

બુદ્ધિ યોગભાગ

હેઠળ ગંથમાળા॥

3023

દાદરાસાસા, લાયનગર.
ફોન : ૦૨૬૮-૨૪૩૧૩૨૨૨
૩૦૦૩૮૮૬

શ્રી

રાસ માળી

ભાગ ત્રીજો.



રચયિતા:—

મુનિ રામચંદ્રા (કંઈ)

॥ અંગ્રેસ ॥

સુ. આચાર્યશ્રી કર્મસિંહજી સ્વામી-રમારક

શાસ્ત્રમાળા : માલુકો ઉ૭-૮ મે.

શ્રી

જૈન રાસમાળા

ભાગ ઉંબે

રચયિતા:-

મુનિ રામચંદ્રજી (કૃષ્ણી)

પ્રકાશક

કૃષ્ણવાંકીના રહીશ શાહ વજપાર હીરજી તથા
હીરજી મૌણ્યશરીની આર્થિક સહાયથી—

જીવનલાલ છગનલાલ સંઘવી
પંચલાઈની પોળ, અમદાવાદ.

આવૃત્તિ ૧ લી

પ્રત ૫૦૦

ધ. સ. ૧૬૪૬

સ. ૨૦૦૨

ધી નવપ્રેલાત ગ્રિન્ટીગ પ્રેસમાં શા. મહેનીલાલ છગનલાલે છાયું.

ડે. ધીકાંઠા રેડી : અમદાવાદ.

અર્પણપત્રિકા

સ્વર્ગસ્� આચાર્ય ભગવાત્

ગુરૂદેવ શ્રી કુર્મસિંહજી સ્વામિનું !

આપ મહારા અગ્રાધ ઉપકારી છો. આપે મને રત્ન-
ત્રયીની પ્રતીતિ કરાવીને તથા લાગ્યવતી લાગવતી પવિત્ર
દીક્ષા આપીને, મહારા જીવનને ઉજ્જ્વલ બનાયું. આપશ્રીજીના
સમીપમાં રહી અદ્વિતીય સ્તુત સેજીયું. કે જાનની પ્રસાદી
વડે મહારી અદ્વિતીય ધર્મ અને સત્યના વિષય ઉપર,
કથા રૂપે ગુર્જરગિરામાં આ રાસની રચના કરી આપશ્રીના
અસીમ ઉપકાર રૂપ ઋષ્યશ્રી મુક્ત થવા આપશ્રીના અમર
એવા આત્માને વિનાનું લાવે આ પુસ્તક અર્પણ કરી મહારા
આત્માને કૃતકૃત્ય માનું છું.

વીર સં. ૨૪૭૨
કૃત્ય શુદ્ધ પ ગુરુ
છસરા-કચ્છ } }

આપશ્રીનો સનાતો ઋષિય
શિષ્ય રામચંદ્ર

વિજયપતાકા



ર પ ર

દા ખો ર્ણ ખા દા

શ્રી ષ્ટુ દા ખા દા ષ્ટુ શ્રી

શ્ર્વ્ય પા શ્રી દા દા ષ્ટુ શ્રી પા શ્ર્વ્ય

ના ના શ્ર્વ્ય પા શ્રી ષ્ટુ શ્રી પા શ્ર્વ્ય ના થા

શુ ય થા ના શ્ર્વ્ય પા શ્રી પા શ્ર્વ્ય ના થા ય શ

ષ્ટુ ર શુ ય થા ના શ્ર્વ્ય પા શ્ર્વ્ય ના થા ય શ ર ષ્ટુ

મઃ મ ષ્ટુ ર શુ ય થા ના શ્ર્વ્ય ના થા ય શ ર ષ્ટુ મ મઃ

ના

ભાગ-	થા	આ ભાગ નિત્ય પ્રત્યે
------	----	---------------------

ષ્ટુ શ્રી પાશ્ર્વ શરષ્ટુ	ય	જપવાધી આત્મીક
--------------------------	---	---------------

મમઃ	શ	શાન્તિ મળે છે.
-----	---	----------------

સં. ૨૦૦૨ ના	ર	ચોજક-
-------------	---	-------

અક્ષયતૃતીથા. શ્રુક	ષ્ટુ	ગુનિ રામચંદ્ર.
--------------------	------	----------------

મ

મઃ

વિજયપતાકા



ચોજક-

પુ સં. ૨૦૦૨ ના ફાલગુન

મુનિ રામચંદ્રજી શ્રી જ્ય શ્રી વહ ૨ મંગળવાર.

મ ક શ્રો ક મ કુચછ-છસરા.

હ સિં મ ક મ સિં હ

સ્વા જ હ સિં મ સિં હ જ સ્વા

લ્યો મિ સ્વા જ હ સિં હ જ સ્વા મિ લ્યો।

મો ન લ્યો મિ સ્વા જ હ જ સ્વા મિ લ્યો ન મો।

મઃ ન મો ન લ્યો મિ સ્વા જ સ્વા મિ લ્યો ન મો ન મઃ

સ્વા

આચાર્યશ્રી મિ કર્મસિંહજીસ્વામી.

જનમ સં. ૧૮૮૬ વાંકી લ્યો દિક્ષા સં. ૧૬૦૪ સિદ્ધપુર

ન

આચાર્યપદ સં. ૧૬૫૮ મો અવસાન સં. ૧૬૬૯

માંડવી.

ન

મુંદ્રા.

મઃ

વિજયપતાકા



થોડક-

પુ સં. ૨૦૦૨ ના ફાલગુન

સુનિ રામચંદ્રજી

શ્રી જય શ્રી વદ ૨ મંગળવાર

ગ ના શ્રી ના ગ કુચેછ-છસરા.

દ ચં ગ ના ગ ચં દ

સ્વા જી દ ચં ગ ચં દ જી સ્વા

લયો મિ સ્વા જી દ ચં દ જી સ્વા મિ લયો

મો ન લયો મિ સ્વા જી દ જી સ્વા મિ લયો ન મો.

મઃ ન મો ન લયો મિ સ્વા જી સ્વા મિ લયો ન મો ન મઃ

સ્વા

આચાર્યશ્રી-

મિ નાગચંદ્રજીસ્વામી.

જન્મ. સં. ૧૯૩૬ લોલય

લયો દિક્ષા સં. ૧૯૪૭ લાઠી

શુવાચાર્ય. ગદ સં. ૧૯૮૪

ન આચાર્યપદ સં. ૧૯૯૨

મુંદા.

મો માંડવી.

ન

મઃ

વિજયપતાકા



ચોજક-

મુ

સં. ૨૦૦૩ ના ફાલઘૂર

મુનિ રામચંદ્રજી

મ નિ મ

વદ ૨ મંગળવાર

રા હા મ હા રા

કચેઠ-છસરા..

શ્રી જ રા હા રા જ શ્રી

ણે મા શ્રી જ રા જ શ્રી મા ણે

ચં ક ણે મા શ્રી જ શ્રી મા ણે ક ચં

જ દ ચં ક ણે મા શ્રી મા ણે ક ચં દ જ

મિ સ્વા જ દ ચં ક ણે મા ણે ક ચં દ જ સ્વા મિ

પ્રશાશિત શ્રી- ણે માણેકચંદ્રજીસ્વામી

જન્મ. સં. ૧૯૪૦ લોકાય. ક દિક્ષા સં. ૧૯૫૪, દુષ્ટી

અવસાન. સં. ૧૯૬૩ ચં દિ. મુનિ રામચંદ્રજી

લોકાય

દ

જ

સ્વા

મિ

રાસ કર્તાની દુંક જીવન-પરિથય.

~~~~~

આ રાસના કર્તા સેવાલાની મુનિ મેહારાજ શ્રી રામચંદ્રજી સ્વામી છે. તેમનો દુંક જીવન-પરિથય વાચેક વંદને કરાવનાની જરૂર છે. તે હેતુથી લખવાની ધર્મિણ થાય છે.

તેઓએ કર્દે દેશના કંઈ વિલાગમાં એક સુંદર ગામ શ્રી પત્રીના વતની છે. આ જામમાં વીશા ઓદ્ધિવાળ શાતિના નૈમ ધર્મ પાળતા ગૃહસ્થેનાં ખરો સારી સંખ્યામાં છે. તેમાં જૈન યોગાંબર સ્થાનકર્વાસી, આડ ડેડી મહોટા પક્ષના અનુસારી, છેડા અવટર્ની, શાહ શિવજી હુરશી વસતા હતા. તેઓ સ્વભાવે લોળા, અદ્વિતી અને સનજનતાના શુદ્ધિનાના હતા. તેમની ધર્મપત્રી માંકુઆઈ હતા. જેઓ કસેલા થરીર-વાળા, કામની આવડતવાળા અને ધર્મશીલ હતા.

શિવજી શાહ મુંઅષ્ઠમાં દાખુની વખારમાં સ્વતંત્ર ધર્ઘો કરતા હતા. પ્રમાણિકતાપૂર્વક ધર્ઘામાં ઢીક આગળ વધ્યા હતા. તેમને કાર્ય નામે એક મહોટા પુત્ર હતો. ત્યાર પછી સં. ૧૯૪૭ ના બાદરવા શુદ્ધ જ ને શુદ્ધવારના રોક્ટે તેમને ત્યાં મુંઅષ્ઠમાં જ ભીજ પુત્રનો જરૂર થયો. જેનું નામ રલસિંહ પાડવામાં આવ્યું. તેનું પાલન માતાપિતા અનિ ડોડથી કરેતા હતી.

કાળની ગતિ અતિ ગહુન છે. એ પુત્ર સાતે વર્ષનો થતાં તેના પિતાશ્રી શિવજી શાહ મુંઅષ્ઠમાં ખેગમાં સપ્તાધની સ્વર્ગવાસી થયા. આ વખતે તેમના ધર્મપત્રી માંકુઆઈ ગામશ્રી પત્રીમાં રહેતા હતા. અશુધ્ધાર્થી પતિના અવસાનના આ અશુલ સમાચાર સાંભળી તેમના મનને આરે આધાત થયો, પરંતુ કાળની ગહુન ગતિ આગળ ડોધનું બળ-જેર ચાલતું નથી. આમ મનને શાંત કરી પુત્રોમાં જ સુખની આશા રાખી સમય પણાર કરવા લાગ્યા. નહાના પુત્ર રલસિંહને

ગામમાં આલતી નિશાળમાં ભણવા મોકદ્વા લાગ્યા. ગુજરાતી પાંચ ધોરણુનો અભ્યાસ રતનસિંહ પૂરા કર્યો.

રતનસિંહ પૂરા પંદ્ર વર્ષની ઉભરે પહોંચતાં પુત્ર વત્સલ માતા પણ આશાલયાં સ્વર્ગવાસી થયા. આ બનાવથી રતનસિંહના હૃદયમાં અત્યંત હુઃખ થયું અને સંસાર તેને અકારો થઈ પડ્યો. સંસારમાં સંયોગ અને વિયોગ મનુષ્ય ઉપર કેવા આવે છે? અને સંસાર કેવો સ્વાર્થી છે? તેના અવાર નવાર રતનસિંહને અનુભવો થવા લાગ્યા.

સં. ૧૯૬૭ ની સાક્ષમાં પત્રી ગામના શ્રી સંઘની અન્યાયહંસી ચાતુર્માસની વિનંતિ થતાં આચાર્ય ગુરુદેવ શ્રી કર્મસિંહજી સ્વામી હા. ૫ થી ચાતુર્માસ અનિરાજન્યા. આ ગુરુવર્ય શ્રી સંસાર પક્ષના રતનસિંહના હાદાના કુદુર્યી હતા. જેથી રતનસિંહભાઈ પણ ધર્મગ્રથાનકમાં ગુરુવર્ય પાસે આવજાવું કરવા લાગ્યા. પૂર્વનાં શુભ કર્મના ઉદ્દેશ્યે સાધુ-સમાગમ પ્રિય લાગ્યો અને તેમની પાસે ધાર્મિક પ્રાથમિક અભ્યાસ-સામાયિક-પ્રતિક્રિમણ વગેરેનો કર્યો. ચાર માસના ગુરુદેવના સમાગમથી ધર્મભાવનાની ખૂબ જાગૃતિ, સંસાર પ્રત્યે ઉદ્દાસીનતા અને આગવતી દીક્ષા લેવાની અભ્યાસ છુટ્ટા થઈ. એ લાવના ગુરુશ્રીને જણાવી. તેમની યોગ્યતા જણ્ણી ગુરુશ્રીએ પણ સહાતુભૂતિ દર્શાવી. જેથી ચાતુર્માસ પૂર્ણ થતાં સાંસારિક કેટલાંએક કાર્યો પતાવી રતનસિંહભાઈ ગુરુશ્રી સાથે રહી ધાર્મિક-શાસ્ત્રીય અભ્યાસ કરવા લાગ્યા. સવા વર્ષ ગુરુ સમીપે રહી કેટલુંક શાન મેળાયું. ત્યારપણી મુંઅધ વસતા પોતાના વહિલ બંધુ કારલાઈ પાસેથી રૂખરમાં દીક્ષા લેવાની સંપૂર્ણ સમ્મતિ મેળવી. તેમજ પત્રી ગામમાં વસતા પોતાના સગા ન્હાલાઓની શાંતિથી અનુત્તા મળતાં પત્રીના શ્રી સંઘે આચાર્ય ગુરુદેવ શ્રી કર્મસિંહજી સ્વામી વિગેર મુનિરાજેને તેડાવી સં. ૧૯૬૮ ના ફાગણું શુદ્ધ ઉં ને ખુખ્ખવારે ભાઈ રતનસિંહની દીક્ષાનો પૂર્ણ ઉત્સાહથી ખૂબ મહોત્સવ કર્યો. પૂજય ગુરુવર્યશ્રીએ ભાઈ રતનસિંહને દીક્ષા આપીને તેમનું નામ રામચંદ્રજ

સ્થાપન કર્યું. આ મહોત્સવ પ્રેસંગે સાધુ-સાધીઓની સારી હાજરી હતી. તેમજ ખારગામનાં પણ ધર્માં સ્વીપુરુષોએ હાજરી આપી લાલ લીધો હતો.

આ વખતે પૂજન ગુરુવર્ષ શ્રી કર્મસિંહજી સ્વામી ૮૪ વર્ષનો વૃક્ષાવસ્થાવાળા હોવાથી પત્રીના શ્રી સંદે સ્થિરવાસ રહેવાની વિનંતિ કરી. પરંતુ મુંડા શહેરમાં પૂજયશ્રીજીના પરમ લક્ષ્ણ દ્વારી માણુકયંદ સાઈ અહુ જ ભિમાર હતા. તેમણે અલિગડ કર્યો કે ‘પૂજયશ્રીજી અને પખારી મને દર્શન આપે તો જ અત્પાણી લેવું.’ આ અલિગડનો સંહેરો મુંડા સંધના નેતા રામજીમાઈ લાલચંડ પત્રી આવીને પૂજય શ્રીજીને સંભળાવ્યો અને મુંડે પખારવાની અતિ આગઢ ભરી વિનંતિ કરી; જેથી પૂજયશ્રીજી ફાલગુન શુદ્ધ ૫ ને શુક્લવારના રોજે લાખાપુર અને ભોરારાના આવક્કાને દર્શન આપી સીધા મુંડે પખાર્યા. જેથી માણુકયંદ દ્વારાને ખૂબ આનંદ થયો અને તેમનો અલિગડ પૂરો થયો.

પૂજયશ્રીજી અવસ્થાના કારણે લાંબો વિહાર થતો ન હોવાથી, નજરનું તેજ ઓછું થવાથી, મુંડા શ્રીસંધની અત્યાગહલરી ના વિનંતિથી અને શિષ્યોની સહાયુભૂતિથી મુંડા શહેરમાં સ્થિરવાસ-રહ્યા. આ પ્રેસંગે મુંડા શ્રીસંદે પૂજયશ્રીજીની સેવા-લક્ષ્ણ અને સમાગમનો અદ્ભુત લાલ લીધો. રામચંદ્રજી મહારાજની બીજી મહોદી દીક્ષા પૂજય-શ્રીજીની હાજરીમાં મુંડા શહેરમાં થાહ નથુ કર્મસિંહના ધર્મપત્ની માંકુભાઈએ ઉત્સાહપૂર્વક ખર્ચેલ દ્વયથી અને ત્યાંના શ્રીસંધની ઉત્તમ લાગણીથી થઈ.

ત્યારપણી ચાતુર્માસનો કાળ નજીક આવતાં રામચંદ્રજી મુનિને પડન પાડન કરાવવા માટે પ્રગાશિક મહારાજ શ્રી માણુકયંદજી સ્વામીની સાથે ચોમાસું પત્રી ગામે રહેવાની પૂજયશ્રીજીએ આગા આપી. એટલે ત્યાં રહી જુદ્ધ અનુસાર ખંતથી ગાનનો અભ્યાસ કરવા લાગ્યા. પાછળથી પૂજયશ્રીજીને બીજા આપાઠ શુદ્ધ ૧૫ ના દિવસે ગુર્દાનો

વ्याखि थयो. श्रीसंघे अनेक उपायो कराववा छतां व्याखि शम्यो नहि. एटले पूज्यश्रीजुगे व्याखि असाध्य नाणीने अनशन नत आर्थु. साथेना शिष्योगे आराधना कळवी अने सिद्धांतोनु श्रवणु कराव्यु. भीज आषाढ वटी ૪ નा हिवसे व्याख्याए ज्ञेर कर्यु, एटले पत्री गाममां विराजता मહाराजश्री माणुक्यदल સ्वाभाने तेऽवा मक्षुद माणुस श्रीसंघे मोक्षाव्यो, पરंतु तेमने माटे गुड्हेवनां अंतिम दर्शन थवानुं सर्वांयु न होवाथी आषाढ वटी ૫ ने शनिवारना प्रभातमां सात वागतां पूज्यश्रीજु समाधिलावे ऐ हिवसनुं अणुसंखु पूर्णु करी स्वर्मवासी थया. माणुक्यदल महाराज तथा रामयदल महाराज पत्रीथी विहार करी सीधा ૧૧ वांगे मुंद पधार्या. गुड्हवर्यश्रीजुना अवसानना समाचार सांखणी लारे आधात थयो. तेमજ આ बनावर्थी सकળ यतुर्विध संबने पणु धर्णો. ऐદ थयो, परंतु लाविलाव आગળ ડाईनुं ज्ञेर चालतुं नदી. गुड्हेवनो निर्वाणु महोत्सव श्रीसंघे लव्य समारोहपूर्वक कुर्यो अने तेमनी मांडवीनुं खड्हुं खर्च मुंदा निवासी शाह नयु कर्मसिंहनी धर्मपत्नी मांडुआઈगे आएयु हતु. माणुक्यदल महाराज ऐ हिवस मुंदे रोकाईने पाणा रामयदल महाराज साथे पत्री आव्या अने पत्रीनुं आतुर्मास पूर्णु करी त्यांचो विहार कुर्यो.

रामयदल महाराज माणुक्यदल महाराज साथे रહी सज्जेनुं वांचन करवा लाग्या. સं. ૧૬૭૫ ની સालમાં રત्नयदल 'મુનિની દીક્ષા' થया ખाद ઘેળનિષ શ્રી ત્રિલોકયદશ્રવાની સाथે કાઢિયાવાડ તરફ પधार्या. તेमनી સाथે રહી રामयदल મહारાજે રાજકોટ, માંગરીલ અને પોરબંદરના આતુર્માસોમાં થોકડા, સજ્જો અને સંસ્કૃતનું સારે ગાન મેળવ્યું. ત્યાર પછી માણुક्यદશ્રવાની સાથે પાણા કર્યામાં પધાર्यા. અને ઘેળનિષ શ્રી ત્રિલોકયદલ મહाराज ભીજ મુનિયો. સાથે ઝનજરાત તરફ પધાર્યા. રામયદલ મહારાજ માણુક્યદલ મહારાજ સાથે કર્યા દેશમાં વિચરવા લાગ्यા અને જૈન સાહિત્યનો અભ્યાસ ને વાંચન કરવા લાગ્યા.

સં. ૧૬૮૮ ની સાલમાં મહારાજશ્રી માણુકયંડજીસ્વામીના પગમાં કંડાકરા ગામે ભયંકર જમરાનો વ્યાધિ થયો. આ વખતે તપસ્વી શ્રીકૃપણજીસ્વામી, મહારાજ શ્રીરામચંદ્રજીરવામી તેમજ આર્યાજ ઐમદુંવરથાઈએ અનન્ય ભાવે તેમની સેવા બળવી હતી. આ વખતે પૂજયશ્રી નાગચંદ્રજીસ્વામીને રતનચંદ્રજી સુનિ તથા છોટાલાલજી મુનિને સાથે લઈ સાધુ સમેલન પ્રસંગે અજમેર જવું પડ્યું. બામ શ્રી કંડાકરાના ગ્રાસીઆ ગ્રેમસંગજીના દેશા ઉપચારોથી જમરાનો વ્યાધિ તો શાંત થયો, પરંતુ તેનો પિકાર આખા શરીરમાં પ્રસરી ગયો અને શરીરમાં સોઝો રહેવા લાગ્યો. રામચંદ્રજી મહારાજ અદીનભાવે સહૃદાવપૂર્વક તેમની સેવાનો અલઘ્ય લાભ લેતા થકા તેમની આનુદ્રોગતાએ થોડો થોડો વિહારે કરવા લાગ્યા. આ વખતે તેમની સેવા ઉપરાંત નિવૃત્તિનો સમય મેળવી દાન અને અઠલ અદ્ધા ઉપર લખિતાંગ કુમરનો રાસ રામચંદ્રજી મહાસંજે પ્રથમ પ્રયાસ રૂપે બનાયો.

સ. ૧૬૮૨ ની સાલમાં પૂજયશ્રી નાગચંદ્રજીસ્વામીનો માંડળી શુદ્ધેરમાં પૂજય પદ્ધતિનો મહોત્સવ થઈ રહ્યા પછી માણુકયંડજી મહારાજ વિહાર કરી અનુકૂળે અભાસા પ્રાંતમાં શ્રી ભોજય ગામે પધાર્યો. ત્યાં મૂળ દરહે વિરોષ જોર કર્યું અને શરીરમાં સોઝો વધ્યો. જેથી ભોજયના શ્રીસંદે તેમની સેવાનો લાભ લેવા માટે ત્યાં રહેવાની અતિ આગ્રહ-પૂર્વક વિનંતિ કરવાથી ત્યાં રોકાયા અને ચાતુર્માસ પણ ત્યાંજ કર્યું. ખૂબ ઉપચારો કરવા છતાં વ્યાધિ અસાધ્ય થઈ જવાથી ઝોર્ઝ ઉપાય લાગ્યું ન પડ્યો. છેવટ સં. ૧૬૮૩ ના મહા વહી રૂ ના રોને સમાધિ-ભાવે કાળધર્મ પાણ્યા. આ પ્રસંગથી રામચંદ્રજીસ્વામીના દુદ્યમાં અસહ્ય આધાત થયો. તેમજ શ્રીસંધને પણ અતિ બેદ થયો. આ વખતે પૂજયશ્રી નાગચંદ્રજીસ્વામી વાંકી તરફ હતા. તેમને સમાચાર મળતાં ઉતાવળો વિહાર કરી ભોજય પધાર્યો. ત્યાર પછી રામચંદ્રજી મહારાજ પૂજયશ્રીજી સાથે વિચરવા લાગ્યા.

‘ માણુકયંડજી મહારાજે પોતાની હૈયાતીમાં રામચંદ્રજી મહારાજને

એક વખત કહેલ હતું કે ‘ઔત્પાતિકી યુદ્ધ અને સત્યના માણાતમ્ય ઉપર અમરદાત અને કસ્તૂરીની કથા અતિ સુંદર છે. તેના ઉપર ગુજરાતી ભાષામાં ઢાળ રૂપે રાસ બનાવાય તો સમાજને ઉપરોક્ત દેવામાં ઉપરોગી બને, આ વાત લક્ષ્યમાં રાખી સાં. ૧૯૯૭ ની સાલમાં અંનર શહેરમાં ચાતુર્માસ રહી અમરદાત અને કસ્તૂરીનો રાસ બનાવી પૂર્ણ કર્યો. આ અને લલિતાંગ કુમરનો એ બને રાસની તૈયાર થયેલી પ્રેસ ડ્રાપી મુનિ રતનચંદ્રલુએ શુદ્ધ કરી આપી. એ રાસો છપાવવાની છંચિણ હતી, પરંતુ કાગળની અતિ મોંધવારીને લઈ એ વિચાર તરતને માટે અંધ રાખ્યો. એઠામાં સાં. ૨૦૦૨ ની સાલનું છસરાનું ચાતુર્માસ પૂર્ણ કરી રામચંદ્રલુ મહારાજ હા. તુ વાંકી પધાર્યા. લાંના વતની ધર્મગ્રેમી, ઉદાર વૃત્તિવાળા ભાઈ વજપાર હીરલુને પોતાના પૌત્રની જન્મ ખુશાલી અર્થે તથા લાઈ હીરલુ મોણુશીને પોતાની સ્વર્ગસ્થ જહેન લીલાશ્રાદ્ધના પુણ્ય સ્મરણાર્થે ફૈન સમાજને ઉપરોગી થાય એવું એક પુસ્તક છપાવી પોતાના સ્વર્ગમાં બંધુઓને લેટ આપવાની ભાવના થઈ અને એ વાત મહારાજ શ્રી રામચંદ્રલુ સ્વામી પાસે કહી. એટલે તેઓશ્રોણુએ લખી તૈયાર રાખેલ એ રાસોનું મેટર તેમને પ્રસિદ્ધ કરવા માટે આપ્યું. એ રીતે ર્ધી રાસ પ્રગટ થવા માનેલ છે.

આ રાસનું ચાતુર્વિધ સંધ પડન પાડન કરી પોતાના જીવનમાં ઉત્તારી જીવનને ઉજાવળ બનાવે તો લેખકનો લેખન પ્રયાસ સર્કણ અને આર્થિક સહાયદાતાના દર્યનો સહદ્ય્ય થયો ગણ્યાય. આ વાખત વાચકવૃદ્ધ લક્ષ્યમાં રાખે ગેવી લેખક, પ્રકાશક અને સંપૂર્ણ આર્થિક સહાયદાતાની આંતરિક ભાવના છે. ધ્રત્યલમ.

સાં. ૨૦૦૨ ના આવણ-  
શુક્લાષ્ટમી.

લિ. શુભેચ્છા-  
સંધવી જીવસુલાલ છગનલાલ.  
અમદાવાદ.

## પ્રસ્તાવના

મિય વાચકવૃંદ !

આજે 'નૈન રાસમાળા ભાગ તીજે' નામનું નૈન ધર્મને લગતું આ રાસ પુસ્તક પ્રગટ થાય છે. આ પહેલાનાં એ લાગો જેઓએ વાંચ્યા હશે તેઓને કંઈ પ્રદેશના રાસ શોખીન મુનિઓની કવિત-શક્તિ, રાસ યોજના, તીક્ષ્ણ ખુદ્ધિતા અને વિદ્વત્તાની પ્રતીતિ થઈ હશે; એટલી જ પ્રતીતિ પ્રસ્તુત રાસની ભાવવાહી યોજના યોજનાર મુનિશ્રી રામચંદ્રજી મ.ની રચના વિષે થશે એમાં અમને શંકા નથી. અમારે કહેવું જોઈએ કે પ્રસ્તુત રાસમાળાના બંને રાસોની રચના અનુપમ, સુંદર અને ભાવવાહી ભાવનાઓથી ભરપુર છે તેમજ સાદા વાક્યો, સાદી દાઢો અને સૌ ડાઈને કંઠરથ થઈ શકે તેવા દોહરાઓથી ઘનાવેલ છે.

નૈન સમાજમાં-અને તેમાંયે સ્થાનકવાસી નૈન સમાજમાં-કે જે સમાજમાં બ્યોરના બ્યાખ્યાન વખતે 'રાસ' વાંચવાની ખૂબ જ ગ્રથા છે તે સમાજમાં સ્થા. નૈન વિદ્વાનોના બનાવેલા રાસો સમાજમાં ઉપલબ્ધ નથી એ એક આશ્ર્યની વાત છે. વળી વિશેષ આશ્ર્યની વાત તો એ છે કે જે મૂર્તિપૂજાક સમાજમાં રાસ વાંચવાનો રિવાજ સ્થાનકવ સી સમાજ જેટલો પ્રયત્નિત નથી તે સમાજમાં મોટી સંખ્યામાં રાસો પ્રગટે, અને તેનો લાલ સ્થા. નૈન સમાજ લ્યે એ આપણા સમાજની એક મોટી ઉણુપ ગણ્યાય. જે રાસો મૂર્તિપૂજાક સમાજ બનાવે અને જેમાં સ્વાભાવિક રીતે જ સમાજને મૂર્તિપૂજાને પણે લઈ જનારી વસ્તુઓ જ પીરસાય, તે રાસોના આધારે બૃહ્દ સ્થાનકવાસી સમાજ પોતાનું બ્યોરના બ્યાખ્યાનનું નાવ હંકારે એ તો ખરેખર એદાજનક ખીના છે.

આ મેંટી અને હંમેશની તુટી દૂર કરવા મુનિશ્રી રામચંદ્રજીએ અને અન્ય કંઈ મુનિઓએ છેલ્લા કેટલાક વર્ષોથી રાસ-યોજના

કરતા માંડી છે તે ખરેખર પ્રશ્નસનીય અને વર્તમાન તથા આવિષ્યની સ્થા. જૈન જનતા માટે આર્થિક સમાજને

અમે તો છચ્છીએ છીએ કે, મુનિશ્રી પોતાની આ શક્તિનો હરહેશ આ માર્ગ જ સહિત્ય કરતા રહે તો, સ્થા. જૈન સમાજને 'રાસ' રૂપ એક મેટો સાહિત્ય વારસો કાયમના વાંચન માટે મળી રહે.

અને જે સહગૃહસ્થોએ આ રાસ-સાહિત્યના વિકાસ અને ઉત્તેજનાર્થી પોતાના દ્વારા સહિત્ય કર્યો છે તે વ્યય એટલું જૈન સમાજના ગ્રાન-ઉત્કર્ષનો હોઈ એટલી જ પ્રશાંસા મળી રહ્યે છે.

આ પુરતકમાં ૧ અમરહાત-કસુરીનો અને ૨ લલિતાંગ કુમારનો-એમ એ રાસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલો રાસ ધર્મ સંભારથી સિંચિત, પતિલક્તા એવી કસુરી નામક આવિકાની વિચિક્ષણ ખુલ્લિનો ખ્યાલ આપવાની સાથે સાથે સત્યનું મહાત્મ્ય ડેવું હોય છે તે બતાવવામાં આગ્યું છે જેથી જનતા હેઠાં સત્યનો જ આગ્રહ રાખી નીતિ, ન્યાય અને સત્યને રસ્તે વિચરી પોતાના જીવનનો ઉત્કર્ષ સાધી શકે.

થીન રાસમાં દાનધર્મ અને ધર્મઅદ્ધારું હુઅહુ વર્ણન કર્યું છે જેથી જનતા તે સન્માર્ગે પોતાનું જીવન વિતાવી આત્મકાંદ્યાણું કરી શકે.

આમ કથા ઇપે, સુંદર રાગ-રાગણીથી ગોધ અપાયેલો હોવાથી આ રાસ-પુસ્તક સૌ ડોઈ વાચકને એટલું જ પ્રિય, એટલું જ આકર્ષણીને એટલું જ મનનીય ફલિત થશે એમાં શાંકા નથી.

ગધ ચરિત્ર વાંચવાની અપેક્ષાએ સુંદર હાળો અને અદ્દકારાથી યોગ્યેલ પદ્ધયચરિત્ર વાંચતા, તે વિષયના શોભીનોને ખૂબ જ આનંદ આવે છે તેમાં શાંકા નથી.

અંતમાં, આપણા મુનિરાજે આવા રાસોનો ઉપયોગ કરી શાવક અને આવિકા વર્ગ પર ધર્મભાવનાની છાપ પાડરો એ વિનંતી અને આશા સાથે મહારે આ સંક્ષિપ્ત પ્રસ્તાવ-કાર્ય પૂર્ણ કરું છું.

શાવણું શુક્લ પૂર્ણિમા. • }      જીવનજીલ સંઘર્ષી.  
૨૦૦૨; અમરાયાદ.

## એતપાતિકી બુદ્ધિ અને સત્યનું માહાત્મ્ય દર્શાવું અમરદાત-કસ્તુરીનો રાસ

૫

રચયિતા:-

સ્વ. આચાર્યશ્રી કર્મસિંહલસ્વામીના શિષ્ય-  
ભુનિ રામચંદ્રજી (કંઈ)

દન્ય સહાયક:

કંઈ-વાંકીના રહીશ શાહ ગાંગળભાઈ વજપારના  
દેર સં. ૧૯૯૬ ના પેષ સુદ દ શુક્રવારે  
૧૧ વાગ્યે, પુત્ર લક્ષ્મીચંદ્ના જન્મની  
ખુશાલીમાં આ રાસ શાહ વજપાર  
હીરળાએ છપાણી સ્વધમી બંધુઓને  
લેટ કરેલ છે.

ॐ श्री वीर !

## પ્રાર્થના.

રાગ-કલ્યાણની ધૂન.

|                                                                |             |
|----------------------------------------------------------------|-------------|
| શ્રી વીર ! ઓં શાંતિ શાંતિ કરો. એ ટેક.                          |             |
| આનંદ ઉત્સાહ શુભ પ્રવૃત્તિ,<br>વિશ્વજનેમાં લાવી ધરો.            | શ્રી વીર. ૧ |
| ચાદશ જીવન તાદશ પ્રાસિ,<br>સ્વર્ગીય જીવને સદા વિચરો.            | શ્રી વીર. ૨ |
| મનુષ્ય જન્મમાં સુર સુખ ચાખો,<br>કર્તાવ્ય સત્યરીલતા લાવી લરો.   | શ્રી વીર. ૩ |
| પૂર્વ સત્પુરુષોના પુષ્ય પગે ચાલી,<br>અમર કીર્તિમાં ઉત્સાહ ધરો. | શ્રી વીર. ૪ |
| પુષ્યાત્મન ! પુષ્ય પંથે પ્રવૃત્તો,<br>મિથ્યા દંલને ફૂર હરો.    | શ્રી વીર. ૫ |
| અનંત આનંદ ને શાંતિ સુખ પામો,<br>સદ્ગર્મે સત્કર્મે સુદશ્તા વરો. | શ્રી વીર. ૬ |

રચયિતા—સ્વ. ચોગનિષ્ઠ  
શ્રી ત્રિલોકચંદ્રજી મહારાજ.



સદ્ગુરૂભ્યો નમ:

દુઃખ જિનાય નમ:

## અમરદાત-કસ્તૂરીનો રાસ.

દાહુરા

|                                              |   |
|----------------------------------------------|---|
| આદિનાથ આદે દઈ, પ્રણભુમું જિનવર પાય;          | ૧ |
| મનવંછિત સુખ સાંપડે, આપદ દૂર પલાય.            |   |
| નાલિરાય કુળાં ચંદ્રોનો, માર્દ-હેવાનો નંદ;    | ૨ |
| યુગલા ધર્મ નિવારીને, વર્તાંયો આનંદ.          |   |
| જિન વાણી રૂપ ૧ભારતી, કવિજન કેરી માય;         | ૩ |
| પદ્મકઞ્ચ તેહનાં પ્રણભીને, કરે કવિતા ઉલ્લસાય. |   |
| ગૌતમ ગણુહરં શુણુધર, પ્રણભું તેહનાં પાય;      | ૪ |
| અંગુઠે અમૃત વસે, હુઃખ દાહુગં સહુ જાય         |   |
| સદ્ગુર પદ્મપંકજં ૫ નમી, તેહ તણે સુપસાય;      | ૫ |
| પુષ્ટયવંત શુણ વર્ણાંદું, આણી મન ઉમાય.        |   |
| અથ પુષ્ટય ઉપર કહું, અમરદાત અધિકાર;           | ૬ |
| સાંભળનો સ્નેહ કરી, થાએ જય જયકાર.             |   |
| આગસ નિદ્રા પરહરી, વિકથાને વિખવાદ;            | ૭ |
| ઉઘે તે સુધે મહીં, ન મળે શ્રવણું સ્વાદ.       |   |
| કથા સરસ શ્રોતા સરસ, વક્તા સરસ ને હોય;        | ૮ |
| તો રસ આપે એ કથા, શિર ધૂણે સહુ કોય.           |   |

૧ સરસતી. ૨ ચરણુ રૂપી કમળ. ૩ ગણુધર. ૪ દુર્લભીય-  
વિયોગ વિગેરની ચિંતા. ૫ કમળ. ૬ પૃથ્વી. ૭ સાંભળવાનો.

માટે સ્નેહ સાંભળો, સ્થિર કરી મન વચ્ચે કાય;  
રસ પ્રપૂરિત એ કુથા, સાંભળતાં સુખ થાય.

૯

### ઢાળ ૧ લી

[ દેશ મનોહર માળવો—એ દેશી. ]

જંબૂદ્વીપ લખ જોયણો, ખટ્ટે ખંડે અલિરામ; લવના.  
ગંગા સિંહુ વैતાદ્વથી, ખંડ થયા ખટ આમ. લવના.

સ્નેહલ થઈ શ્રોતા ! સુણો. ૧

મધ્ય ખંડે શોલતો, રૂડો દેશ કલિંગ; લવના.

ગિરિઓ સરિતાથી<sup>૧</sup> ઓપતો, સર્વ દેશમાં ઉત્તંગ. લવના. ૨

પાટ નગર તે દેશનું, કંચન પુરવર સાર; લવના.

ધન ધાન્યે કરી પૂરીયું, સુખીયા સહુ નર નાર. લવના. ૩  
તે નગરીનો રાજુયો, જિતથનું વર ભૂપ; લવના.

રાજ્ય ગુણે કરી રાજતો, સમૃદ્ધિવંત અનુપ. લવના. ૪

તે નૃપની પૃપટરાગિણી, ધારિણી નામે પ્રધાન; લવના.

ધર્મી સફુગુણુ ધારિણી, નૃપ વિશ્વાસનું સ્થાન. લવના. ૫

વાર્ષ અઠાર તિંડાં વસે, કરે વણિજ વ્યાપાર; લવના.

ધર્મ કર્મ જીમાચરે, નહિ વ્યસનનો પ્રચાર. લવના. ૬

નગરશોઠ તે પુર તથો, સાગરદાત ધંશ્યુ નામ; લવના.

અનુપમ અંગના<sup>૨</sup> તેહની, લક્ષ્મી નામે ઉદ્ધામ. લવના. ૭

સુખલર રહેતા દંપતિ, જતો ન જાણે કાળ; લવના.

દાન પુષ્ય કરણી કરે, હુસ્થિત<sup>૩</sup> જન પ્રતિપાણ. લવના. ૮

૧ ભરેલ. ૨ છ. ૩ પર્વત. ૪ નદીથી. ૫ પરાણી. ૬ ઝો.

૭ દુઃખી.

પણ १ સંતતિ નહિ તેહને, તેથો રહેતા ઉદાસ; લવના.  
 એ જગ મોટી મોહિની, સહુજન આશા દાસ. લવના. ૬  
 એકદા ઉદાસી નારીને, રલાળીને કહે શેઠ; લવના.  
 પુત્ર પૈસો મળે પુષ્યથી, ન મળે ચિંતાએ નેઠ. ૭ લ. ૧૦  
 જો તુજ પુત્રની વાંચના, તો કર તપ ઉપવાસ. લવના.  
 દાન ઉદ્દિષ્ટ ધરી આપતાં, પૂરણ થાશે આથ. લવના. ૧૧  
 તહુત કરી પતિ વચનને, ઉદ્દિષ્ટ ધરી કરે ધર્મ; લવના.  
 શ્રદ્ધાવંત પ્રાણી તણું, ત્રુટે અંતરાય કર્મ. લવના. ૧૨  
 સુખભર સૂતી એકદા, ૪ સુહણું દીકું અલિરામ; લવના.  
 ૫ અમરવિમાન હેઠી કરી, જાગૃત થઈ સા નામ. લ. ૧૩  
 સેનથી ઉઠી કરી, વીનવીચો ભરથાર; લવના.  
 સ્વ-બુદ્ધિથી વિચારીને, દેહ નારીને તે વાર. લવના. ૧૪  
 પુત્ર રત્ન તમે પ્રસવશો, કુળ મંડણું આધાર; લવના.  
 ગર્ભ તણી પ્રતિપાલણા, સા કરતી સુખકાર. લવના. ૧૫  
 સવા નવ માસે જનમીચો, પુત્ર રત્ન અલિરામ; લવના.  
 લક્ષણ લક્ષિત ૮ દેહડી, માતા સુખ લહે તામ. લવના. ૧૬  
 ક્રાદ્ધમે ૯ દિન સ્થાપીયું, અમરહત અલિધાન; ૧૦ લવના.  
 ૧૦ પંચ ધાવે પાળી જતો, વૃદ્ધ પામે ગુણવાન. લવના. ૧૭  
 ૧૧ પંચ વર્ષની વચ થતાં, પાડવે ૧૧ પઠનની શાળ; ૧૨ લવના.  
 પુરુષ તણી બહુતેર કંગા, શીએ આણી ન્હાવ. લવના. ૧૮  
 પ્રથમ ઢાળ પૂરી થઈ, આગળ વાત રસાળ; લવના.  
 કર્મન્હુ ગુરુ પસાયથી, રામ કહે ઉજમાણ. લવના. ૧૯

૧ પુત્ર. ૨ જેઠને. ૩ નકી. ૪ હર્ષ. ૫ સ્વભન. ૬ દેવ વિમાન.

૭ શોભાવનાર. ૮ કાયા. ૯ બારમે. ૧૦ નામ. ૧૧ મોકલાવે.  
 ૧૨ નિશાગે.

## દોહરા

|                                                           |  |   |
|-----------------------------------------------------------|--|---|
| અલુક્કમે વધતાં તે થયો, સત્તર વરસનો જામ;                   |  |   |
| ઓહવે પિતરો <sup>૧</sup> અંગમાં, ઉપની વ્યાધિ તામ.          |  | ૧ |
| ઉપચારો અગણિત કર્યા, થયો નહિ આરામ;                         |  |   |
| વ્યાધિ અસાધ્યજી <sup>૨</sup> જાણુને, સંથારો કરે તામ.      |  | ૨ |
| વિધિએ કરી આલોચના, સ્વર્ગતણ્ણાં સુખ લીધ;                   |  |   |
| અમરદત્ત કુમરે તદા, ભરણુ કિયા તસ્ કીધ.                     |  | ૩ |
| વિરહો માતાપિતા તણ્ણો, ખર્ટકે કુમરને મન;                   |  |   |
| મિત્ર કર્મદત્ત તેહને, સમજલવે પ્રતિ દ્વિન.                 |  | ૪ |
| એમ વાસર <sup>૩</sup> વીતાવતો, મિત્ર સંગાતે તેહ;           |  |   |
| નીતિ ન્યાયે ચાલતો, રહેતો સુખલર ગેહ.                       |  | ૫ |
| મિત્ર સમજલવે તેહને, લગ્ન કરો ધરો હામ;                     |  |   |
| ન્રિય <sup>૪</sup> વિષુ ધર શૂનુ કહ્યું, એ વિષુ ન સરે કામ. |  | ૬ |
| અમરદત્ત કહે મિત્રને, એવી ન કહેશો વાત;                     |  |   |
| પરણુવામાં શ્યો સાર છે ?, તે સમજલવો ભાત ! <sup>૫</sup>     |  | ૭ |

## ઢાળ ૨ ૭

[ કપુર હોવે અતિ ઉજલો। ૨-એ દેશા. ]

કર્મદત્ત કહે મિત્રજી ! રે, શું સમજલવું તુજ ?;  
 ગૃહ<sup>૬</sup> સંસાર ચાલે નહિ રે, હજ છો તું અખુજ રે ભાઈ!  
 સાંલળ મારી વાત. ૧

ધ્રાક્ષણુ શ્રમણુ<sup>૭</sup> આવે નહિ રે, નાવે મહી ને મેમાન;  
 વિષુ નારી શોલે નહિ રે, શું આય પુષ્ય ને ઢાન રે ? ભાઈ! ૨

---

૧ માતાપિતાનાં. ૨ કેને કાઈ ઉપાય લાગુ ન પડે તેવો. ૩

દિવસ. ૪ સ્ની. ૫ ભાઈ! ૬ ધર. ૭ સાધુ.

તવ અમરદત્ત એમ જણે રે, વિચારી એક વાત;  
 સંશુદ્ધાની જે ક્ષયામાં મળે રે, તો પરણું હું આત ! રે ભાઈ. ૩  
 વયણું સુષુપ્તિને કુમારનાં રે, મૌન ધરી રહ્યો મિત્ર;  
 એહવે ત્યાં શું નીપનું રે ?, તે નિસુષ્ણો હવે અત્ર રે ભાઈ. ૪  
 તેહ નગરમાંડે વસે રે, કનકદાર એક શેઠ;  
 ધને ધનદર સમાન છે રે, લચ્છીઓ કરે તસ વેઠ રે ભાઈ. ૫  
 કનકમાળા તસ ગેહિની રે, ઇપે આક અમાળ;  
 પતિલક્ષ્મા સાચી સતી રે, સુખમાં વીતાવે કાળ રે ભાઈ. ૬  
 સંસારિક સુખ જોગવે રે, દંપતી પૂરે સ્નેહ;  
 જાતો કાળ જાણે નહિ રે, સુખલર રહેતાં ગેહુરે ભાઈ. ૭  
 કનકમાળાના ઉહરમાં રે, ઉપનો કોધિક લુલ;  
 માતા મન હર્ષિત થઈ રે, વિકસિત અંગ અતીવ રે ભાઈ. ૮  
 ગર્ભની સ્થિતિ પૂરી થઈ રે, પ્રસવી પુત્રી રતન;  
 દૈખી દિદાર<sup>૫</sup> સુખ ઉપનું રે, કરે ધણ્યાં તસ થતન રે ભાઈ. ૯  
 બારમે દિવસે સ્થાપીયું રે, કસ્તૂરી તસ નામ;  
 અનુકૂમે સા વધતી થઈ રે, સાત વરસની જમરે ભાઈ. ૧૦  
 પઠનશાળાએ<sup>૬</sup> પાઠવી રે, કરવા વિદ્યાભ્યાસ;  
 ચતુરાની<sup>૭</sup> ચોસઠ કળા રે, શીખી ધરી ઉલ્લાસ રે ભાઈ. ૧૧  
 કનકમાળા નિજ પુત્રીને રે, શીખવે શુદ્ધ આચાર;  
 ધર્મ કળા પણ શીખવે રે, અંતરમાં ધરી ખ્યાર રે ભાઈ. ૧૨  
 યૌવન વય આવી યદ્દા રે, ખીલ્યાં સંઘળાં અંગ;  
 માતું રંલા ઉરવસીને,<sup>૮</sup> રહેતી સખીયન સંગ રે ભાઈ. ૧૩  
 એકદા કીડા કારણે રે, ઉપવનમાં તે જાય;

૧ ખો. ૨ કુમેર લંડારી. ૩ લક્ષ્મી. ૪ આકૃતિ-ચહેરો. ૫  
 કન્યાશાળામાં. ૬ જીની. ૭ ધન્દતી અપચ્છરા. અસરા-ઉર્વશી.

સખીયું ના પરિવારથી રે, દીઠા ત્યાં સુનિરાય રે ભાઈ. ૧૪  
 અતિ હષે સુનિરાયને રે, લક્ષ્મિ ભર વિનયેણ;  
 નમન કરે ભાવે કરી રે, માની સાચા સયણુ રે ભાઈ. ૧૫  
 સુખસાતા પૂછી કરી રે, એઠી સખીની સાથ;  
 પ્રશ્નાદિક પૂછે ભલા રે, વિનયે જેડી હાથ રે ભાઈ. ૧૬  
 હવે લવિયણુ ! તુમે સાંભળો રે, આગળ વાત રસાળ;  
 રામચંદ્ર સુનિયે કહી રે, સુંદર ણીજી ઢાળ રે ભાઈ. ૧૭  
 દોહરા

શુરુ આગમ<sup>૧</sup> નિસુણી કરી, અમર કુમર તે વાર;  
 મિત્ર સંગાતે આવીયો, ધરી અંતરમાં ખ્યાર. ૧  
 શુરુ વાંદી એઠો તિહાં, દીકી તિહાં સા ખાળ;  
 વિનય વિવેક દેખી કરી, મનમાં થયો ખુશાળ. ૨  
 પુરુષાગમન<sup>૨</sup> દેખી કરી, વંદી ગુરુનાં પાથ;  
 કન્યા આવી નિજ ધરે, મન રળીયાયત થાય. ૩  
 કુમરે સુનિ દેશન સુણી, નીજયો અતિ ચિત્તમાંય;  
 શુરુ વાંદી ધર આવતાં, પૂછે મિત્રને ત્યાંય. ૪  
 કોણુ ખાળા કેની ધુઆ ?<sup>૩</sup>, હતી તે કહેને મોય;<sup>૪</sup>  
 પ્રત્યુત્તરમાં અમરને, વળતું પલણે સોય.<sup>૫</sup> ૫  
 તારે શું કારણ અછે ?, બણણુ તેષનુ ગુંજ;  
 વળતું અમર તેને કહે, અમશું પૂછું તુજ. ૬  
 તે સુણી કર્મદા કહે, જો પરણેવા ખાસ;  
 ખરા દિલથી મુજને કહે, પૂરું તુજ મન આચ. ૭  
 એમ સુણી કુમર કહે, હા પરણું એ ખાળ;  
 ગુણુ મંજુષા<sup>૬</sup> તે અછે, ગજ ગતિ એ તસ ચાલ. ૮

૧ આવવું. ૨ માણુસનું આવવું. ૩ દીકરી. ૪ મુજને. ૫ તે. ૬ પેરી.

અહવાં વયણો સાંભળી, મન રળીયાયત થાય;  
હવે લવિયણ ! તમે સાંભળો, રાખી મન વચ ઠાય. ૬

### ઢાળ ઉ ૭

[ હરીયા મન લાગ્યો—એ દેશી. ]

કર્મદાત તિહાંથી ચલો, આવ્યો શેઠ હુકાન રે;  
લવિયણ ! સાંભળો.

બુહાર કરી એઠો તિહાં, પામીને સન્માન રે. ભ૦ ૧  
કર વારો<sup>૧</sup> જરી અહી, કન્યા એક આવંત રે; ભ૦ ૨  
સ્વરૂપવતી સા લાળીને, કર્મદાત પૂછંત રે. ભ૦ ૩  
કનકદાત હસીને કહે, એ છે મહારી જાતરે;<sup>૨</sup> ભ૦ ૪  
શું નથી ઓળખતા તમે ?, કે પૂછો તમે ભાતરે ! ભ૦ ૫  
વળતું કર્મદાત કહે, એ ખરી છે તુમ વાય રે; ભ૦ ૬  
કિહાં પરણુાવી અહને ?, તે લાંખો તુમે ભાય રે ! ભ૦ ૭  
અહવાં વયણો સાંભળી, કનકદાત કહે તામ રે; ભ૦ ૮  
હજી સગપણ કીધું નથી, કિમ પરણુાં આમરે ? ભ૦ ૯  
કર્મદાત એમ સાંભળી, શિર ધૂણુ કહે ગુંજરે; ભ૦ ૧૦  
શું જગમાં મળતા નથી ?, મૂરતીયા કોઈ તુજ રે. ભ૦ ૧૧  
વળતું શેઠ કહે તદા, શોધ કરી ધણું ભાય રે !; ભ૦ ૧૨  
મન માન્યો મળતો નથી, તેથી ચિંતા થાય રે. ભ૦ ૧૩  
નો ખખર હોય તુમને, તો કૃપા કરી કહે મોય રે; ભ૦ ૧૪  
કર્મદાત વળતું કહે, હુનીયામાં ધણું હોય રે. ભ૦ ૧૫  
ધર એઠાં મળે નહિ કદિ, શોધ કરવી ધરે ભાય રે !; ભ૦ ૧૬  
નો છચ્છા હોય તુમ તણું, તો લાંખું હું આંયરે. ભ૦ ૧૭

૧ પાણી. ૨ દીકરી. ૩ વાણી.

એહિજ નગરમાંહેં અછે, સાગરદાતનો જાતરે; <sup>૧</sup> લઠ  
 જે મન માને તુમ તણું, જુગતી જોડી અવહાતરે. લઠ ૧૦  
 કનકદા કહે તેહને, અમર ન માને વાત રે; લઠ  
 મિત્ર અછે એ તુમ તણું, જે સમજાવો ભ્રાત રે!. લઠ ૧૧  
 જે માને એ વાતડી, તો સુજ પૂરણુ લાગ રે; લઠ  
 એહ કાર્ય કરો માહરં, તો આલાર અથાગરે. <sup>૩</sup> લઠ ૧૨  
 કર્મદા કહે શેઠળ, એમાં શ્યો ઉપગાર રે; લઠ  
 માનવી માનવતું કરે, તેમાં ન પાડ લગાર રે. લઠ ૧૩  
 જે તુમ ઈચ્છા એહવી, તો જઉ મિત્ર આગારણ રે; લઠ  
 એમ કહીને ઉઠીયો, શેઠને કરી જુહાર રે. લઠ ૧૪  
 ત્રીજ ઢાળ પૂરી થઈ, પુણ્યથી સરે સહુ કામ રે; લઠ  
 નિયતિહરિ<sup>૫</sup> સૂરિજનો, <sup>૬</sup> રામેંહુજ કહે આમ રે. લઠ ૧૫  
 દોહરા

કર્મદા અટપટ હુવે, આંયો મિત્ર <sup>૮</sup>સકાશ;  
 અમરદાત પૂછે તદા, કેમ લરાણુ સાસ? <sup>૧</sup>  
 શાંત થઈ કહે મિત્રને, સુષુ કારણુ શુષુ ગેહ;  
 કનકદા શેઠે સહુ, માની વાત એ તેહ. <sup>૨</sup>  
 તુમને પોતાની કન્યકા, આપવા ઈચ્છે ખાસ;  
 હુવે મુજ વિનાંતિ માનીને, પૂરો મનની આશ. <sup>૩</sup>  
 અમરદાત એમ સાંભળી, હસીને લાંઘે એમ;  
 મારે પણ એ કખૂલ છે, કરી પૂછે તું કેમ? <sup>૪</sup>  
 મિત્રનાં વયણ્ણો સાંભળી, આંયો શેઠ આગાર;  
 અન્ને એકાંતે બેસીને, કરે વાતો તે વાર. <sup>૫</sup>

૧ મુત્ર. ૨ મનોહર. ૩ ધણો. ૪ ધર. ૫ કર્મસિંહજ સ્વામી.  
 ૬ આચાર્ય. ૭ રામચંદ્રજી. ૮ પાસે.

## દાણ છ થી

[ રામચંદ્રકે ખાગ, ચાંપો મોરી રહ્યોરી—એ દેશી. ]

|                                                       |    |
|-------------------------------------------------------|----|
| કર્મદત્ત કહે તામ, તુમ બળ્યાં પુષ્ય ખરીરી;             |    |
| અમરદત્ત મુજ ભિત્ર, વાત તે કષ્યૂલ કરીરી.               | ૧  |
| હવે તુમે થધને તૈયાર, વેવિશાળ <sup>૧</sup> કરોરી;      |    |
| પરિશ્રમે સમજાવ્યો એહ, હવે ન વિલંબ કરોરી.              | ૨  |
| એમ સાંભળીને શેઠ, સગપણુ તુરત કરીરી;                    |    |
| નહેંચ્યાં ફૈઝળ પાન, મનમાં ઉલ્લટ ખરીરી.                | ૩  |
| સાંભળીને સહુ કોચ, વાતો એમ કરીરી;                      |    |
| જુગતી બેડી મળી એહ, પુષ્યની વાત ખરીરી.                 | ૪  |
| શેઠ વિચારે લગ્ન, કરલું સુહૂર્ત લદેરી;                 |    |
| ઓલાબ્યા જેષી તામ, આબ્યા તેહિજ પદેરી.                  | ૫  |
| જેષી જેષને જેધી, આપે દ્વિવસ તદારી;                    |    |
| વધુની કરે તૈયારી, ઉલ્લટ અંગે ઉદારી.                   | ૬  |
| ઉલયનાં સદન <sup>૨</sup> મુઝાર, મહોત્સવ થાય અપારી;     |    |
| એમ વ્યતિક્રમતાં તે દિન, લગ્નનું આંધ્રું યદારી.        | ૭  |
| અમરદત્ત કુમાર, ચડ્યો વરઘોડે તદારી;                    |    |
| વાગે નગારાં નિશાન, વાજ્ઞિત્ર વિવિધ અપારી.             | ૮  |
| અનુક્રમે ચાલતાં તેહ, આબ્યા શ્વસુર <sup>૩</sup> ધરેરી; |    |
| સાસુએ પોખરણ્યાં લેધ, પદ્ધરાબ્યા માહેરેરી.             | ૯  |
| વેહીયાઃ ભણે ત્યાં વેદ, મંત્રોચ્ચાર કરેરી;             |    |
| મંગળ ફેરા ચાર, ફેરવ્યા હર્ષ ધરેરી.                    | ૧૦ |

૧ સગપણુ. ૨ ધર. ૩ સાસરાને ધરે. ૪ વેદ અજોલા આલણો.

|                                                          |    |
|----------------------------------------------------------|----|
| કનકદાત તવ શેઠ, ઉલ્લટ મનમેં ધરીરી;                        |    |
| આપે ધીયને <sup>૧</sup> આથ, <sup>૨</sup> કન્યા દાન ખરીરી. | ૧૧ |
| સાજન મહાજન લોક, પાભ્યા હર્ષ અપારી;                       |    |
| નહોરાવે તહા શેઠ, સાસરીએ તે કુમારી.                       | ૧૨ |
| અનુકમે દંપતિ ચાલ, આભ્યા મહેલ મુનારી;                     |    |
| સતી આવી પતિ પાસ, દિલમાં હર્ષ અપારી.                      | ૧૩ |
| અમરદાત કહે એમ, એક મુજ વાત ખરીરી,                         |    |
| પ્રશ્ન પૂછું તુજ એક, સાંભળ દિલડું ધરીરી.                 | ૧૪ |
| તવ સતી કહે કર જોડ, સ્વામી ! હું દાસી તુમારી;             |    |
| જે કૃષ્ણા હોય આપ, મુજને લાંઘો મુરારી !                   | ૧૫ |
| મુજ મતિને અનુસાર, આપીશ ઉત્તર ધારો;                       |    |
| અમરદાત સુષ્પી એમ, થચો રળીયાત મનારી.                      | ૧૬ |
| પૂછશે શું તે કુમાર ?, સાંભળો સહુ નરનારી;                 |    |
| આગળ વાત રસાળ, શ્રોતાને સુખકારી.                          | ૧૭ |
| ચાથી ઢળ રસાળ, એ મુનિ રામે ઉચ્ચારી;                       |    |
| નિયતિહરિ સુપસાય, મુજ મન હર્ષ અપારી.                      | ૧૮ |

### દોહરા

|                                        |   |
|----------------------------------------|---|
| અમરદાત ત્રિયને કહે, જે મુજ મન વિચાર;   |   |
| તે લાંખું છું તુજને, સાંભળ થઈ હુશીયાર. | ૧ |
| મોખ અને આડી મહિં, તેને ગણુંનો બધુર ?;  |   |
| જે ઉત્તર મન માનતો, . મળશે મુજને મધુર.  | ૨ |
| તો ગૃહસ્થાશ્રમ આપણો, ચાલશે સુખે સમાધ;  |   |
| વિચાર પૂર્વક આપને, ઉત્તર તું નિરાખાધ.  | ૩ |

૧ દીકરિને. ૨ દાયનો. ૩ પહેલા.

એહ સુણ્ણી સતી ચિંતવે, શું પતિ ભાંખે એમ ?;  
પહેલે કબળે મક્ષિકા,<sup>૧</sup> આગળ ચાલશે કેમ ?.  
કરનોડીને ધર,<sup>૨</sup> પ્રત્યે, હસીને પલણે તામ;  
સ્વામી ! કેમ બોલો તુમે ?, હાસ્ય વચન પ્રભુ ! આમ.  
વળતું કુમર કહે તદા, નહિ હાંસીની વાત;  
ખરું કહું છું તુજ પ્રત્યે, મેળવવા સુખ સાત.  
સતી સુણ્ણી ચમકી તદા, સાંલળું છું શું દશ ! ?;<sup>૩</sup>  
વિચારીને હું પણ ઈંડાં, બોલું વાત જગીશ.  
૪  
૫  
૬  
૭

### દાળ ૫ મી

[ વિમળ જિન ! વિમળતા તાહરી રે—એ દેશ[.] ]  
કરનોડી કહે કામિનીરે, કંત પ્રત્યે ધરી હામ;<sup>૪</sup>  
તુમ પૂછેલ જે વાતડીરે, ઉત્તર આપું આમ.  
૧  
સુશુષ્ણ સનેહા ! સાંલળોરે.  
૨  
મોલ અને આડી અન્નેરે, તે વિષુન અને ધામ;  
માટે અન્ને છે કામનારે, નહિ વિવાદનું કામ. સું ૩  
ત્રટકીને કુમર કહેરે, એ નવ માનું વાત;  
તેમાં પણ કોણું શ્રેષ્ઠ છે રે ?, કહેને તે અવદાત.<sup>૫</sup> સું ૪  
પતિ વચ્છો. એવાં સુણ્ણીરે, સા ચિંતે મનમાંય;  
નિઃકારણુ વિવાદમારે, નીકળે સાર ન કાંય. સું ૫  
તો પણ વિનોદને કારણુરે, સતી ભાંખે<sup>૬</sup> છે તામ;  
અન્નેમાં આડી ધૂર છેરે, હું ભાંખું છું આમ. સું ૬  
એમ સુણ્ણી ઈર્ષા ધરીરે, કહે શું ભાંખું તુજ ?;  
સુજ કથિત જે વાતડીરે, તું નવ સમજે ગુજ. સું ૭

૧ માખી. ૨ પતિ. ૩ પ્રભુ. ૪ પ્રેમ, આનંદ. ૫ ઝુલ્લે ઝુલ્લું.  
૬ બોલે છે.

અભિમાન ચકે તું ચડીરે, તુજને લાંખું એહુ;  
હજુ પણ કરીથી વિચારિનેરે, કહે સાચું હોય નેહુ. સું ૭  
ત્રિય<sup>१</sup> પણ હઠથી તે કહેરે, મેં લાંખી ને વાત;  
એમાં ઝેર નથી જરીરે, કેમ ખીલે સુજ કાંત!?. સું ૮  
એમ સુણ્ણીને કુમર કહેરે, સુજથી પરહી જાય;  
કામ નહિ ઈંદ્રાં તાહુરંદે, એમ કહું છું વાય. સું ૯  
ધવ વયણો એહવાં સુણ્ણીરે, દચિતા<sup>૨</sup> ઉઠી તામ;  
અમર કહે સુણું સુંદરી રે!, સુજ વયણો તું આમ. સું ૧૦  
ધૂર<sup>૩</sup> આડી તું વેખવેરે, તો આટલાં કામ કરેહુ;  
સુજ પિતરૌની લાજનેરે, વધારને શુણુ ગેડ. સું ૧૧  
મારા વિના તું પુત્રનેરે, ઉત્પજ્ઞ કરને એક;  
વળી વ્યાપાર ચલાવનેરે, રાખીને તુજ ટેક. સું ૧૨  
જ અળગી હવે સુજથીરે, તારા મહેલ સુઝાર;  
ત્રિય સ્વલ્બાવે સા તફારે, ઉઠી ચાલી તે વાર. સું ૧૩  
પોતાને લુખને<sup>૪</sup> જઈરે, આસને એઠી તામ;  
કરે વિચારો મનમારે, હઠથી કીધું મેં આમ સું ૧૪  
પતિ આગળ જઈ વીનવુંરે, પડીને હું તસ પાય;  
મારી માંગું લૂલાનીરે, તો સુજ શાન્તિ થાય સું ૧૫  
એમ ચિંતી ઉઠી યદારે, આંયું અભિમાન તામ;  
મારી વાત જ્યૂઠી નહિરે, સા એસી ગઈ ઢામ. સું ૧૬  
હવે શ્રોતાજન! સાંલળોરે, સતીના પતિની વાત;  
સુણુતાં સાતા ઉપજેરે, મિષ આગળ પ્રાવદાત. સું ૧૭  
પાંચમી ઢાળ પૂરી થઈરે, રામેંદુ<sup>૫</sup> કહે તામ;  
નાગેંદુ<sup>૬</sup> શુરૂ રાજનેરે, વંદન કરું ધરી ઢામ. સું ૧૮

૧ સ્વી. ૨ સ્વી. ૩ પહેલાં. ૪ ધેર. ૫ હક્કિત. ૬ રામચંદ્રજ.  
સુનિ. ૭ નાગચંદ્રજ સ્વામી.

## દોહરા

અમરદત્ત મન ચિંતવે, ત્રિયા<sup>१</sup> હઠીલી જાત;  
 શિક્ષા આપવી એહને, એ છે સીધી વાત. ૧  
 સકળ વ્યાપાર સમેટીને, લક્ષમી કરી એકત્ર;  
 મંજુષામાં<sup>૨</sup> નાંખીને, મારી તાળું તત્ત્ર. ૨  
 દૃઢતા<sup>૩</sup> પાસે આવીને, બાંઘે એવાં વયણું;  
 હું પરદેશે જાઉં છું, સાથે લઈ સહું <sup>૪</sup>સયણું. ૩  
 માસ એક તુજ ચાલશે, ધર છે એટલું અજન;  
 હવે રહેને તું શાંતિમાં, જેમ ફાવે તુજ મન. ૪  
 પણ મેં જે ઓલોલા કલ્યા, કરી બતાવને તેહ;  
 ત્યાં સુધી તું એકલી, રહેને તાહરે ગેહ.  
 એમ કહી ચાલી નીકળ્યો, અમરદત્ત કુમાર;  
 હવે શ્રોતાજન ! સાંભળો, નિદ્રા વિકથા વાર. ૬

## દાળ દ ઠી

[ જરે મારે જગ્યો કુંવર જમ-એ દેશી.]

જરે મારે સતી વિચારે ચિત્ત, પતિ રોસાઈને ગયા; ૧  
 જરે મારે હાંસીથી થધ હાંણું, હું કી મતિની કહી ત્રિયા. જરેજ. x૧  
 જરે મારે હવે મહારે કરવું કેમ ?, કિહાં જાઉં કેહને કહું ?;  
 જરે મારે ઉધમતું હવે કામ, જેથી કાર્ય સીજે સહુ. ૨  
 જરે મારે રોયા ન મળે રાજ, ડાદ્યા પુરુષો એમ કહે;  
 જરે મારે તો ઉધમ કરું આંહિ, તોજ વચન મારું રહે. ૩  
 જરે મારે એહવો કરી વિચાર, ફરવા લાગી ધર મહિં;  
 જરે મારે જેઈ સયદ<sup>૫</sup> આગાર્દ, દીડો પટારો એક તહિં. ૪

૧ સ્વી. ૨ પેરીમાં. ૩ સ્વી. ૪ કુંભિં. ૫ આખું. ૬ ધર.

× દરેક લાટીએ ‘જરેજ’ ઓલાવું.

જરે મારે ખાલી જોઈને તેહ, મન રળીયાયત થઈ તદા;  
 જરે મારે ઉપત્તા<sup>૧</sup> લઈને તેહ, હાથે પરારો ભર્યો સુદા. ૫  
 જરે મારે તાળું મારી તાસ, ગાડી સુદા<sup>૨</sup> તવ કરી;  
 જરે મારે પાડોસણુનો પુત્ત, પાસે બોલાવીને જરી. ૬  
 જરે મારે મીઠે વયણું તામ, બાળકને સા કહે તદા;  
 જરે મારે મછારે છે એક કામ, તું કરીશ કે નહિ સુદા? ૭  
 જરે મારે બાળક કહે તવ એમ; હા હું કરી આપીશ ભલે;  
 જરે મારે સુખેથી કહેા માત!, જાઉં ઉતાવળો આ પણે. ૮  
 જરે મારે સતી કહે તે વાર, સુજ સ્વામીનો સુનિમ છે;  
 જરે મારે તેહને તેડી આવ, કકલ તેહનું નામ છે. ૯  
 જરે મારે એમ સુણ્ણી તે બાળ, દોડી તેહને ઘર ગયો;  
 જરે મારે કરનેડી કહે તામ, તુમ સરીઓ કારજ ભયો. ૧૦  
 જરે મારે સુનિમને કહે તવ બાળ, અમરદાત તુમ શૈઠીયો;  
 જરે મારે તેહની જે ઘર નાર, તુમને ત્યાં બોલાવિયો. ૧૧  
 જરે મારે વસનો<sup>૩</sup> પહેરી અંગ, સ્વધરથી તવ ચાલીયો;  
 જરે મારે અનુકમે ચાલતાં તેહ, શેડાણ્ણી ઘર આવિયો. ૧૨  
 જરે મારે શેઠ ત્રિયને કહે તામ, કેમ સુજને તુમે તેડીયો?;  
 જરે મારે કસ્તૂરીએ તવ તાસ, સાદરથી<sup>૪</sup> બેસાડિયો. ૧૩  
 જરે મારે વળતું કહે સા એમ, વિનાંતિ સુજ અવધારનો;  
 જરે મારે એક વખત દરરૂાજ, સુજ મંહિરોયે આવનો. ૧૪  
 જરે મારે તુમ સરિખા જે વૃદ્ધ, આવે અહનિશ્ચ<sup>૫</sup> સુજ કને;  
 જરે મારે સુખે જાચે સુજ દિન, તેથી આનંદ સુજ મને. ૧૫  
 જરે મારે સાંલળી એવાં વયણું, કકલ બાપે અંગોકર્યોં;  
 જરે મારે સુણ્ણી હરખી સા મન, સુજ સંધળાં કારજ સર્યાં. ૧૬

૧ પથરા. ૨ સીલ-પેક કર્યો. ૩ કપડાં. ૪ ચતુરાર સહિત.  
 ૫ હંમેથ.

જીરે મારે છઢી દાળ રસાળ, નિયતિહરિ સુરિરાજનો;  
જીરે મારે રામેંહું કહે એમ, સાંભળજો સહુ સજજનો ! ૧૭  
**દોહરા**

મુનિમ રૈજ સતી આગળે, આવી એસે પાસ;  
વાતોમાં હિન ચાર ત્યાં, વીતી ગયાં ઉલ્લાસ. ૧  
હિન પંચમેં કહે કક્ષને, બાપા ! સુણુ સુજ વાત;  
પતિ પરદેશ સિધાવતાં, કહી ગયા લલી ભાત. ૨  
હું જાઉં પરદેશડે, તું સુખે રહેને ગેહ;  
તું અને વળી મુનિમજી, વ્યવસાયરે કરજો એહ. ૩  
તે ચિંતામાં હું પડી, ધવ જતાં પરદેશ;  
આજે સુજ હૈડે ચડયો, જે સુજ થયો આદેશ. ૪  
માટે હવે મુનિમજી !, એદ્વા તરત વખાર;  
એમ સુણ્ણી કક્ષ કહે, એમાં નથી હવે સાર. ૫  
વૃદ્ધાવસ્થા માહરી, નહિ હવે કામનાં હિન;  
માંડ માંડ છૂટો થયો, રહું પ્રલુભાં લીન. ૬  
**દાળ ભ મી**

[ અરથિક મુનિનર ચાલ્યા ગૌયરી-એ દેશા. ]

એહવી વાણ્ણી સુણ્ણી સા સુંદરી, વળતું ભાંઘે એમોણ;  
જે તમે લાંખ્યું તે તો સત્ય છે, એમાં સહુનો એમોણ.

**ભવિયણુ !** ભાવ ધરીને સાંભળો. ૧  
પણ જ્યાં લગે તુમ શેઠ ન આવીયા, ત્યાં લગે ચલવો વ્યાપારજી;  
શેઠ આવ્યા પણી જેમ સુખ ઉપજે, તેમ તુમે કરજે તેવારજી. ૨  
વળી તુમ ટાળી અવરની ઉપરે, સુજને ન મળે ભરેંસોણ;  
તેથી કહું છું બાપજી ! તુમ લણ્ણી, માનો સુજ અરદાસોણ. ૩

૧ રામચંદ્રજી સુનિ. ૨ વ્યાપાર. ।

વિનય લરેલાં વયણો સાંભળી, મુનિમ વિચારે એમોલુ;  
 હવે નવ થાએ નકારો મુજથી, અંગીકરે સહુ ગ્રેમોલુ. ૪  
 એમ નિશ્ચય કરી મુનિમ કહે તદા, તુમચી ઇચ્છા જો એમલુ;  
 તો હવે પૈસા આપો મુજને, કરે વ્યાપાર હું ક્રેમલુ. ૫  
 એમ સુણ્ણી વળતું કહે સા તદા, બાપા! થઈ હું ગમારલુ;  
 પતિ પરદેશ સિધાવતાં સાદરે, કણું મુજ અપરંપારલુ. ૬  
 વિત્ત જેઠલું જોઈએ તુજને, તારી પાસે તું રાખલુ;  
 પણ ત્રિયની દુંડી મત કહી સદા, તે અનુસારે મેં દાખલુ. ૭  
 મહારે વિત્ત<sup>૧</sup> તણું શું કામ છે? સાચવી જાઓ આપલુ;  
 ધન સાચવવું મુજ મુશ્કીલ છે, જેમ જોણે રમાડવો સાપલુ. ૮  
 એહવાં વયણો માહરાં સાંભળી, વિત્ત પટારે સ્થાપેલુ;  
 તાળું વાસી શીલ કરી તદા, ચાવી મુજને આપેલુ. ૯  
 ધરની ભલામણુ આપી ખંતથી, પોતે પરદેશ શિધાવેલુ;  
 જાતાં જાતાં વળી કહેતા ગયા, વ્યાપાર અખંડ ચલાવેલુ. ૧૦  
 તો પણ મુજને વિત્તની વાતડી, ચિત્તમાં કિમહિ ન આવીલુ;  
 પતિની આજા વિષુ હવે મુજથી, દેવાય નહિ કહિ ચાવોલુ. ૧૧  
 પણ એક થીજે ઉપાય હું દાખલું, જે કરો તુમે એકકામલુ;  
 તો મનવંચિત કારજ સંપન્ને, પૂરો મનની રહામલુ. ૧૨  
 એહજ નયરી માંડ વસે ભલોા, મુજ સ્વામીનો ભિતલુ;  
 પાનાચંદ એહવે અલિધાનથી, જે છે સાચો સંતલુ. ૧૩  
 વિત્તથી પૂરિત આ મંજૂષ<sup>૨</sup> છે, રાખો તેહને ગેહલુ;  
 લક્ષ છીનાર નગદ તે ઉપરે, લઈ આવો તુમે તેહલુ. ૧૪  
 હવે ભવિયણુ! તુમે સાંભળો સ્નેહથી, આળસ નિદ્રા ટાળલુ;  
 સ્વાતમી ઢાળે રામ મુનિ કહે, આગળ વાત રસાળલુ. ૧૫

૧ પૈસા. ૨ છીંછા. ૩ પટારો. ૪ સોનામહેર.

## દોહરા

- સતી કથિત<sup>૧</sup> વયણો સુણ્ણી, કકલ આપો તામ;  
તિહાંથી ઉઠી ચાલીયો, પાનાચંદને ધામ. ૧
- મુનિમને આવતો લાળીને<sup>૨</sup>, ધસમસી ઉઠ્યો તેહ;  
સાદરથી બેસાડીયો, સજજન રીતિ એહ. ૨
- શ્રેષ્ઠી પૂછે મુનિમને, તુમ કિમ જૂલ્યા આમ?;  
ઘણે દિને અમ ગૃહ વિષે, પદધાર્યી શ્યે કામ? ૩
- અમ સરિખું કારજ હુએ, સુણે પ્રકાશો તેહ;  
મુનિમ કહે અહો શેડજ! , સુણો કામ છે જેહ. ૪

## ઢાળ ચ મી

[ રાગ બંગાલો ]

- એમ કહીને મુનિમજી તામ,  
શોઠ લણ્ણી વાતો કહે આમ; ભવિ ! સાંભળો.  
તુમચો ભિત્ર અમરદટા જેહ,  
પરદેશ ગયો તુમે જણો એહ. ભવિ. ૧
- તસ ધર પાછળ તેહની નાર,  
સતીએ માંહે શિરોમણુ સાર; ભવિ.
- તેણે મૂક્યો તુમ આવાસ,  
રાખીને પૂરણુ વિશ્વાસ. ભવિ. ૨
- તેનુ કારણુ કહું તુમ પાસ,  
સાંભળજો તે ધરીને ઉલ્લાસ; ભવિ.
- ચાતે ધરમાં બાઇ છે એક,  
અવસ્થા છે તેની નાની છેક. ભવિ. ૩

૧ કહેલાં. ૨ દેખીને.

૨

|                              |        |  |
|------------------------------|--------|--|
| ગૃહમાં જોખમ છે રૈ અપાર,      |        |  |
| તેથી લાગે થીક આવાર;          | ભવિ.   |  |
| રાતે નાવે નિંદ સંદર્ભ,       |        |  |
| તેથી ન રહે એક ઠામે મન.       | ભવિ. ૪ |  |
| રવિત ભરેલો પટારો તુમ પાસ,    |        |  |
| અનામત રાખવાની તસ આશ;         | ભવિ.   |  |
| એહ જણુવવા આવ્યો આંહિ,        |        |  |
| રાખવા તુમ નહિ કરશો મનાઈ.     | ભવિ. ૫ |  |
| તુમ મિત્ર કેરેં છે એ કામ,    |        |  |
| કરે ધરીને મનમાં હામ;         | ભવિ.   |  |
| જે તમે ના કહેશો આ વાર,       |        |  |
| થાશે મિત્રની કચવાળું અપાર.   | ભવિ. ૬ |  |
| એવાં વયણો સાંભળી શેડ,        |        |  |
| મધુર ગિરાથી તે કહે નેઢું;    | ભવિ.   |  |
| તુમે કહી તે સધળી વાત,        |        |  |
| સાચે સાચી છે અખીયાત.         | ભવિ. ૭ |  |
| પણ મુજથી નવી થાય એ કામ,      |        |  |
| હું થાપણું નવ રાખું આમ;      | ભવિ.   |  |
| લક્ષ દીનાર જે તુમને જેય,     |        |  |
| તો હમણું લઇ જાઓ સોય.         | ભવિ. ૮ |  |
| આકી વિત ભર્યું મંજૂષ,        |        |  |
| રાખવા મનમાં નવ ધરેં હુંશ;    | ભવિ.   |  |
| વ્યાજની પણ નવ કહેશો વાત,     |        |  |
| તુમને કહું છું પ્રેમથી ભાત ! | ભવિ. ૯ |  |

૧ ધરમાં. ૨ પૈસાથી. ૩ નકી, ચોકુસ.

|                                 |         |  |
|---------------------------------|---------|--|
| ઉંઘ ઠેણું છો લે ઉનાગરો કોણું ?, |         |  |
| તુમે છો મારા સાચા 'સેણું;       | ભવિ.    |  |
| તેથી કહું છું તુમને એમ,         |         |  |
| તેમ કરો મુજ થાંએ એમ.            | ભવિ. ૧૦ |  |
| નાણં કહ્યું છે નેહનો તોડ,       |         |  |
| તેથી તમે નવ કરશો જોડ;           | ભવિ.    |  |
| ધન દેખીને મારી બુદ્ધિ,          |         |  |
| અગડી જાય તો નાશે શુદ્ધિ.        | ભવિ. ૧૧ |  |
| મિત્ર દ્રોહ વળી તવ તિહાં થાય,   |         |  |
| એવું કામ નવ કરવું લાય !;        | ભવિ.    |  |
| આપા ! તમે છો ચતુર સુનાણું,      |         |  |
| શું સમજવું કહીને વાણું ?.       | ભવિ. ૧૨ |  |
| એ વિષુ અવર જો હોવે કાંચ,        |         |  |
| કરું સુખેથી છે મુજ રવાય;        | ભવિ.    |  |
| એમ સુણું કકલ કહે તામ,           |         |  |
| કેમ આદો છો તુમે તે આમ.          | ભવિ. ૧૩ |  |
| શ્રેણાણું એ ને કહેલ છે મુજ,     |         |  |
| તે લાંખું સધળું તુમ ચુજ.        | ભવિ.    |  |
| તુમ ઉપર વિશ્વાસ છે એહ,          |         |  |
| તેથી રહેશો મંજૂષ તુમ ગેહ.       | ભવિ. ૧૪ |  |
| આધાર વિષુ હું ન લહું વિત્ત,     |         |  |
| એ સારી છે સર્વની રીત;           | ભવિ.    |  |
| કો કણે ફરી જાયે મન,             |         |  |
| તો મુજ ન મળે ખાવા અજ.           | ભવિ. ૧૫ |  |

|                             |         |
|-----------------------------|---------|
| નીતિમાં પણ કહ્યું છે એમ,    |         |
| વ્યવહાર પણ શુદ્ધો રહે જેમ;  | ભવિ.    |
| તુમ અમમાં જે છે સંતોષ,      |         |
| રાખવો પડશે ધરીને હેંથ.      | ભવિ. ૧૬ |
| એમ સમજાવ્યો બાપે તામ,       |         |
| હવે કસ્તૂરીની પૂગશે હામ;    | ભવિ.    |
| નિદા વિકથા સર્વને ટાળ,      |         |
| શ્રોતા ! સુણો કરો મન વિશાળ. | ભવિ. ૧૭ |
| નિયતિહારિ સૂર્યિરાજનો બાળ,  |         |
| રામ થઈ મનમાં ઉજમાળ;         | ભવિ.    |
| આડમી ટાળ એહ પૂરી થાય,       |         |
| સાંલળજે સહુ ડોર્ધ ઉમાય.     | ભવિ. ૧૮ |

### દોહરા

|                                            |   |
|--------------------------------------------|---|
| એમ સમજાવી શેઠને, કકલ બાપેા તામ;            |   |
| જુહાર કરીને ચાલીયો, મનમાં ધરી બહુ હામ.     | ૧ |
| કકલ હવે ઘર આવીને, કહે કસ્તૂરીને આમ;        |   |
| માંડ માંડ સમજાવીએા, દેશે શ્રેષ્ઠી હામ.     | ૨ |
| એમ સુણી સા સુંદરી, મનમાં રળીયાયત થાય;      |   |
| હવે મારી ચિંતા ટળી, સ્ફુર્યો સરસ ઉપાય.     | ૩ |
| રાજ થઈને એમ કહે, મુનિમ પ્રત્યે ધરી હામ;    |   |
| બાપા ! હવે સત્તવર કરો, મંજૂષ મેલ્યાનુ કામ. | ૪ |
| રશકટ એક ભાડે લઈ, જેહયા એલ તવ ચાર;          |   |
| તે પર મંજૂષા ધરી, ચાલ્યો મુનિમ તે વાર.     | ૫ |

૧ પૈસા. ૨ ગાડું.

આંદ્રો શેડ તણુ ગૃહે, લાવી પટાડો તેહ;

૬

કહે અનામત મૂડીને, તમે સાચવનો એહ.

શેડ પાનાચંદ પાસથી, લીધી લક્ષ દીનાર;

૭

કકલ બાપો લેછને, આંદ્રો અમર આગાર.

નીમી<sup>૧</sup> લક્ષ દીનારની,<sup>૨</sup> સોંપી મુનિમે તામ;

૮

હુર્ધિત થઈ કસ્તૂરીને, કહે સર્યાં તુમ કામ.

### ઢાળ હ મી

[ નિદરણી વેરણુ હુદ્ધ રહી-એ દેશી. ]

સુંદરી કહે હવે મુનિમને,

હવે બાયા ! હો ચલવો વ્યવસાયકે;

નીમી જોઇએ તે લઈ કરી,

માત ખરીદો હો કરી દાય ઉપાય કે.

પુષ્ય સંજેગે સાજન મળે. એ ટેક. ૧

અર્ધલક્ષ સોના મહોરને,

તેહ મુનિમે હો તવ લીધી ત્યાંય કે;

વિવિધ જાતિનાં કરિયાણુકે,

વઈ ભરીયાં હો તે વખારની માંયકે. પુષ્ય. ૨

વ્યાપાર ધમધોકારથી,

કકલ ચલવે હો થઈને ઉજમાળ, કે;

કસ્તૂરી મનમાં ચિંતવે,

હવે મુજને હો ટળી એહ જંબાળ કે. પુઠ ૩

વ્યાપારથી એક માસમાં,

થયો ફ્રાયદો હો દશ સહસ્રનો<sup>૩</sup> તામ કે;

૧ પુણુ-મૂડી. ૨ સોનામહોર. ૩ દશ હજારનો.

એ દેખી સતી ચિંતવે,

મુજ પૂગશો હો સધળો હવે હામ કે. પુનો ૪  
નામું ડામું સા સાચવે,

આપીને હો તવ પૂરણુ લક્ષ કે;  
માલ બેવે ને સાટવે,

તે સુનિમ છે હો વ્યાપારે દક્ષ કે. પુનો ૫  
વ્યાપાર વિવિધ પ્રકારથી,

તેહ કરતાં હો એમ નિગમે કાળ કે;  
વર્ષ દિવસને આંતરે,

લાલ તિહાં હો દોય લક્ષ<sup>૧</sup> નિહાળ કે. પુનો ૬  
તે દેખી સતી ચિંતવે,

જે પટારા હો ઉપર લીધી લક્ષ કે;  
હવે પાછી સોંપું તેહને,

તો કહેવાઉં હો જગમાં હું રેદક્ષ કે. પુનો ૭  
એમ વિચારી સુનિમને.

મોલાવીને હો કહે ધરીને હામ<sup>૨</sup> કે;  
પાનાચંદની હુકાનથી,

લક્ષ હીનાર હો આપણે લીધાં દામ કે. પુનો ૮  
વ્યાજ સહિત હવે તેહને,

તુમે તરતજ હો આપી આવો આજ કે;  
મંનૂષ મત ઉપાડને,

કરો સત્તવર હો જઈને તુમે કાજ કે. પુનો ૯  
એમ ઠણીને સુનિમને,

લક્ષ સુવર્ણ<sup>૩</sup> હો સુદ્રા<sup>૪</sup> આપી હાથ કે;

૧ એ લાખ. ૨ ડાહી. ૩ પ્રેમધરી-રાજ થઈ. ૪ સોનામહેાર.

લઈ કક્ષ તે ચાલીયો,

આવી આપે હો શ્રેષ્ઠીને<sup>१</sup> હાથ કે. પુનો ૧૦  
એક સહસ્ર દીનાર વળી,

આપે વ્યાજની હો શેઠને તે તામ કે,  
પુલકિત<sup>૨</sup> વદને<sup>૩</sup> તવ કહે,

યાનાચંદ હો બાપા ! શું કહેણ આમ કે ? પુનો ૧૧  
અમરદાત ને મહારા વચ્ચે,

નવિ અંતર હો કેાઈ જાતનો આંહિ કે;  
વ્યાજ નથી લેવો માહરે,

તો સુજને હો શરમાવો કાંઈ કે ? પુનો ૧૨  
એવડી ઉતાવળ શી હતી ?,

ને લેઇને હો આપવા આવ્યા દામ<sup>૪</sup> કે;  
મારે હમણું તેહતું,

કાંઈ પણ હો એવડું નથી કામ કે. પુનો ૧૩  
પાછા લઈ જાઓ એ તમે,

સુખેથી હો ચલવો વ્યાપાર કે;  
એમ સુણુને મુનિમ વદે,

સુણો શેઠળ ! હો તુમ બહુ આલાર કે. પુનો ૧૪  
વળી અમને જોશે યદો,

તવ લેશું હો તુમચી એ પાસ કે;  
એમ શિષ્ટાચાર સાચવી,

પાછો વળી હો મન ધરી ઉલ્લાસ કે. પુનો ૧૫  
પાનાચંદ શેઠ કહે તદો,

સાંલળજો હો કહું છું ને વાત કે;

૧ શેઠને. ૨ હસતું. ૩ મુખે. ૪ પૈસા.

જેહ પટારો સુજ ધરે,  
 રાખ્યો છે હો અનામત વિખ્યાત કે. પું ૧૬  
 બેઈ જાઓ તુમચે ધરે,  
 ઈછાં હવે હો નવ રાખીશ એહ કે;  
 વળતું મુનિમ કહે શેઠને,  
 તે પડીઓ હો લવે તુમચે વાસ કે. પું ૧૭  
 પરદેશથી તુમ મિત્રજ,  
 જખ આવશે હો સુખે આપણે ગેહ કે;  
 તવ તે પોતે બેઈ જશે,  
 તિહાં સુધી હો તમે રાખો એહ કે. પું ૧૮  
 એમ સમજવીને આવીએ,  
 કક્ષ બાપો હો હવે અમરને ગેહ કે;  
 કસ્તૂરી આગળ કહી,  
 સહુ વાતજ હો ધૂરથી માંડી છેક કે. પું ૧૯  
 એમ સુણી સા સુંદરી,  
 મનમાંહિ હો અતિ થઇ ખુશાળ કે;  
 હવે ભવિયણ ! તુમે સાંલળો,  
 છે આગળ હો અતિ વાત રસાળ કે. પું ૨૦  
 નવમી દાળ પૂરી થઈ,  
 નિયતિહરિ હો સૂરિનો બાળકે;  
 રામચંદ્ર મુનિ એમ કહે,  
 લવિ ! આગળ હો સુણો બાળ ! ગોપાળ કે. પું ૨૧

## દોહરા

હવે સુખભર રહેતા થકા, વર્ષ જુગલો વીતંત;  
એહવે શું ત્યાં નિપત્તુ ?, તે સુષુંજે વિરતંત. ૧

ધરાપતિનારે સુત તણું, વિવાહ તણું મંડાણું;  
કરે તૈયારી અતિ ધણ્ણી, સાજન મળી સુનાણું. ૨

નૃપતિ મન એમ ચિંતવે, મહારે છે એક પુતા;  
મુજ અવસર આ સાંપડયો, લહું લાવો ખરબી વિત. ૩

લઘું ઝેર આવી મળો, પણ અવસર નહિં આવંત;  
અવસર ચૂકા મેહુલા, વરસી કાંઈ કરંત. ૪

માટે અવસર ચૂકું નહિં, એમ વિચારી તામ;  
નગર તણું વ્યાપારીઓ, બોલાવ્યા ધરી હામ. ૫

વ્યવહારીઓ આવીને, ઉલા જેડી પણું;  
રાજન્ ! કેમ અમ તેડીઓ ?, શી છે તુમચી ડાણું ? ૬

સાદરે સહુને બેસાડીયા, નૃપ થઈને ઝુશીખાળ;  
હાઈ પોતાનું હવે ઈહાં, કહેશે હૃદય ઝુશાળ. ૭

## ઢાળ નો મી

[ ચિત્ત કહે અલરાયને-એ દેશી. ]

વળતું કહે રાજ તિહાં, સહુ સાંભળતાં એમ હો;  
તુમને જે ઈહાં બોલાવીયા, સુષુંજે ધરીને પ્રેમ હો.  
સુષું લવિ પ્રાણી ! હો. ૧

મહારા કુંવર તણોં ઈહાં, વિવાહ શુલ થાય હો;  
તે લાણી તુમને આજ મેં, બોલાવ્યા આંય હો. સુ. ૨

૧ એ. ૨ રાજના ૩ લદ્દમી. ૪ વ્યાપારીઓ. ૫ હાથ. ૬  
આણા, હુકમ. ૭ આદરથી, પ્રેમથી. ૮ મનમાં કહેવા ધારેલું.

મોદીખાનું તુમે લીયો, તેહ ભણી એલાવ્યા હો;  
 તુમે પણ સહુ મળી કરી, ઈંડાં સુધી આવ્યા હો. સુ. ૩  
 નૃપ વયણો એહવાં સુણી, માંહો માંહેં આમ હો;  
 નથન<sup>૧</sup> પદ્ધતિથી<sup>૨</sup> તદા, કરી સંકેત તામ હો. સુ. ૪  
 ધરાપતિને પૂછીયું, કેટલા પૈસા માંહિ હો;  
 વળતું રાજ એમ કહે, ચઉં લક્ષ લેને આંહિ હો. સુ. ૫  
 એમ સુણી વ્યાપારીઓ, મન વિચારે આમ હો;  
 મોદીખાનું આપણે, લીધાથી સરે કામ હો. સુ. ૬  
 પણ વિવાહ વીત્યા પછી, નૃપ જો પૈસા નાપે હો;  
 તો ધાં ઢેવી કિંડાં કણો ?, હુઃખી થાઈએ આપેં હો. સુ. ૭  
 મારે આપણે લેવું નહિ, મોદીખાનું ડોઈ હો;  
 માંહો માંહે સકેતથી, જાતો કીધો સોઈ હો. સુ. ૮  
 કરનોડી ભૂધવ<sup>૪</sup> પ્રત્યે, વ્યવહારી કહે તામ હો;  
 અમારી પાસે વખારમાં, માલ ખૂટયો સ્વામ ! હો. સુ. ૯  
 તો અમે લહીએ ડેમ કરી ?, મોદીખાનાનું કામ હો;  
 તે ભણી મારી માંગીએ, થઈને લાચાર આમ હો. સુ. ૧૦  
 અવિનય થાતો હોય જો, ક્ષાંતિ કરો પક્ષિતિકંત ! હો;  
 અમે તુમચા છોડ છેએ, અમચો મ લેશો અંત હો. સુ. ૧૧  
 વ્યાપારી સુખથી સુણી, નાકારનાં વયણું હો;  
 બૂધવ મન સમજી રહ્યો, એ નવી દીશો સયણું હો. સુ. ૧૨  
 વ્યાપારીઓ પગે લાગીને, રાજ્ય સલાથી તામ હો;  
 ખાહિર આવી એમ ભણે, ભલું કીધું એ કામ હો. સુ. ૧૩  
 એમ વિવિધ કરતા વાતડી, ઝોંચ્યા નિજ નિજ ગેહ હો;  
 વ્યવહારીઓ ગણ્યા પછી, નૃપ મન ચિંતે એહ હો. સુ. ૧૪

૧ આંખના. ૨ એસારાથી. ૩ ચાર લાખ. ૪-૫-૬ રાજ.

મોટે મંડળે આદર્યો, રાજકુંવરને વિવાહો હો;  
 સાજન સંતોષી તેડીયા, આંહિ ધરીને ઉમાહો હો. સુ. ૧૫  
 વ્યાપારીએ લીધું નહિ, મોહીખાનું તેણું હો;  
 એ વિશુ<sup>૧</sup> આગત રોપાહૂણા, કેમ સંતોષીશ સેણું હો ? સુ. ૧૬  
 એમ ચિંતા કરે ધણી, પણ કાઈ ન સૂઝે હો;  
 એહવે ત્યાં શું નીપતું ?, પુષ્યે કારજ સીજે હો. સુ. ૧૭  
 દશમી દાળ પૂરી થઈ, રામ કહે ઉજમાળ હો;  
 ગુરુપદ<sup>૨</sup> પંકજ લૂંગ<sup>૩</sup> હું, કરે જીવન રસાળ હો. સુ. ૧૮

### દોહરા

કણોપકરણો<sup>૪</sup> સાંભળી, સતીયે એવી વાત;  
 નૃપે મહાજન તેડીયો, હર્ષિત સાતે ધાત. ૧  
 કોઈ પણ વ્યાપારીએ, મોહીખાનું ન લીધ;  
 તો મહારે સહી રાખવું, એમ મન નિશ્ચય કીધ ૨  
 મુનિમને તવ તેડીયો, તે પણ આંધો તામ;  
 મુજને કેમ બોલાવીયો ?, કહો જે હોય તુમ કામ. ૩  
 વળતું કહે સા સુંદરી, બાપા ! સુણુ મુજ વાત;  
 થશે નૃપતિના કુમરનોં, લગોત્સવ ભાવી લાત. ૪  
 મોહીખાનું કોઈ પણ, વ્યવહારિએ નવ લીધ;  
 તો આપણે દેવું સહી, એ નિશ્ચય મેં કીધ. ૫  
 પણ જો રાજા આપણી, શરતો કણૂલે જેહ;  
 મેં ધરો મુજ મન વિષે, તે સુણુને ધરી સનેહ. ૬

૧ આવેલા. ૨ મહેમાન. ૩ ગુરુનાં ચરણ ૩૫ કમળમાં. ૪  
 અમરા સમાન. ૫ એક કાનથી ખીને કાને.

## ઢાળ હુ ભી

[ રતન ગુરુ ગુણે મીઠારે-એ દેશી ]

મુનિમ સંભળવા સજજ થયો રે, સતી લાંખે તેણી વાર;  
પહેલી શરત એ આપણી રે, આપણા ગામ મુઝાર.

સતી લાંખે સુણો વાતડી રે. એ ટેક. ૧

માલ ઠેંચવા નિત્ય આવે છે રે, શક્તો<sup>૧</sup> પાંચસેં જામ;  
વિવિધ જાતિનાં કરિયાણુકો રે, લાવે છે ધરી રહામ. સ. ૨  
આપણા સિવાય આ ગામમાં રે, માલ ખરીદે ન કોય;  
એમ બંદોખસ્ત નૃપ કરે રે, વળી લાંખું સુણુ સોય. સ. ૩  
બીજી શરત વળી એહાવી રે, નૃપને કહેજે આમ;  
માલ જે અમે ખરીદીએ રે, તે રાખવા જેશો ઠામ. સ. ૪  
નગરમાંઠે આજા કરો રે, કક્ષા બાપો કહે જાસ;  
તે તે પોતાની વખારને રે, ખાલી કરી આપે ખાસ. સ. ૫  
એમાં કોઈ ખલખંચ કરે રે, રાય ગુનહેગાર તેહ;  
તેને શિક્ષા થાશે પૂરતી રે, રાઉલ<sup>૨</sup> આણું છે એહ. સ. ૬  
ત્રીજી શરત વળી આપણી રે, નૃપને સંભળાવજે એમ;  
રાજકુંવરના વિવાહ પછી રે, બીજે દ્વિને ધરી ગ્રેમ. સ. ૭  
પૈસાં આપવા અમ લાણી રે, વિલંબ ન કરશો કોય;  
માલ ખરીધો જેહનો રે, તેહને આપવા જોય. સ. ૮  
એહ શરતો જો અમ તણું રે, તમે કખૂંબો ઇલૂકંત !;  
તો મોઢીખાતું તુમ તણું રે, અમે રાખીએ ધરી ખાંત. સ. ૯  
ઇત્યાદિક સહુ વાતડી રે, કરજે થઈ હુશીઆર;  
એમ લલામણુ મુનિમને રે, આપી સતીએ તે વાર. સ. ૧૦

૧ ગાડાં. ૨ હૃષી ૩-૪ રાજ.

સતીનાં વયણો સાંલળી રે, કક્ષલ ત્યાં ચાલ્યો તામ;  
 અતુક્રમે રાજ-કચેરીમાં રે, આંદ્રો ધરીને હામ. સ. ૧૧  
 નમન કરીને ઉલ્લો જઈ રે, ભૂધવની તે પાસ;  
 રાજાએ તવ બોલાવીયો રે, વદનમાંડે<sup>૧</sup> ધરી હાસ. સ. ૧૨  
 કરનેડીને મુનિમ લણો રે, આંદ્રો સલામે ખાસ;  
 પણ એક વાત મેં સાંલળી રે, પૂજુ ધરીને આશ. સ. ૧૩  
 રાજ-કુંવરના વિવાહનું રે, મોહીખાનું કોઈ ન લૈય;  
 એહ સાંલળીને હૃદયમાં રે, મુજ હુઃખ નવી સમેય. સ. ૧૪  
 જે ઇચ્છા હોવે રાજીની રે, તો હું કહું એક વાય;  
 શેઠ અમરદાતાની ત્રિયારે, મોહીખાનું લેવા ચહાય. સ. ૧૫  
 ત્રણ શરતો છે તેહની રે, જે પાળી આપો રભૂનાથ!;  
 તોઝ મોહીખાનું લીએરે, પૂરે સધળી ઉચાથ. સ. ૧૬  
 ધૂમ સુણ્ણી રાજ રીજુયો રે, કક્ષલને કહે તામ;  
 શી શરતો છે તુમ તણ્ણી રે ?, કહી બતાવો હામ. સ. ૧૭  
 મુનિમ હુવે રાજ લણો રે, કહેશે શરતો તેહ;  
 શ્રોતાજન ! ભાવે સુણો રે, આગળ બનશે જેહ. સ. ૧૮  
 નિયતિહુરિ સૂરિરાજનો રે, રામ નમે કર જોડ;  
 ધર્ઘયારદી એ ઢાળમાં રે, પૂરાશે સતીનાં કોડ. સ. ૧૯

## દોહરા

શેઠાણ્ણીએ મુનિમને, કહી હતી જે વાત;

૬

મુનિમે પણ રાજ લણી, સંલળાવી હરખાત.

૧

સુણ્ણીને નૃપ રંજિત થઈ, કહે કક્ષલને તામ;

મહારે શરતો કખૂલ છે, જે કહી તમે તમામ.

૨

૧. મોહામાં. ૨. રાજા. ૩ દરેક જાતનો માલ.

|                                           |   |
|-------------------------------------------|---|
| લેખ કરીને આપીએ, ઉપર કરી વળી મોર;          | ૧ |
| તે લઈ કસ્તૂરી પ્રત્યે, સોંપે સુનિમ ચકોર.  | ૩ |
| આપી લેખ શેડાણીને, કહી સંભળાવી વાત;        | ૪ |
| તે સાંલળી સા સુંદરી, મન રળીયાયત થાત.      | ૫ |
| આપે શાબાશી સુનિમને, લદું કર્યું તુમે કામ; | ૬ |
| દોય સહસ્ર રેણીનારની, લેટ આપે ધરી હામ.     |   |
| લેટ હેખી રંજિત થઈ, તે કહે જેડી ઉપાણુ;     |   |
| આપણુ હવે કરવી સહી, વ્યાપારીને જણુ.        |   |

## ઢાળ ૧૨ મી

[ છકડ આંથા આંખળી રે-એ દેશા ]

તેહ સુણું સતી રીઓને રે, કહે સુનિમને રે વાણુ;  
આપણુ કશું કરવું નહિ રે, કરશે નૃપ પોતે જાણુ. લવિક જન !  
જુએ જુએ પુણ્ય પ્રલાવ, જેથી સીજે સઘળા દાવ.  
લવિક. એ ટેક ૧

એહવે ખીને દિન તિહાં રે, ખીનાં ગામેથી રે તામ;  
જન શક્ટો ભરી માલના રે, વહેંચવા આવે જમ્ભે લ. ૨  
વ્યાપારીએને કહે તદા રે, જુએ અમારો રે માલ;  
પસંદ પડે જે તુમને રે, તો ખરીદીને ધો ૪દામ. લ. ૩  
વ્યાપારીએ વળતું કહે રે, અમથી લેવાએ ન માલ;  
નૃપની સખત મનાઈ છે રે, આણુ ફેરવી નૃપે કાલ. લ. ૪  
રાજકુંખરનો વિવાહ છે રે, મોહીખાનુ તેથી દીધ;  
અમરદાના સુનિમને રે, જઈ કરે વાત પ્રસિદ્ધ. લ. ૫

૧ છાપ. ૨ સોનામહોર. ૩ હાથ. ૪ ચેસો.

તે તુમ માલ ખરીદશો રે, વ્યાપારીએ ઉત્તર દીધ;  
 માલ ધણી એમ સાંભળો રે, વાત તણી ગુજ લીધ. લ. ૬  
 કક્ષ પાસે આવીને રે, માલ ધણી કહે એમ;  
 અમ ગાડાં ચૌટે ઉલાં રે, માલ લીયો ધરી પ્રેમ. લ. ૭  
 મુનિમ કહે હા ભાઈઓ રે!, ચાલો જેઠાં તે માલ;  
 જો અમ સરીએ તે હશો રે, તો અમે લેશું ચાલ. લ. ૮  
 એમ કહી કક્ષ ચાલીયો રે, માલ ધણીની રે સાથ;  
 માલ જેઠાં તે કહે રે, શું લેશો તમે આથ?. લ. ૯  
 વળતું કહે તે મુનિમને રે, બજાર લાવે રે તેહ;  
 અમને પૈસા આપજો રે, માય લરી ધો ગેહ. લ. ૧૦  
 કક્ષ કહે પરવડે નહિ રે, અમે તો દેશું આ લાવ;  
 જો તમને પોશાએ તો રે, અમને ધો તુમે દાવ. લ. ૧૧  
 માલ વહેંચનારા એમ કહે રે, શેઠ શું કહો છો રે વાત?;  
 સામાં દામ અમ ધર તણું રે, દેવાં પડે અહો તાત! લ. ૧૨  
 એ અમને કેમ પરવડે રે?, વિચારી બુઝો તુમે મન;  
 અમે ગરીબ માણુસ અછું રે, હુઃખી અમારાં તન.<sup>૨</sup> લ. ૧૩  
 વળતું મુનિમજી એમ કહે રે, જો તુમ ધૂંચા રે હોય;  
 તો ધો માલ એ અમ લણી રે, નથી જોરાવરી કોય. લ. ૧૪  
 એમ સુણી માલ ધણી કહે રે, અમને પોશાએ ન એમ;  
 એદ કરતા ચાલતા થયા રે, આપણો કરવું કેમ?. લ. ૧૫  
 જો માલ વહેંચીએ આપણો રે, તો જાણે સામીરે ખોટ;  
 રાખ્યો પણ પરવડે નહિ રે, રાખ્યે ન રહે ખાવા લોટ. લ. ૧૬  
 એવા વિચારો કરતા થકારે, તૃશુકણો કને આવંત;  
 ચારાશી ચૌટા દેખીને રે, સહુનાં મન ઉદ્દલસંત. લ. ૧૭

૧ પૈસો. ૨ છોકરાં છૈયાં. ૩ ગાડાએ.

પણ લાઇ ! આપણું ભાગ્યમાં રે, નવી લખણું છેરે સુખ;  
 ઈંધાં માલ વહેંચાય નહિ રે, તો કેમ જાએ હુઃખ ? લ. ૧૮  
 નિશદ્ધિન શક્તો પાંચસેં રે, આવે બરીને રે માલ;  
 કેમે માલ વહેંચાય નહિ રે, અજારે મારી ધમાલ. લ. ૧૯  
 એમ આડ દિન વીતીયાં રે, શક્તો મળીયાં અપાર;  
 નગરના લોકો તેહથી રે, મુંજાએ પારાવાર. લ. ૨૦  
 હવે ભવિજન ! તમે સાંલળો રે, કકલ કરે જે રે જેલ;  
 પુષ્યથી વંછિત સંપજ્ઞે રે, અશુલ કર્મ દીયે ઠેલ. લ. ૨૧  
 બારમી ઢાળ પૂરી થઈ રે, હજી રહી અધૂરી રે વાત;  
 કર્મસિંહ શુરૂ રાયનો રે, રામ ગુણી ગુણુ ગાત. લ. ૨૨

### દોહરા

નગર તણુરે ચોકમાં, ગીરધી થઈ અપાર;

માલ ધણી મન ચિતવે, હુઃખી થયા આ વાર. ૧

સર્વે એક મતો કરી, શક્તોના માલીક;

કકલ પાસે આવીને, કહે થઈને સાહસીક. ૨

અમચો માલ તમે નવ લીએા, તો બીજથી ન લેવાય;

અમે શું કરીએ કહેા હવે ?, ઈંધાં પણ નહિ રહેવાય. ૩

માટે કહીએ તુમ લણું, લઈ વ્યો અમચો માલ;

તો અમે ધૂટા થઈ કરી, જર્દાએ ધર લણું ચાલ. ૪

તેહ સુણું કહે મુનિમજી, ધૂરથી કહી મેં વાત;

જે ઈચ્છા હોય તુમ તણું, તો લહીએ અપીઆત. ૫

### ઢાળ ૧૩ મી

[ માળા ક્યાં છે રે ? - એ દેશી ]

માલધણી કહે તવ મુનિમને, જેમ તમને ચોગ્ય લાગે રે;  
 અમે તો એસી એસીને કંટાજ્યા, હવે તો જઈએ આગે રે.

ભવિજન ! સુણુનો રે, પુષ્યવંતનું ચરિત્ર;  
 સુણીને દિલ ધરજો રે, ભવિજન ! સુણુનો રે. ૧  
 કુકલ વળતું કહે છે તેહને, અમને આમ પોશાશે રે;  
 એમ જો ઈચ્છા હોય તુમારો, તો તુમ ચિંતા સર્વ જશે રે.૧.૨  
 પૈસા પણ એ મહિને મળશે, જો તુમ ઈચ્છા હોય રે;  
 તો અમે માલ સર્વ તુમારો, ઠેડાંચાતો લઇયે સોય રે. ૩  
 માલધણીએ પણ મુંબણૂા, તેથી કખૂદ્યું સર્વ રે;  
 કુકલ બાપે પણ હુશીયારીથી, કામ કર્યું અગર્વારે. ૪  
 માલ પ્રપૂરિત<sup>૧</sup> શકટો સર્વ, ખરીહી તવ તેણું લીધાં રે;  
 નગરશોઠ ભણી તવ ઓલાવે, કહે નૃપથી ડોલ અમે કીધારે. ૫  
 વખાર તુમારો અમને જેશે, માલ ભરવાને કાજે રે;  
 તેથી ખાલી કરી આપો તુમે, જેઠશે આજના આજને રે. ૬  
 મુનિમનાં વયણૂા એવાં નિસુણી, શેડ મન એમ વિચારે રે;  
 સર્વ માલ ભર્યો છે રે વખારે, મેં કર્યું કામ અવિચારે રે. ૭  
 જે વળાર ન આપું તેહને, તો નૃપને તે ચેતાવે રે;  
 તો રાબા રીથ કરીને મુજને, સીધો બંધીખાને ઠાવે રે. ૮  
 વળી લોકોમાં લાજ મારી જાએ, ઉપર દંડ લીએ રેલૂકંત રે;  
 તો જીવનું મુજને થાએ મુશ્કીલ, વિચાર કરે છે એકાંતરે. ૯  
 જે આપું છું વખાર તેહને, તો માલ કિહાં તે નાંખું ?;  
 વાધ નહીનો ન્યાય મળ્યો છે, દિન મારું હીશે આંખું રે. ૧૦  
 એમ વિલિધ વિચારો તેણું કીધા, એક વાત નિશ્ચાગ કીધી રે;  
 મુનિમને એકાંતે મળીને, કહી એમ વાત જ સીધી રે. ૧૧  
 તમે સયણું છો ખરા અમારા, અમ લાજ તુમારે હાથે રે;  
 તેથી છાનું કહીએ તમને, વખાર દ્યો માલ સાથે રે. ૧૨

૧ ભરેલા. ૨ રાન.

૩

નૃપને તમે વાત મત કહેશો, અમે મોહીઆનું નવ લીધું રે;  
 અમે અલિક કણું તવ રાયને, અમ પાસે નથી સીધું રે. ૧૩  
 માટે સજજન જાણું તુમને, કીધી ગુજરી વાત રે;  
 એમ સુણીને તવ કુકલ કહે, અમને આમ પોશાશે રે. ૧૪  
 હોય જે મરજી તમારી દેવાની, તો અમે લહીયે અંતે રે;  
 ચૈસા ભગશે વિનાહ વીત્યે, સુણી અંગુલી દીયે દાંતે રે. ૧૫  
 લાજ પોતાની રાખવા માટે, થેડે કણૂદ્યું તેહ રે;  
 માલ સહિત વખારજ હીધી, ચલી આવે તવ ગેહ રે. ૧૬  
 કુર્તૂરીને સધગી વાતો, કહી સંભળાવી એમ રે;  
 તે સુણી સા અતિ મનમાં રીતી, હુવે આગળ થશે એમ રે. ૧૭  
 એકેક વ્યવહારીને નિશદ્ધિન, સુનિમ બોલાવી લાંઘે રે;  
 વખાર જોશે તુમારી અમને, એવાં વચન તેને દાખે રે. ૧૮  
 કુરકજ લોડી તે પણ તેને, સહ માલ વખારો આપે રે;  
 વાયદા કીધા છ મહિનાના, ધન આપવાના બાપે રે. ૧૯  
 રસ્વલ્ય મૂઢ્ય તેને આપે લેવે, મનમાં રાજ થાવે રે,  
 આમ બુદ્ધિના બળથી કુકલ, લક્ષમી ધણી ઉપાવે રે. ૨૦  
 હુવે લવિયણુ ! તમે લાવે નિસુણો, કોતુક થાવે આગે રે;  
 આળસ નિદ્રા ને વિકથાને, પરિહરજો વડ ભાગે રે; ૨૧  
 કર્મસિંહ સુરિરાજનો બાળક, રામેંહુડ કહે એમ રે;  
 તેરમી દાળે અધિક રસાળો, સાંલળો ધરીને પ્રેમ રે. ૨૨

### દોહરા

દેશો દિશો કેંકોત્તીઓ, મોકલી રાયે તામ;

આવજો વિનાહ ઉપરે, કુંવર તણે ધરી હામ.

૧

૧ દાથ ૨ થોડો. ૩ રામચંદ્રજી મુનિ.

- નૃપના આથહને વશો, ૧જનગણુ બહુ આવંત;  
દેરા તંયુ રાવઠી, ઉતારા કરી આપંત. ૨
- મોદીખાને જઈ જનો, જે જેઠાએ તે દેય;  
કુક્લ બાપો પણ તિહાં, આદર માનથી દેય. ૩
- આવનાર લોકો સહુ, રાજુ થયા અપાર;  
તે હેખી નૃપ ચિંતવે, કંકણે લીધ સંભાર. ૪
- એમ દિવસો ઉચ્છરંગમાં, જાતાં ન લાગે વાર;  
લઘુ તાણુ દિન આવિણુ, સહુને હર્ષ અપાર. ૫
- વરધોડે કુવર ચડયો, શોલા તણો નહિ પાર;  
ધવળ મંગળ ગાવે તિહાં, ગોરી મળો તે વાર. ૬
- ગણિંડા નાચે આગળે, વાજે વાળાં અનેક;  
એમ આડંખરે ચાલતાં, આવે તોરણે છેક. ૭
- પોખરણાં દેઈ પધરાવીએ, વરને માયરામાંય;  
ચોરી ખાંધી ચોકમાં, બહુલી શોલા બનાય. ૮
- જેખી જોખ લણે તિહાં, મંત્રોચ્ચાર કરંત;  
તિલને સરસવની તિહાં, રદ્વિજ આહૂતિ આપંત. ૯
- વિધિપૂર્વક વર કન્યકા, ચોરીએ ચડયા તે વાર;  
મંગળ ઝેરા ઝેરંયા, ધરી આનંદ અપાર. ૧૦
- તવ વર કન્યા બેહુને, પધરાંયા <sup>૩</sup>આગાર;  
સાજન સંતોષ્યા નૃપે, કરી પહેરામણું સાર. ૧૧
- રજ મેળવી ભૂધની, ખેંટા નિજ નિજ ધામ;  
હવે ભવિજન ! તમે સાંલળો, કુસ્તૂરી જે કરે કામ. ૧૨

૧ ધણુ માણુસો. ૨ ખાલણુ. ૩ ધર વિશે.

## ઢાળ હુણ મી

[ જ હો મથુરા નગરીને રાજ્યો લાલા !-એ દેશી ]

જુહો ધીને દિન હવે ભૂપતિ લાલા, એઠો સભામાં આય;  
જુહો મહાજન સર્વ મળો કરી લાલા,

વધાવો દેવા જય. અવિકળ !

સાંલળો અચરિજ વાત. ૧

જુહો નમન કરી એડા તિહાં લાલા, નૃપ કરે અતિ સન્માન; ૧  
જુહો નગરશોષ તવ ઉડીને લાલા, બાલે એમ કરી સાન. ૨  
જુહો વિવાહ વીત્યો ઉમંગથી લાલા, સહુને હર્ષ અપાર; ૩  
જુહો એહ પ્રસંગને લહી અમે લાલા, દદ્ધએ વધાવો આ વાર. ૪  
જુહો પાંચ હનાર દૃષ્ટયક<sup>૧</sup> ઈહાં લાલા, હું આગું ધરી હામ; ૫  
જુહો કૃપા કરી મો ઉપરે લાલા, અહેણુ કરો અભિરામ. ૬  
જુહો વારા ક્રરતી એમ સવે લાલા, આપે વધાવો તેહ; ૭  
જુહો સર્વ જણે આચ્યા પછી લાલા, કુકલ ઉઠ્યો સસનેહ. ૮  
જુહો ક્રન્નેડી ભૂધવ પ્રત્યે લાલા, બાપો કહે ધરી હામ; ૯  
જુહો અમરદા મુજ શેઠની લાલા, વલલા<sup>૨</sup> કસ્તૂરી નામ. ૧૦  
જુહો કુમર વિવાહ પ્રસંગમાં લાલા, મનમાં અતિ ઉમાય; ૧૧  
જુહો લક્ષ સુવર્ણ મુદ્રા<sup>૩</sup> ઈહાં લાલા, આપે વધાવો આંચ. ૧૨  
જુહો એમ સુણ્ણી વિસ્તિમત થયો લાલા, વળતું બાલે રાય; ૧૩  
જુહો શું કહો છો બાપા ! તુમે લાલા ?, નિશ્ચય ભૂલ્યા વાય. ૧૪  
જુહો વળતું મુનિમજી એમ કહે લાલા, નથી ભૂલ્યો મહારાય !; ૧૫  
જુહો એમ કહીને તતકણે લાલા, લક્ષ<sup>૪</sup> મુદ્રા<sup>૫</sup> તવ દેય ૧૬

૧ દૃપીયા. ૨ સ્વી. ૩ સેનામહોર. ૪ વચન. ૫ લાણ.

**સેનામહોર.**

જીહો તે હેખી પુરજન<sup>૧</sup> સહુ લાલા, અચરિજ પાભ્યાએમ; જીહો દિગ્ભૂદ થઈ એડા તિહાં લાલા, હવે તે કરવું કેમી<sup>૧૦</sup> જીહો ભૂપતિએ તવ સર્વને લાલા, કરી પહેરામણી હેત; જીહો જેહવું જેહતું જેટણું લાલા, તેહવું તેહને હેત. ૧૧ જીહો વળતું નૃપ વળી એમ વહે લાલા, કસ્તૂરી થઈ મુજ ઝેન; જીહો કુમરની ઝઈઅા થઈ હવે લાલા, તેથી બોલાવો એન. ૧૨ જીહો કુકલ બાપો એહ સાંલળી લાલા, હોડી આવ્યો તામ; જીહો શેઠ ત્રિયાની<sup>૨</sup> આગળે લાલા, સર્વ બાતમી કહી આમ. ૧૩. જીહો મુનિમ સુએ એમ સાંલળી લાલા, મનમાં થઈ તે ખુશાળ; જીહો ઉત્તમ વસનો<sup>૩</sup> પહેરિને લાલા, એડી થઈ ઉજમાળ. ૧૪ જીહો પૃથ્વીનાથે નિજ સેવકો લાલા, બોલાવ્યા ધરી નેહ; જીહો મિયાના સહિત તે માણુસો લાલા, મૂક્યા અમરદત્ત ગેહ. ૧૫ જીહો નૃપ આદેશો અનુચરો<sup>૪</sup> લાલા, કહે તવ જેડી પાણું<sup>૫</sup>; જીહો ધર્મ બંધુ હવે તુમ તણો લાલા, ભૂપ થયો છે સુભાણ. ૧૬ જીહો તે ભણી તુમને તેડે તિહાં લાલા, બાઈ! ચાલ્યો આ વાર; જીહો તે પણુ ભ્યાને બેસીને લાલા, ઘેંટી નૃપ દરખાર. ૧૭ જીહો હવે લવિજન! તમે સાંલળો લાલા, અચરિજ ધહાંને થાય; જીહો ચૌદમી ઢાળ રામે કહી લાલા, નિયતિહરિ સુપસાય. ૧૮

### દોહરા

વાહન એડી તે તદી, આવે રાજ દ્વાર;

આદર માન નૃપતિ દીચે, સા ભણી તેણી વાર. ૧

આજ થકી મુજ ઝેન છે, હું તુજ ધર્મનો ભાઈ;

તે ભણી સાસર વાસરો, તુજને કરું છું આંઈ. ૨

૧ નગરોના માણુસો. ૨ સ્વીની. ૩ કપડાં. ૪ સેવકોં. ૫ હાથ નેહને.

સાંભળતાં મહાજન જનો, વચ્છુ વદે નૃપ એમ;  
મુજ છેણને કાપડો,<sup>૧</sup> આપું છું ધરી ગ્રેમ. ૩  
ચાર ગામ દઉં તેહને, મનમાં આણી ચાહ;  
દર વર્ષે એકેકની, ઉપજ આવે છે પ્રાહ. ૪  
લક્ષ લક્ષ સહુ ગામની, વાર્ષિક થાએ પેદાસ;  
વંશ પરંપરા લેણવો, વાણી વદે નૃપ તાસ. ૫  
ભૂપ કથન એમ સાંભળી, મહાજન પામ્યો શોલ;<sup>૨</sup>  
અન્યો અન્ય કરી સાનને, ઉઠી ગયો ગત શોલ. ૬  
આહેર જઈ વાતો કરે, આપણુને થઈ એ શૂલ;  
એહ બાધાએ આપણા, કાગ્યા નાક અમૂલ. ૭  
પરસ્પર એમ ખોલતા, કષ્ટ્યો જવલને<sup>૩</sup> જવલંત; ૮  
સહુ રહેંતા નિજ નિજ ધરે, દ્વેષી થઈ અત્યંત.  
બેખ લહી બાઈ હવે, આવે નિજ આગાર;  
નિર્બિય સ્થાનકે રાખીને, હવે કરે હૃદય વિચાર. ૯

### ઢાળ ૧૫ મી

[ રાજ ને પરધાન રે-એ દેશી. ]

કસ્તૂરી મન ચિંતે દે, હવે કરું ઉપાય હું કાંઈ;  
જિમ મુજ ખોલ પળે ઈહાં એ.  
એમ આલોચી મન રે, મુનિમ ખોલાવીયો;  
ખોલે વચન એણી પરે એ. ૧  
આપા ! સુણુ મુજ વાત રે, મુજ મન કચ્છા થઈ;  
શેઠ તમારા છે નહિ એ.  
તિહાં લગે હું જાઉ રે, યાત્રા કરણુ લણી;  
પછે મુજથી નવ થાયશે એ. ૨

૧ સ્ફુર્યી-પસલી. ૨ એદ પામ્યો. ૩ અભિન વડો. ૪ બળો રહેલા.

એમ સુણ્ણીને સુનિમ રે, વળતું વહે ધરણું;  
શેડાણી શું આલીયા એ? ૧  
 ચાત્રા કરવાની અવસ્થા રે, હમણા તો મારી અછે;  
તે તમે મુજને રોકીએ એ ૩  
 વ્યવસાય<sup>૧</sup> કરણુંની ચિતારે, મુજ શિર નાંખીને,  
તુમે જાએ ચાત્રા ભણી એ.  
 પાછળ એ વ્યવસાય રે, તુમ વિષુ કેમ થશે?;  
આઈ! મન વિચારીએ એ. ૪  
 જરઠપણું<sup>૨</sup> મુજ દેહે રે, દેખાએ છે હવે ધણું;  
તેથી કામ સરે નહિ એ.  
 તુમને કહું છું તેથી રે, અધુના<sup>૩</sup> મતિ જાએ;  
પછી જાણે સુખે કરી એ. ૫  
 એમ સુણ્ણી સા સુંદરી રે, મન ચિંતે ધરણું;  
શું સમજે સુનિમળ એ?  
 મહારે જવું શ્યે કાજ રે? એ મનમાં સમજે નહિ;  
તેથી આદે એણી પરે એ. ૬  
 નિજ હાર્દને<sup>૪</sup> ગુપ્ત રે, રાખીને ભાંઝે તદા;  
આપા! સુણુ મુજ વાતડી એ.  
 વ્યાપારની મુજ મન રે, લેશ નહિ છે મુજ ચિતા;  
આપ અહિ બેઠા છતાં એ. ૭  
 તુમ ઉપર તો મુજને રે, પૂર્વ પણે વિશ્વાસ જ છે;  
તેથી કહું છું તુમ ભણી એ.  
 હમણા જો ન જવાએ રે, તો પછી આગળે;  
જાવાનો મોકા નહિ એ. ૮

૧ વ્યાપાર. ૨ ધરઠપણું. ૩ હમણા-હાલ. ૪ મનની ધારણા.

એટલી પણ મુજ હામ રે, શું નવ પૂરશો ?;  
 જનક સમા તુમને ગાયું એ.  
 સુષુંને એવાં વયણો રે, બાપો મન ચિતવે;  
 અહારે હવે કરવું કિશ્યું એ ?.

નો હું કરું નાકાર રે, તો તો ઓદું લાગશો;  
 એમ મનમાં આદોચીને એ.  
 વળતું એલે વૃદ્ધ રે, શેડાણું તુમે સાંભળો;  
 લારે શું જશો નજી એ ?.

નો એવડી તુજ મન રે, લારી ઉત્કંઢા અહે;  
 તો નાકારો કેમ કરું એ ?.

પણ ચિંતિત કરી સિદ્ધ રે, પાછા વળીને આવજો;  
 એહ વિનંતિ માહરી એ.

પણ સાથે કેટલા સહાયક<sup>૧</sup> રે, માણુસ દેશો તમે;  
 કયે હિન અહિથી ચાલવું એ ?.

એહવાં મુનિમનાં વયણો રે, સા નિસુષું કરી;  
 મનમાં રાજ થઈ ધણું એ.

પુલકિત<sup>૨</sup> વદને<sup>૩</sup> તામ રે, કેસ્તરી વદે;  
 લાગ્યવિધાયક<sup>૪</sup> હું ખરી એ.

વિનંતિ માની મુજ રે, ખાપાજ ! તમે;  
 મુજ મન શાંતિ થઈ ધણું એ.

એ દેખશ હું દાસ રે, એ દાસી વળી;  
 એટલા માણુસ લઈ કરી એ.

કાલે કરશું પ્રયાણ રે, શુલ કારજ લણી;  
 દીવ હવે કરવી નથી એ.

૧ સાથે રહેનાર. ૨ આનંદિત. ૩ રહેરે. ૪ ભાગ્યશાળી.

હવે રામા ઈહાં ઝંદ રે, રચ્છે કેહવા;  
તે નિસુણો સજજન! સહુ એ.  
પંદરમી વર દાળ રે, રામેંદુ સુનિએ કહી;  
નિયતિહરિ સુપ્રસાયથી એ. ૧૫  
દોહરા

ઓને દિન હવે કસ્તૂરી, જવા થઈ તૈયાર;  
દાસ દાસીને સજજ કરી, સાથે લે વિત<sup>૧</sup> અપાર. ૧  
ઘર લગાવી સુનિમને, દીધી લલામણુ સાર;  
આપા પાછળથી તમે, કરનો વણુજ બ્યાપાર. ૨  
એમ કહી સા સુંદરી, સોંપી ખહુલી આથ;  
રજા લઈને સુનિમની, ચાલી મળવા નાથ. ૩

### દાળ ૧૬ મી

[ દેશી-આ છે લાલની ]

ચાલી વિદેશો ખાસ, સાથે દાસી દાસ;  
આછે લાલ, સા મન ચિંતવે એણું પરે જ. ૧  
પતિ હોય જેણું દેશ, જાંબું તિહાં સુવિશેષ;  
આછે લાલ, એમ આવોચી મન મહિં જ. ૨  
ગામ નગર પુર દેશ, કરવા લાગી હમેશ;  
આછે લાલ, ધવ<sup>૨</sup> શોધનને ઉમહી જ. ૩  
કુરતી નવ નવા દેશ, ન મળ્યો કયાંય પ્રાણુશ; ૪  
આછે લાલ, મનમાં ચિંતવે એણું પરે જ.  
તવ મન પેડી ઝાળ, ઉલ્લી થઈ જંનળ;  
આછે લાલ, હવે મન ધીરજ હારતી જ. ૫

૧ ધન. ૨ પતિ. ૩ ઉત્કંડા વાળી થઈ. ૪ પતિ.

|                                          |    |
|------------------------------------------|----|
| વળી દૃઢતા ચિત્ત ધાર, મનશું કરતી વિચાર;   |    |
| આછે લાલ, એમ કેમ હિંમત હારવી જુ ?         | ૬  |
| કરવો ઉધમ આ વાર, તજુ કાયરતા સાર;          |    |
| આછે લાલ, પ્રયત્ને સહુ કારજ સરે જુ.       | ૭  |
| ચિત્ત આદોચી એમ, ઝરવા લાગી તેમ;           |    |
| આછે લાલ, ધરી કસ્તૂરી ઉમંગને જુ.          | ૮  |
| ઝરતાં ઝરતાં તેહ, આવી પહેંચી એહ;          |    |
| આછે લાલ, ઠાણાપુરને પરિસરે જુ.            | ૯  |
| ઝરકણું ડાખું નયણું, મળશે ધહાં સુજ સયણું; |    |
| આછે લાલ, મન રળીયાયત થઈ અતિ જુ.           | ૧૦ |
| પુરમાં પેસે ને વાર, શુકન થયાં શ્રીકાર;   |    |
| આછે લાલ, શેઠ ત્રિયા આનંદ લહી જુ.         | ૧૧ |
| આગળ ચાલી ને વાર, ધવં રસૂદ હેણે તે વાર;   |    |
| આછે લાલ, તવ નિશ્ચય એહે કીયો જુ.          | ૧૨ |
| છે સ્વામી આ ગામ, હવે સરશે સહુ કામ;       |    |
| આછે લાલ, સાતે ધાત ઉલ્લસિત થઈ જુ.         | ૧૩ |
| શોધું તેહનું હામ, પણી કરું મહારં કામ;    |    |
| આછે લાલ, એમ ત્રાદોચી ચિત્તમાં જુ.        | ૧૪ |
| તેની પાછળ તામ, ધારી મનમાં હામ;           |    |
| આછે લાલ, ચાલી ચતુરા ચતુરાઈ શું જુ.       | ૧૫ |
| પતિને દીઠો હાટ, હવે મન નહિ ઉચ્ચાટ;       |    |
| આછે લાલ, શાંતિ થઈ હવે હૃદ્યમાં જુ.       | ૧૬ |
| પાછી વળી તે વાર, આવે જિહાં પરિવાર;       |    |
| આછે લાલ, મનશું એમ નિશ્ચય કરી જુ.         | ૧૭ |

૧ ઋ. ૨ રસોધારો. ૩ વિચારી.

|                                         |    |
|-----------------------------------------|----|
| કરવી ચુક્તિ હવે કોઈ, જેમ કારજ સરે સોઈ;  |    |
| આછે લાલ, ઠાણાપુરથી સંચરી લુ.            | ૧૮ |
| સાથે દેઈ પરિવાર, ચાલી ગામથી બહાર;       |    |
| આછે લાલ, મનમાં અતિશય ૧ગઢગહીલ.           | ૧૯ |
| ભવિજન ! સુષુંજે મર્મ, કુસ્તરી કરે કર્મ; |    |
| આછે લાલ, આગળ વાત મીઠી અછે લુ.           | ૨૦ |
| સોણમી ઢાળ કહી એમ, રામચંદ્રે ધરી પ્રેમ;  |    |
| આછે લાલ, નિયતિહરિ સુપસાયથી લુ.          | ૨૧ |

### દોહરા

|                                              |   |
|----------------------------------------------|---|
| પરિજન સહિત સતી હવે, તિહાંથી ચાલી જય;         |   |
| વિચારે મનમાં કરે, કરે હવે ચુક્તિ આંય.        | ૧ |
| વાત ગોડવી ચિત્તમાં, આવે સોારઠ દેશ;           |   |
| દાસ દાસી એસારીને, વાત કરે સુવિશેષ.           | ૨ |
| સુખે સમાધે છહાં કહ્ણે, રહેને ધરી સમાધ;       |   |
| નિરખી ચારેક ગામડાં, કરી આવું નિરાખાધ,        | ૩ |
| સેવક દેંકો એમ કહે, અમે આવશું સાથ;            |   |
| વળતું કુસ્તરી વહે, ફૈકટ ન ફેરવું આથ.         | ૪ |
| રસ્તરવર હું આવીશ અહિં, તિહાં લગે રહો આ ઠોમે; |   |
| પછી સહુ લેગા મળી કરી, ચાલશું આપણે ગામ.       | ૫ |
| કુર્મ કહી આપે તેમને, પુષ્ટળ એસા હાથ;         |   |
| હળી મળી રહેને સહુ તમે, સધળો આપણો સાથ.        | ૬ |
| એમ સહુને સમજલવીને, મનમાં ધીરજ ધાર;           |   |
| અતિશય સુંદર ઉમહિષીએ, લીધી તેણે ચાર.          | ૭ |

૧ રાજ થતી, આનંદ પામતી. ૨ જલદી ઉતાવળી. ૩ લેસો.

શ્રીતાજન ! હવે સાંભળો, વામા જે કરે કામ;  
રસ પ્રપૂરિત<sup>૨</sup> એ ચરી, મન વચ રાખી ઠામ.

૮

### ઢાળ ૧૭ મી

[ અનિત જિલ્હાં શું પ્રીતડી-એ દેરી ]

બોંસો લઈ સા સુંદરી,

તવ ચાલી હો જિહાં છે ડાણુાપુર કે;

અદ્વ માંહે એહવે સમે,

થયાં તેહને હો શુલ શંકુનો છ્યાંદુર કે.

લાવ ધરી લવી ! સાંભળો. ૧

માલણુ પહેલી સામી મળી,

ક્રણ કૂલે હો લરી છાખ સુ ઠાય કે;

શંકુનો શુલ થાએ છહાં,

મન માંહેં હો રળીયાયત થાય કે.

ભા. ૨

પસુત તેડી સહામી મળી,

સુધવા તવ હો નારી ઈસુચંગ કે;

શ્રીક્રણ આપી કુમારિકા,

કરે તિલક તે હો ધરી મનમેં ઉમંગ કે. ભા. ૩

મચ્છ ઊયુગલ દાધિ દ્રુતિકા,

પનિહારી હો પાણી લરી તામ કે;

ધેનુ<sup>૧૦</sup> સ્વ-વચ્છ<sup>૧૧</sup> ધરુરાવતી,

મનમાં તવ હો રાજુ થઈ આમ કે. ભા. ૪

૧ સ્ની. ૨ રસથી લરેલી. ૩ ગામમાં પેસતાં. ૪ જાદી  
સાંદે ક્રણ દેખાડનાર. ૫ પુત્ર. ૬ સુંદર. ૭ એ. ૮ દહી. ૯ મારી.  
૧૦ ગાય. ૧૧ પોતાના અચ્યાને.

૧ અર રખાન ઉદ્ગરી કાગડો,  
 ૪ સારસ ને હો વળી સાંઠ શિયાળ કે;  
 ડાણાં એ હુઃઅને હરે,  
 શકુન શાખે હો કહ્યાં મંગળ માળ કે. લા. ૫  
 ૫ કુંસ કુરેવો જચીભરી,  
 ૮ હનુમંતને હો ૯ હરણાં સુખડારી કે;  
 જિમણ્ણા એ જયને કરે,  
 આપદ્ધી હો ઉદ્ગારણ ૧૦ સારો કે. લા. ૬  
 ૧૧ અહિ જો જમણ્ણા ઉત્તર્યો,  
 વળી ૧૨ નકુલજ હો સામો ૧૩ નીલચાસ કે,  
 તોરણ ખાંધે તેણું સમે,  
 તેમ ૧૪ ગણેશજ હો જમણ્ણા કહ્યો ખાસ કે. લા. ૭  
 એ શકુને ઉજાડ વસે,  
 સ્વી વાંગણી હો જણે પુત્ર રતન કે;  
 વિધા મૂરુણને આવડે,  
 ૧૫ કુમક તિહાં હો લહે નાન્ય સુયતન કે. લા. ૮  
 એહવાં શકુનો ૧૬ લાળીને,  
 તવ કુટૂરી હો મન થઈ રગીયાત કે;  
 છાંસથી નગર પ્રવેશ કરે,  
 ૧૭ આલીરિણી હો થઈને વિખ્યાત કે. લા. ૯  
 આવી માણુક ચોકમાં,  
 જિહાં રહી હો હાટ ૧૮ શ્રેણી અપાર કે;

---

૧ ગઢેડો. ૨ કુતરો. ૩ કાળી ચકલી. ૪ કુંલયું. ૫ ધડો.  
 ૬ ઉંડ. ૭ લેસવ. ૮ હનુમત. ૯ હરણીયા. ૧૦ સારી રીતે. ૧૧  
 સર્ફ. ૧૨ નોળીયો. ૧૩ એ પ્રસિદ્ધ પક્ષી. ૧૪ તિતર. ૧૫ લિખારી.  
 ૧૬ જોઈને. ૧૭ આહેરણી. ૧૮ હાટોની હાર-લેન.

આડું અવડું વિદેંકતી,  
તિહાં એડા હો દીશે સાહુકાર કે.      લા. ૧૦

એક હાટે ઉલ્લી રહી,  
કર જેડી હો તેને પૂછે એમ કે;  
શેડળ ! રહેવાને ઈહાં,  
કોઈ મળશે હો જગ્યા ઈહાં કેમ કે ?      લા. ૧૧

વળતું ઈલ્લિય વહે ઈશ્યુ,  
બાઈ મળશે હો જગ્યાઓ અનેક કે;  
તમને કેહવી જોઈશે ?,  
હેખાડું હો તુમને રાતિરેક કે.      લા. ૧૨

શું તુમચું રાતિરિધાન છે ?,  
વળી શું છે હો કહો તુમચી જાત કે, ?;  
તે કહો માહરી આગળે,  
સાચે સાચું હો તુમચું રાવદાત કે.      લા. ૧૩

તેહ સુણ્ણી ઘર આપશું,  
પણ લાડું હો પડશે આંહિં ભૂરિપ કે;  
તે પણ પહેલું આપશો,  
તો તુમને હો જગ્યા મળશે જરૂરી કે.      લા. ૧૪

એહવું સુણ્ણી સા સુંદરી,  
હુને કહેશે હો ઉત્તર રાવદાત કે;  
સત્તરમી ટાળ રામે કહી,  
લવિ ! સુણુઝો હો આગે મીડી વાત કે.      લા. ૧૫

૧ મહોટો સાહુકાર. ૨ અતિશય સરસ. ૩ તામ. ૪ ખરી ગાત.  
૫ ધાણું. ૬ મજનો.

## દોહરા

શેડનાં વયણો સાંલળી, કસ્તૂરી કહે આમ;  
 જાતે હું ભરવાડ છું, કુમગા માહરું નામ. ૧  
 શું લાડું દેશો તમે ?, તે કહો સુજને વાત;  
 જે પાતવશે સુજને, તો જ રહીશ અહિ ભાત!. ૨  
 ખંધુ ! શું તુમ નામ છે ?, તે દાખો સુખ એમ;  
 મોતી શાહ સુજ નામ છે, દુનીયા કહે છે એમ. ૩  
 માસ એકનું રોકડી, સાચું એક દીનાર;  
 લાડું પડશે અહિ કને, જે હોય બાઈ ! વિચાર. ૪  
 તો હું જગ્યા તુમ પ્રત્યે, દેખાડું તે સાર;  
 મહારે વાત કખૂવ છે, જે કહો તે આ વાર. ૫  
 કસ્તૂરી કહે શેડને, પણ હું કહું એક વાત;  
 સોળ ખંડ જોશે સુને, જિમ ધાચે સુખ સાત. ૬  
 શેડે આપી જાયગા, સા રહી તેની માહિ;  
 હુવે મન ચિંતે સુંદરી, કામ કરું રહી આહિ. ૭  
 ચારેક લૂત્યોડ રાખીને, કામ ચલાવે આમ;  
 હુવે શ્રોતાજન ! સાંલળો, શું કરે ઈંડાં રહી કામ ?. ૮

## દાણ ૧૮ મી

[ દેશી-હમીરાની. ]

અજખ બની રે આહેરડી, મલપતી<sup>૪</sup> મોહન<sup>૫</sup> વેલ; સહુલ્લાલી.  
 રૂપે રંભા હુરાવતી, ગજગતિ ચાલે સહેત. સ અ. ૧

૧-૨ એક સો. ૩ નોકરો. ૪ શોભતી. ૫ જોનારને વથ કરી  
 કે તેવી.

|                                                                        |  |
|------------------------------------------------------------------------|--|
| ધોળી ધાખળી પહેરણું, વિચ વિચ રાતી તાર; સ.                               |  |
| કુદે કાળાં કાંગરાં, ગળે શુંભને। <sup>૧</sup> હાર. સ. અ. ૨              |  |
| ઓદણું આધી લોંઘડી, <sup>૨</sup> તે આગળ શું ચીર?; સ.                     |  |
| પોષાયલી <sup>૩</sup> પટ્ટ અંતરે, <sup>૪</sup> હીશે દિવ્ય શરીર. સ. અ. ૩ |  |
| ભરત ભરેલી રે કંચુકો, <sup>૫</sup> કોમળ કમળ હો બાંહીં; સ.               |  |
| જાણું નાગ પાતાલકી, ધુઆ <sup>૭</sup> ઉત્તરી આંહિ. સ. અ. ૪               |  |
| વેણી વાસ ગજ નાગશી, <sup>૮</sup> ગજ ગજ લાંબા કેશ; સ.                    |  |
| ધૂધરીઆળો ગોઝણું, <sup>૯</sup> ઓાથ્યો <sup>૧૦</sup> અહ્લુત વેશ. સ. અ. ૫ |  |
| કસ કસ બેહુ કુમકાં, લટકે લોંઘડી <sup>૧૧</sup> માંય; સ                   |  |
| પાતાલ પેટી કૂટડી, જેખન લહેરે જાય. સ. અ. ૬                              |  |
| દંત અખૂકે દામની, <sup>૧૨</sup> સુખનો મટકો જેર; સ.                      |  |
| નથ નાકે થરકી રહી, જાણું કળાચ્યેલ <sup>૧૩</sup> મોર. સ. અ. ૭            |  |
| એવે વેશો ઓપી રહી, ચતુરા <sup>૧૪</sup> ચંપકવાન; સ.                      |  |
| ચુનડી ચટક લાગી રહી, ત્રોટી લટકે કાન. સ. અ. ૮                           |  |
| માથે મદુકી મહી <sup>૧૫</sup> તણી, ઈદોંણું તો અનુપ; સ.                  |  |
| લાંબી બાંહ લોડાવતી, ચાલી ધરીને મુંપ. સ. અ. ૯                           |  |
| મહીયારી મહી <sup>૧૬</sup> ઠેંચવા, શેરીએ પાડે સાદ; સ.                   |  |
| પોતાનું કામ સાધવા, સળ્યાં સોળ શ્રુતગાર. સ. અ. ૧૦                       |  |
| શેરીમાં ફેરી <sup>૧૭</sup> મારતી, જન <sup>૧૮</sup> પૂછે તેણું વાર; સ.  |  |
| શું મૂલ છે એ દુધનુ?; આહેરી ઘે પડકાર. સ. અ. ૧૧                          |  |

૧ ચણોડીનો. ૨ જડતનવારી. ૩ ટંકાયલી. ૪ વસ્ત્રની. ૫ અંદર  
 ૬ કાંચળા. ૭ દીકરી. ૮ સર્પ સરખો. ૯ ગાગરો. ૧૦ શોલતો  
 હતો. ૧૧ ઓદણી. ૧૨ વીજળી. ૧૩ અખાડો કરેલ. ૧૪ ચાંપાનાં  
 ફૂલના વર્ણ સરખા વર્ણ વાળી. ૧૫-૧૬ દુધ. ૧૭ ચકર મારતી,  
 આંટા મારતો. ૧૮ માણુસો.

મહારં ફ્રથ મોંધું અછે, તુમથી નવ પીવાય; સ.  
 ખીનારા પીશે ખરા, બોલે એવી વાય. સ. અ. ૧૨  
 ઝુગમ<sup>૧</sup> રૂપીએ શેર છે, વ્યો તુમ ઈચ્છા હોય; સ.  
 વળતું જન ગણું એમ કહે, આકર્ષિતુમ પયરે જોય. સ. અ. ૧૩  
 એમ સુણી આગે સંચરી, પાડે સુખ પોકાર; સ.  
 દિવસે ક્રેસા શહેરમાં, સાંજે આવે ઘર દ્વાર. સ. અ. ૧૪  
 કોઈ પણ ફ્રથ લીએ નહિ, મોંધું ધારીને દોક; સ.  
 મહીયારી કહે તેહને, પીશે જરૂર પય કોડ. સ. અ. ૧૫  
 સાંજે દુખિયાં વાછડાં, લેગાં કરી પાએ ફ્રથ; સ.  
 માંડો માંડે એમ કહે, એને નથી કાંઈ શુદ્ધ. સ. અ. ૧૬  
 કાનો કાને એ સાંભળી, દોકને સા કહે એમ; સ.  
 પૈસાની ભૂખી નહિ, છતાં ઠેણંચું પય કેમ? સ. અ. ૧૭  
 દોકા કદર કરે એહની, કેહલું સરસ સુજ ફ્રથ?; સ.  
 ગાંડી નથી હો બાઈએ!, હજી ઠેકાણે છે શુદ્ધ સ. અ. ૧૮  
 એમ પ્રત્યુત્તર આપતી, તુરત પાછી વળી જાય; સ.  
 ધવ<sup>૨</sup> સ્નોદ્રો એહવે આવીએ, ફ્રથ દેવાને ત્યાંય સ. અ. ૧૯  
 ફ્રથ દેલું છે માહરે, શું દેશો તુમે મૂલ્ય?; સ.  
 આહેરી કહે તેહને, બોલી વચન અમૂલ્ય. સ. અ. ૨૦  
 મૂલ્ય પૂછો કાં શેઠજી?, જ્યો ફ્રથનો સ્વાદ; સ.  
 પૈસાનું શું પૂછલું?, ન કર્દે તુમથી વાદ. સ. અ. ૨૧  
 એમ સુણીને સ્નોદ્રો કહે, કરો બાઈ! ચોણી વાત; સ.  
 તુમને અને અમને પછી, જેમ થાએ સુણ સાત. સ. અ. ૨૨  
 મહીયારી તેહને કહે, એ રૂપીએ છે શેર; સ  
 વ્યો ફ્રથ પી જુએ તુમે, વળતું ન બોલો ક્રેર. સ. અ. ૨૩

૧ એ. ૨ ફ્રથ. ૩ પતિ. ૪-૫ રસોઈએ.

૪

એમ સુણીને તે કહે, બાઈ નથી હું શેડ; સ. ૧  
 સુજ શેડ તે જૂદો અછે, હું તો કર્દું તસ વેડ. સ. અ. ૨૪  
 અડધો શેર આપો તુમે, દ્વો એ રૂપીએ એક; સ.  
 મહીયારી કહે તેહને, ઝારી પૂરી થઇ ટેક. સ. અ. ૨૫  
 હમણું પૈસા નવ લહું, જણ મહિનો પૂરો થાએ; સ.  
 ત્યારે આપણે સામઠા, તન તે પદ્ય<sup>૧</sup> લેધ જાએ. સ. અ. ૨૬  
 હવે શ્રોતાજન ! સાંલળો, વામા રચે કેવા કુંદ ?; સ.  
 ઢાળ અઢારમી એ કરી, શુરુ કૃપયા રામચંદ. સ. અ. ૨૭

### દાહરા

|                                                          |   |
|----------------------------------------------------------|---|
| કુંઘર લેધને ઘર ગયો, જમવા આવ્યો જામ;                      |   |
| જણ તેણે પદ્ય <sup>૨</sup> માંગીયું, સ્કૂરેજ આખ્યું તામ । | ૧ |
| અમરદસે પીધું યદા, તેહને પૂછે એમ;                         |   |
| એ પદ્ય <sup>૩</sup> કયાંથી લાવીએ, મિષ્ટ લાગે છે કેમ ?    | ૨ |
| ઈમ સાંસળી તે બોલીયો, આજ લીધું અન્ય ધેર;                  |   |
| પરદેશી મહીયારડી, રહી છે ઈંડાં સુપેર. <sup>૪</sup>        | ૩ |
| યુગમ <sup>૫</sup> રૂપીએ શેર છે, મેં લીધું અધશેર;         |   |
| ને તુમ પસંદ હોય તો, વારી લઈ આવું કેર. <sup>૬</sup>       | ૪ |

### ઢાળ ૧૬ મી

[ કોઈદો પરવા ધુંધદો લાલ રે-એ દેશી ]

શોઠ કહે એક શેર તું હો લ્યાત,  
 આવણે લેધ હુમેશ રે; હું વારી લાત.

૧-૨-૩-૫ દૂધ. ૪ રસોઈએ. ૬ સારી રીતે ૭ એ ૮ ફરીને,

ખીજુનાર.

હુકમ અછે તુને માહરો હો લાલ,  
આપી રોકડા કેશ રે. હું વારી લાલ.  
ચરિત્ર સુણો અમગા તથાં હો લાલ. ૧

રપાદપતિ કહે શેઠને હો લાલ,  
તુમ હુકમ છે પ્રમાણુ રે; હું.  
શેર શેર પથ લાવીશ સદા હો લાલ,  
પાણીશ તુમચી આણુ રે. હું. ચ. ૨

મેં પૈસા મહીયારીને હો લાલ,  
આપ્યા તેણું નવ લીધ રે; હું.  
મહિને પૂરે આપણે હો લાલ,  
ઓણી પરે સુજને કીધ રે. હું. ચ. ૩

અમરદત કહે સ્સૂદને હો લાલ,  
મહિને આપી હેઠે ઐવિત રે; હું.  
પઢી આળસ કરજો નહિ હો લાલ,  
કહું છું તુજને ખચીત રે. હું. ચ. ૪

માસ દિને પૈસા લેઈને હો લાલ,  
પધવ સ્સૂદ આંધો જમ રે; હું.  
મહીયારી કહે તેહને હો લાલ,  
તુમ શેઠને કહો આમ રે. હું. ચ. ૫

હુમણું રાખો તુમ કને હો લાલ,  
મને જેશો જે વાર રે; હું.  
લેઈ જાંશિ દ્વાર્ય હું તદા હો લાલ,  
આપણે તમે તે વાર રે. હું. ચ. ૬

૧-૪ પૈસા. ૨ રસોધિયો. ૩-૬ રસોધિયો. ૫ પતિ.

|                                 |            |
|---------------------------------|------------|
| ‘પાકકાર કહે શેઠને હો લાલ,       |            |
| મહીયારી પૈસા ન લીધ રે;          | હું.       |
| આપીશ હું જતે જઈ હો લાલ,         |            |
| રસ્ફુને શેઠે એમ કીધ રે.         | હું. ચ. ૭  |
| સાંજે પૈસા લેઈ કરી હો લાલ,      |            |
| આવે આહિરી ગેહ રે;               | હું.       |
| મહીયારીને એમ કહે હો લાલ,        |            |
| વ્યો તુમ પૈસા એહ રે.            | હું. ચ. ૮  |
| વળતું સા એણી પરે વહે હો લાલ,    |            |
| હમણું રાખો તુમ પાસ રે.          | હું.       |
| તુમ અમ ઘર એકજ અછે હો લાલ,       |            |
| અંતર નથી કાંઈ ખાસ રે.           | હું. ચ. ૯  |
| હું પૈસાની લૂખી નહિ હો લાલ;     |            |
| ગ્રેમની લૂખી છું સ્વામ રે !;    | હું.       |
| મુજ પયની કિમત થઈ હો લાલ,        |            |
| મને મળ્યાં સર્વ દામ રે.         | હું. ચ. ૧૦ |
| એમ કહી આંખો મારતી હો લાલ,       |            |
| ઉધવને ઝ્રસાવવા ઇંદ રે;          | હું.       |
| તુમ માણુસ પય લેઈને હો લાલ,      |            |
| આવે ઘરે અતિ મંદ રે.             | હું. ચ. ૧૧ |
| તેથી ફુધના સ્વાદમાં હો લાલ,     |            |
| ઝેર પડી જાઓ ઐંદ રે;             | હું.       |
| ખણું તાણું તાણું જો પીઓ હો લાલ, |            |
| તો લાગે ભારી પમિંદ રે.          | હું. ચ. ૧૨ |

૧-૨ રસોઈઓ. ૩ પતિ. ૪ ધણો. ૫ મીહું.

|                                           |            |
|-------------------------------------------|------------|
| એમ કહી પય કાઢીને હો લાલ,                  |            |
| આપે ધવને તત્ત્વ રે;                       | કું.       |
| વળતું શેડ એમ બોલીયો હો લાલ,               |            |
| અમથી પીવાએ ન અત્ર રે.                     | કું. ચ. ૧૩ |
| નયન નચાવી સા કહે હો લાલ,                  |            |
| અમચા મોંધા મેમાન રે!;                     | કું.       |
| ન પીએ તો સુજ સુંસ <sup>૨</sup> છે હો લાલ, |            |
| એટલું રાખો સુજ માન રે.                    | કું. ચ. ૧૪ |
| દટકે બાંધ લોડાવીને હો લાલ,                |            |
| મુખ આગે ધરે તામ રે;                       | કું.       |
| પુલકિત વદને શેડળ હો લાલ,                  |            |
| મહીયારીને કહે આમરે.                       | કું. ચ. ૧૫ |
| ના ન કહું તુમ પ્રેમથી હો લાલ,             |            |
| લાવો તુમ પય-પાત્ર <sup>૩</sup> રે;        | કું.       |
| ચય કચોણો પી ગયો હો લાલ,                   |            |
| ઉલ્લસિત થાતે ગાત્ર <sup>૪</sup> રે.       | કું. ચ. ૧૬ |
| તવ સા ધણુ <sup>૫</sup> ધવને કહે હો લાલ,   |            |
| નેયો એનો સ્વાદ રે;                        | કું.       |
| હવે નિત્ય નિત્ય ઈહાં આવજો હો લાલ,         |            |
| મન ધારી આહૃદાદ <sup>૬</sup> રે.           | કું. ચ. ૧૭ |
| હા કહીને તે ઉઠીયો હો લાલ,                 |            |
| ગયો પોતાને હુકાન રે;                      | કું.       |

૧ પતિ. ૨ સમ છે. ૩ દૂધનું વાસણ. ૪ શરીર. ૫ ઝી.

૬ હૃદ, પ્રેમ.

મન મૂક્યું તેણી કને હો લાલ,

તન<sup>૧</sup> રહ્યું નિજ સ્થાન રે.

હું. ચ. ૧૮

હવે અવિષ્ણુ ! તમે સાંલળો હો લાલ,

આગે કે છુંાં થાય રે;

હું.

દાળ એગાણ્ણિશરી ભાંખતાં હો લાલ,

રામ શુરુ શુણ ગાય રે.

હું. ચ. ૧૯

### દોહરા

ખાન પાન આવે નહિ, મનડે વસી સા નાર;

સૂતાં નિંદ આવે નહિ, એમ થયો શેડ ખુવાર. ૧

ચટપઠી મન લાગ્યા રહી, નારી મળવા કાજ;

શેડ વિચારે ચિત્તમાં, થયું અતીવ અકાજ. ૨

કામણુગારી એ ખરી, કામણુ કીધું એણુ;

મુજ ઝુદ્ધયમાં વસી રહી, ખટકે એનાં નેણુ. ૩

રજની<sup>૩</sup> તરફ્ફી નિર્ગંભી,<sup>૪</sup> પ્રકુલ્પિત થયો પ્રભાત,

શ્રોતાજન ! તમે સાંલળો, પ્રેમીજન અવહાત. ૪

### દાળ ૨૦ મી

[ નાનો નાહલો રે-એ દેશી. ]

ધવની શેરીએ સા ગઈ રે, દિવસ ચડયો ઘડી ચાર કે;

સાજન ! સાંલળો રે.

ખેડો દીડો બારળુ રે, તવ તિહાં નિજ ભરથાર<sup>૫</sup> કે સા. ૧

અમરદતો તવ તેહનુ રે, દેખી રૂપ અતૂલ કે; સા.

મૂછેં વળ હેતો થકો રે, પૂછે ફંધનુ મૂલ કે. સા ૨

૧ શરીર. ૨ આંખો. ૩ રાત. ૪ કાઢી. ૫ પતિ.

પતિનું સુખ હેઠી કરી રે, રાજ થધ સા અપાર કે;  
હાથમાં ભરો જળો લરી રે, હાતણું કરે તે વાર કે. ૩  
વાંકી મેલી પાઘડી રે, વળી છૂટી મેલી ચાર<sup>૧</sup> કે;  
બાણે રાજકુમારજી રે, ગળે મોતીનો હાર કે. ૪  
સુરધો<sup>૨</sup> જણ્ણે કેવડો રે, સરળો<sup>૩</sup> જણ્ણે ચંપક છોડ કે;  
કેશરીઓ<sup>૪</sup> કોડામણો<sup>૫</sup> રે, મૂછેં સુખનું મરોડ કે. ૫  
દેશન અમીય<sup>૬</sup> કચોળાં<sup>૭</sup> રે, મધ્યે રાતી જુણી રેખ કે;  
અણીયાળાં<sup>૮</sup> કાને અડયાં રે, કાને લાગી છે મેખું<sup>૯</sup> કે. ૬  
રંગલીનો રળીયામણો રે, એડો ઉંચે ઠામ કે;  
કસ્તૂરીઆ મૃગની પરે રે, લલકી રહ્યો અંગે કામ કે. ૭  
મહીયારી મન વિંતવે રે, ધરણી<sup>૧૦</sup> તળે એ ધન્ય કે;  
ગોં સહી તપ ઉંચાં તખ્યાં રે, પૂરાં કીધાં એણું પુષ્ય કે; ૮  
અમ મનમાં આદોચતી રે, રહી સુખ સામું જ્લેય કે;  
સાંભળો શોઠજી ! વિનંતિ રે, ચતુર સુખાણ છો તોય કે. ૯  
મૂલ કહેણું તુમ આગળે રે, બોલે મીડા બોલ કે;  
અળવે<sup>૧૧</sup> અંખ ઉલાળતી રે, ધૂંધટનો પટ<sup>૧૨</sup> બોલ કે. ૧૦  
તમે ઉત્તમ વ્યવહારીઆ રે, સમજે સંઘળી પેર કે;  
દાન પુષ્યે તુમે આગળા રે, જણ્ણે દરિયાની લહેર કે. ૧૧  
ઉંચી જાત આહેરની રે, નવ લહું નવ ને તેર કે;  
અમને કાંઈ ન આવડે રે, શેર મોટો કે પાશોર કે ? ૧૨  
મહીયારી તાણી ધૂંધટો રે, આણી અંગ ઉચ્છાહુ કે,  
વાત કરે વિનોદમાં રે, નાનુક નાંખી<sup>૧૩</sup> ખાંડ કે. ૧૩

૧ અંગરખાની ડોર. ૨ માયામાં નાખેલા તેલની સુગંધ. ૩  
નાકની ડાંડી. ૪ વરશાળ જેવા. ૫ હેંશિનો. ૬ અમૃતનાં. ૭ કચોળા-  
વાટકા. ૮ આંખના છેડા-અણી. ૯ કાનમાં પહેરવાનું ધરેણું. ૧૦  
પૃથ્વી. ૧૧ ચપળતાથી. ૧૨ પડો-વસ્ત્ર. ૧૩ ઉલાળતી.

દીકી નારી હીપતિ રે, નિરૂપમ રૂપ નિવાસ કે;  
 મન મજું હેખી કરી રે, શોઠ પૂછે કરી તાસ કે. ૧૪  
 કહો મહીયારી કિહાં વશો રે ?, કહો શું તમારું નામ કે ?;  
 કુણુ કુળે તું ઉપની રે ?, કોણુ છે તાહુરે ગામ કે ?. ૧૫  
 નામ કુમળા છે માહુરું રે, જાતની છું લરવાડ કે;  
 ઝનકપુરે વાસો વસું રે, મહો ઠેણું ચવા પાડું રાડ કે. ૧૬  
 સ્વામી છે શિર માહુરે રે, હણું નામે હુસ નાગ કે;  
 મહિષીઓ ૧ હુંજે ૨મંહિરે રે, દંડિં હુંધનો છે લાગ કે. ૧૭  
 પૂછો છો શ્યે કારણું રે ?, શું કરવો છે ડેવિશાળ કે ?,  
 ઊચી જાત માહુરી રે, દોાડ ચડાવશે આળ કે. ૧૮  
 વાતો ઓટી કાં કરો રે ?, રહ્ણારે ધરે છે કામ કે;  
 બાટ જોતાં હશે વાછડું રે, રીશ કરશે મોરા સ્વામ કે. ૧૯  
 એમ કહી નથન નથાવતી રે, સા ગઈ નિજ ધર ચાલ કે;  
 મહીયારી ગયા પણી રે, શેડના થયા એ હાલ કે. ૨૦  
 હવે અવિજન ! આગે સુણો રે, અચરિજ જે ઈહાં થાય કે;  
 વીશભી ઢાગ રામે કહી રે, નિયતિહરિ સુપંસાય કે. ૨૧

### દોહરા

શોઠ હવે મન ચિતવે, મહારા ચિતની ચોર;  
 હૈડામાંહિ વસી રહી, મેળવવા કરું હું દોર. ૧  
 જિમ તિમ કરી હિન કાઢીયુ, સાંજ પડી તે વાર;  
 હુંધ મિષે તેડને ધરે, આંથો ધરી અતિ ઘ્યાર. ૨  
 સા ઊઠી સન્સુખ ગઈ, આપે આદર માન;  
 અદે પધાર્યા શોઠળ !, કરે ખડુ શુણુ ગાન. ૩

૧ લેસો. ૨ થેર. ૩ સગપણ.

આસન આપ્યું એસવા, આપે ફોકર પાન;

૧ કનક કચોળામાં લહી, કરાવતી પથ પાન.

તેણે પથ પીધું યદ્દા, મનમાં થયો ખુશાળ;

૨ પાસે એસાડી કરી, કરતો ઘણું રૂક્ય ચાળ

૩ તુજ વિષુ સધળું વિશ્વમાં, શૂનું સમ સમસાન;

૪ અમર લાન ભૂલી કરી, કરે ૫ અધરામૃત ૪ પાન.

૬ ઘર ચિંતા છોડી કરી, રહ્યો મહીયારી ગેહ;

૭ હવે ઈંદ્રાં શું નીપજે ?, તે સુણુંને ધરી નેહ.

૪

૫

૬

૭

## દાળ ૨૧ મી

[ વૈદરભી વનમાં વિલવિલે-એ દેશી. ]

રાત દિવસું તેહને ધરે, શેઠ રહે ધરી નેહ;

૧ વ્યાપાર વણિજ તેણે તદા, છોડી હીધે એહ.

ધિગ ધિગ વિષયી પ્રાણીને !.

૧

કોઈ કોઈ સમયે શેઠજી, વખારે જોવા જાય;

૨ પસ્વદ્દપ સમય તિહાં રહી, ફરી મહીયારો ધરે આય. ધિગ.

૩ સુનિમો મનમાં ચિંતવે, શેઠ ઈંદ્રાં નવી આય;

૪ ધૂતારી ધૂતી કરી, મહીયારી સર્વ આય.

ધિગ. ૩

૫ એમ વિચારી ધન ધણું, તેમણે ધર લેણું કીધ;

૬ કંક સમયમાં એણી પરે, તેમનું કારજ સિદ્ધ. ધિગ. ૪

૭ એમ કરતાં તો વહી ગયા, મહિના ૮ ખટ તે વાર;

૮ સુનિમો શેઠને એમ કહે, સાંલળો અમરી ૯ કાર. ધિગ. ૫

૧ સોનાના. ૨ સ્લન-આંગળના ચાળા. ૩ હોડ રૂપી અમૃતનું.

૪ ચુંઘન. ૫ થોડું. ૬ ૭. ૭ વિનંતિ

વ्यापारे ખોટ ગઈ ધણી, વળી દૂષી ગયાં ઠહાણું;  
ભાંડારો યે ખાલી થયા, સાંલળો ચતુર સુનણું !. ધિગ. ૬  
હવે શું કરવું આપણે ?, તે ભાંખો તુમે સ્વામ !,  
કો વિત્ત આપો અમ પ્રત્યે, તો કરીએ વળી કામ. ધિગ. ૭  
મુનિમો મુખથી સાંલળી, શોઠ થયા રે ઉદાસ;  
હવે શું કરવું માહરે ?, કયાંથી લાવવી રાસ ?. ધિગ. ૮  
ઇહાં કણે મહારો કોઈ નહિ, સગો એણાખીતો મિત;  
પોકારું કેની કને ?, થધુ પીડા મુજ ચિત. ધિગ. ૯  
વ્યાપાર બંધ કરું કહિ, તો જાએ મુજ લાજ;  
ઈમ શોઠ મનમાં ચિતવે, શું કરું હું હવે કાજ ?. ધિગ. ૧૦  
એમ ચિતા કરતો હવે, ગયો મહીયારી ગેહ;  
રૂપુલક્ષિત વફને તેહને, પૂછે ધરી બહુ નેહ. ધિગ. ૧૧  
આજે કેમ ઉદાસીયા ?, દીશો છો અહો શોઠ ?;  
વળતું અમરદાત ઓલીયો, સાંલળા કહું છું નેહ. ધિગ. ૧૨  
મહારી લાજ જવા તણો, આવ્યો વખત જ એહ;  
મુનિમોએ ગોટો વાળીયો, કહેવું કેને તેહ ?. ધિગ. ૧૩  
કયાંથી પૈસો આપવો ?, તેથી ઉદાસીન ચિત;  
કલાકિત જીવને જીવતાં, મહારે મરવું ખરીત. ધિગ. ૧૪  
ચેતાવવા આવ્યો તુજ કને, હવે જાર્દિશ મુજ ગેહ;  
મરણ શરણ મહારે હન્ને !, એમ કહી ઉઠ્યો તેહ. ધિગ. ૧૫  
એમ સુણી સા સુંદરી, આપે ધીરજ તામ;  
આકળા આમ કાં થાએ છો ?, સમતા ધારો સ્વામ !. ધિગ. ૧૬  
હવે સહુ કો તુમે સાંલળો, એક મને રે સદાય;  
એકવીશ ઢાળ પૂરી કરી, રામચંદ્રે ઉમાય. ધિગ. ૧૭

૧ પૈસો. ૨ હરતે મોણ.

## દોહરા

કરનેડી એમ પૂછતી, અહો સુજ પ્રાણુધાર !;

સાચે સાચી સુજ કને, વાત કહો નિરધાર.

૧

ને ન કહો તો તુમને, સુજ ગળાના સુંસ.

મારે અંતર છોડીને, કહો ધરીને રહુંસ.

૨

એમ સુખુને શોઠળ, વળતું બોવે એમ;

સુલગો ! સુષુ સુજ વાતડી, સુજને કહેતાં તેમ.

૩

મુનિમાએ જ હુકાનમાં, કર્યો ગોટાળો તેહ;

પૈસા સુજ ખાઇ ગયા, એહ ચિંતા સુજ દેહ.

૪

લાજ જય હુનીયા ભર્ણિ, શું લુંધામાં સાર ?;

એહ ચિંતા સુજ મન વિષે, હુવે જાઈશ હું ઝાર.

૫

એમ કહી જખ ઉઠીયો, કર પકડી જ્ઞા નાર;

આચહ સહિત બેસાડીને, કરે ધણી મનોહાર.

૬

## ઢાણ ૨૨ મી

[ તોરણુથી રથ ફેરીયો રે હાં-એ દેરા ]

ધર લિંતર સા જઈ કરી રે હાં, લાવી સોનોમારો તામ;  
સંજગન ! સાંખળો.

વીશ સહસ્રની થેલિકા રે હાં, આપે આમરને લામ. સ. ૧

તે દેખોને આમર કહે રે હાં, તહારી કેમ લેવાય ?; સ.

સુંદરી વળતું એમ કહે રે હાં, શું કરવા ન લેવાય ?. સ. ૨

મહારા ને તહારા વચ્ચે રે હાં, ક્યો અંતર છે સ્વામ ! ?; સ.

જ્હાલા ! પ્રાણ આપું ખરી રે હાં, તો મહોરાની શી મામ ? ? . સ. ૩

૧ સમ, સોગન. ૨ પ્રેમ-આહુલાદ. ૩ અરજી. ૪ જી. ૫ વાત.

અતિશય આથડે આપીને રે હાં, શેઠનું મનહું મનાય; સ. ૪  
 ગાઝગાઝ સ્વરથી એમ વહે રે હાં, અમરહત્તા તવ લાય. સ. ૪  
 તુમ પાસેથી કેમ લહું રે હાં ?, લેતાં આવે લાજ; સ.  
 છારે તુજે આપવી રે હાં, સધળી વાતે સહાજ. સ. ૫  
 એમ સુણુને સા વહે રે હાં, તું સુજ જીવનાધાર; સ.  
 પૈસા એ હાથનો મેલ છે રે હાં, ફરી નવ કરશો ઉચ્ચાર. સ. ૬  
 જે આદો તો આપને રે હાં, છે સુજ ગગાના સુંસ; સ.  
 કૃત કૃત્ય થધ તેને કહે રે હાં, તેં પૂરી મન હુંસ. સ. ૭  
 અલિહારી તુજ લખગમે રે હાં, વિધાતા છે અનુરૂળ; સ.  
 સજજન સહેને પરગડા<sup>૧</sup> રે હાં, કરે ઉપકાર અમૂલ. સ. ૮  
 હેડું હેને ગહુગહે<sup>૨</sup> રે હાં, ઉત્તમ જનને સંગ; સ.  
 આણુચિંતયા સાજન મળે રે હાં, તે આળસમાં <sup>૩</sup>ગંગ. સ. ૯  
 સજજન સહેને પરગળુ રે હાં, હુઃખ્યાના આધાર; સ.  
 વારી જાઉં તેહને રે હાં, ચંદ્રિ <sup>૪</sup>સર્જનહાર. સ. ૧૦  
 અસકળ વસ્તુ હૃષિત કરી રે હાં, ચૂક્યો છે કિરતાર; સ.  
 પણુ સાજન ઘડતાં કરી રે હાં, ચતુરાઈ પારાવાર. સ. ૧૧  
 સ્વાર્થ તળુ પર કાર્યમાં રે હાં, સમરથ સુશુષ્ણા હુંત; સ.  
 ચંદ્ર ધ્વળા<sup>૫</sup> યશ શાખુતું રે હાં, દિન દિન જસ પ્રસરંત. સ. ૧૨

---

૧ પ્રસિદ્ધ. ૨ આનંદ પામે. ૩ ગંગા. ૪ વિધાતા-ખલા.  
 ૫ ધોળું.

### અસવૈયો

આરો કીએ! હૈ પયોનિધિ ડા પય, કારો કીએ પિડ સો અનુમાનો,  
 કંટકદાર ગુલાય કીએ અર, ચાતક ખાર હી માસ નરાનો;  
 પંકડા અંક કીએ હૈ મયંક મે, આગ કીએ હૈ યકોરડા ખાનો,  
 સાગર મિત સમે પરખા કરો, હંસપતિ હર વાહન જનો. ૧

\*જગ જન સુખિયા દેણીને રે હાં, સંત લહે સંતોષ; સ.  
 હુહુંયા જ્ઞાઠે માણુસે રે હાં, પણુ નાણે મન રોષ. સ. ૧૩  
 તરું તટિની<sup>૨</sup> ધણુ ધેનુકા<sup>૩</sup> રે હાં, સંત શશી<sup>૪</sup> હીનકાર;<sup>૫</sup> સ.  
 ભિત્ત કહ્યાં, વિષુ સ્વારથે રે હાં, કરતાં જગ ઉપકાર. સ. ૧૪  
 એહવું સાંભળીને કહે રે હાં, કુસ્તૂરી ઉમાય; સ.  
 મત શરમાવો મને ધણી રે હાં, બોલીને ગણોળી વાય. સ. ૧૫  
 હું પણુ દાસી આપની રે હાં, તો પૈસાની શી વાત ?; સ.  
 મુજ વિત્ત<sup>૬</sup> એ છે આપનુ રે હાં, મૂકો હવે પંચાત. સ. ૧૬  
 શેડ હવે મહોરો લઈ રે હાં, ઘેંટો પોતાને દુકાન; સ.  
 નિજ પ્રાણેશ<sup>૭</sup> ગયા પછી રે હાં, સતી ચિન્તે ધરી માન. સ. ૧૭  
 જે કારણુથી હું ઈહાં રે હાં, આવી હતી ધરી હામ; સ.  
 તે કારજ માહરું સર્થુ રે હાં, હવે જલું નિજ ધામ. સ. ૧૮  
 પણુ સ્વામીના મન વિષે રે હાં, શંકાન આવે લેશ; સ.  
 એવો ઉપાય કરવો હવે રે હાં, મહારે ભજવવો વેશ. સ. ૧૯  
 દસતિતથી<sup>૮</sup> સાંભળો રે હાં, વામાં<sup>૯</sup> રચે શું ઝંદ; સ.  
 રસિક વાત આગે ધણી રે હાં, સુષૃતાં ધાયે આનંદ. સ. ૨૦

### \*છાપયુ

અગર અગત પર ધરત જરત સુગંધ પ્રકાશે,

લસત કસત કલધૌત છરત તંદુલ દુતિ ભાસે;

દુધ તપત દધિ ભથત ધસત ચંદ્ન મૃગ ઐનુ,

તિલે તૈલ રસ છંસુ પગ બંધત પણ ધેનુ;

ફુલ હેત અંધ પથ્થર હન્તત, ગનપતિ સંચરી ઉચ્ચરે;

કુલવંત સંત સજજન પુરષ, ગિનેંન અવગુન ગુન કરે.

૧ ઝાડ. ૨ નદી. ૩ ગાયો. ૪ ચંદ્ર. ૫ સર્થ. ૬ પૈસા. ૭ પતિ.

૮ સાવધાન થઈને. ૯ ખી.

નિયતિહરિ સૂરિરાજનો રે હાં, શિષ્ય મુનિ રામચંદ; સ.  
આવીશ લાળ પૂરી કરી રે હાં, વર્તે પૃથુનંદ. સ. ૨૧  
દેખરો:

પ્રભાવરી<sup>૧</sup> પૂરણ થઈ, પ્રકુલ્પિત થયો પ્રભાત;  
અમરદત્ત ઉઠી કરી, જઈ એડો એકંત. ૧

મન ચિંતે એણી પરે, કરું વ્યાપાર ખચીત;  
મહીયારીએ અહિં મને, પુષ્કળ દીધું વિત્ત. ૨

અહો ! સંજગનતા એહની, કિહાં નિર્ણયુતા સુજ;  
હજી ઈહાં એડો અછું, થડુને તદ્દન અખુત. ૩

વાટ જેતી હુશે માહરી, તો જાઉં હુલે અટ;  
એમ આદોચી ઉડીયો, ચાલવા લાગ્યો સટ. ૪

તેમ હુંધું પીવા તણી, તાલાવેદી મન;  
ચાલી આવ્યો ઉતાવણો, મહીયારીને સદ્ધન. ૫

ધવને<sup>૬</sup> આવતો ભાગીને,<sup>૭</sup> સા થઈ ચિત્ત ઝુશાળ;  
ચિંતે નિશ્ચય માહરી, જાશે સહુ જંબળ. ૬

સા આવી તે સન્મુખે, પુલકિત<sup>૮</sup> વદ્દને તામ;  
કરકજી<sup>૯</sup> જોડીને વહે, સાર કરી મુજ સ્વામ ! ૭

આદર સહિત આગારમાં,<sup>૧૦</sup> તેડી લાવી નાથ;<sup>૧૧</sup>  
આસન આખ્યું બેસવા, લટકો કરતી હાથ. ૮

લાન ભૂલી કહે શેડજી, મહીયારીને એમ;  
સુલગે ! તમે પણ અહિં કને, બેસો ધરીને ગ્રેમ. ૯

સા પણ તિહાં હળવે કરી, બેસી ગઈ તસ પાસ;  
વાતોના જ વિનોદમાં, જોડી દીધો તાસ. ૧૦

૧ રાત્રિ. ૨ ચૈસો. ૩ ધરે. ૪ પતિને. ૫ દેખીતે. ૬ હસતે  
મોદે. ૭ એ હાથ જોડીને. ૮ ધરમાં. ૯ પતિ.

કસ્તૂરી દ્વે ઉઠીને, પય લાવીને તેહ;  
સ્વા<sup>૧</sup> હાથે પીવરાવીયું, અંતરમાં ધરી નેહ      ૧૧  
પયઃપાત કીધા પદ્ધી, વાંમાનેર કહે એમ;  
તું સુજ જીવન-ઓષધી, નથી બોલતી કેમ ?      ૧૨  
અવસર આવ્યો લાળીને, તવ બોલી સા નાર;  
સુજ મનોરથ પૂરશો, અહો જીવનાધાર !      ૧૩  
તે સાંભળીને કહે અમર, બોલ જે ઈચ્છા હોય;  
પ્રાણુંતે પણ તાહરી, પૂરીશ હું સહુ કેય.      ૧૪  
શ્રોતાજન ! હવે સાંભળો, દયિત <sup>૩</sup> શું કરે કામ ?;  
ખાદ્ય આકારો ગોપવી, હવે બોલી સા તામ.      ૧૫

### ઢાળ ૨૭ મી

[ કરણેડી મંત્રી કહે-એ દેશી. ]

કરણેડી સા સુંદરી, બોલે પ્રીતમશું વાય; સ્વામીજી !  
અધુના ગ્રેમ બતાવો છો, પદ્ધી સાર ન લેશો કાંય. સ્વા.  
કરણેડી કહે સુંદરી.      ૧  
એહાં સાંભળી શોડ તે, વળતું કહે શુચિગાત; <sup>૪</sup> સલુણ્ણી !  
એમ કેમ તું બોલે અછે ?, એહવી નહિ સુજ જાત સલુણ્ણી ! ક ૨  
તહારે મન શી વાત છે ?, તે કહે અંતર બોલ; સ.  
પ્રાણુ જે જેધએ માહેરા, તો બે એ સુજ કેવ. સ. ક. ૩  
જે મને સ્ત્રારથી ધારતી, હો તો તું છે અજ્ઞાન; સ.  
આણુંતે પણ તુજને, છોડું નહિ અખીયાત. <sup>૫</sup> સ. ક. ૪

૧ પોતાને હાથે. ૨-૩ ખ્રી. ૪ પવિત્ર શરીરસાળા. ૫ નકી-  
નિશ્ચ.

જમણું હાથનો તુજને, કોલ આપું આ વાર; સ.  
 જે દુચ્છા હોય અંતરે, સુખે કહે આખું ખ્યાર. સ. ક. ૫.  
 ધવં<sup>૧</sup> મુળાથી એમ સાંભળી, વળતું વહે સા નાર; સ્વા.  
 એ તો અમથું<sup>૨</sup> કહેવાય છે, કરતાં લાગે વાર. સ્વા. ક. ૬  
 કહેવું જગમાં સોહેલું, પણ કરવું મુશ્કેલ; સ્વા.  
 કહેતાં વાર લાગે નહિ, કરતાં થાએ એત. સ્વા. ક. ૭  
 એહવાં વચનો સાંભળી, કહે અમરદત્ત એમ; સલુ.  
 કાં ઝોગટ ચાળા કરે ?, એમ કર્યે જાએ પ્રેમ. સ. ક. ૮  
 જે માંગવું હોય તાહરે, કહેને સુખેથી તેહ; સ.  
 ઉકંથ સુખે એમ સાંભળી, તવ સા ધરી નેહ. સ્વા. ક. ૯  
 હળવે રહી એમ બોલતી, સુણો સ્વામી ! મુજ વાત; સ્વા.  
 નામાંકિત તુમ મુદ્રાદી, આપો મન કરી શાંત. સ્વા. ક. ૧૦  
 મુણ મલકાવીને કહે, શોઠ તે તોણ્ણી વાર; સ.  
 એહ તમે શું માંગીયું ?, ન કર્યો કાંઈ વિચાર. સ. ક. ૧૧  
 એમાં શું રહારે આપવું ?, અવર માંગી લીયો કાંઈ; સ.  
 તુમને આપું જો મુદ્રાદી, મુજ થાએ લધુતા આંઈ. સ. ક. ૧૨  
 અવર જે કહે તે તાહરી, પૂર્ણ દુચ્છા અધીન; સ.  
 એમ કહુને શેહજી, સન્મુણ જોવે પાદ્ધીન. સ. ક. ૧૩  
 એહ સુણ્ણી કહે સુંદરી, વહન જાંખું ધરી એમ; સ.  
 મામૂલી એ મુદ્રાદી, હેતાં ન ધરો પ્રેમ. સ્વા. ક. ૧૪  
 અવર માંગ્યું શું આપશો ?, મેં જાણી તુમ પ્રીત; સ્વા.  
 એમ કહી સા સુંદરી, રડતી નીસાસા સહિત. સ્વા. ક. ૧૫  
 અમરદત્ત એહ હેખીને, તવ બોલે એમ વાય; સ.  
 કે આ કરની મુદ્રાદી, તું ઉણ્ણી મનથી મત થાય. સ. ક. ૧૬

૧-૩ પતિના. ૨ ઝોગટ. ૪-૭ વીટી. ૫ ઐહ વગર. ૬ મોહું.

પણ તુજને પૂછું ઈહાં, તેં એમાં શ્યો દીઠો માલ ?; સ. ૧૦  
કાં એવડો હક લઈ કરી, હુઃખ આણે અસરાળ ? . સ. ૧૭  
તેનું કારણું કાંઈ મુજથી, નથી સમજાતું એહા; સ.  
માટે દ્વિલ ઓલી કરી, સમજાવ આણું નેહ. સ. ૧૮  
૧ કરકજ નેડી સા કહે, એમાં કારણ છે કાંઈ; સ્વા.  
દ્યો સમજાવું તુમ લણ્ણી, ખલ ખંગ મૂકી આંઈ. સ્વા. ૧૬  
મુજ કહેતાં તુમે સાંલળો, એક ચિંતે મુજ નાથ !; સ્વા;  
હવે રવામા કહેશે ઈહાં, તે સાંલળો સહુ સાથ. સ. ૨૦  
નિયતિહરિ સૂરિરાજનો, રામેંદુ કહે વાત; સ.  
ત્રેવીશ ઢાળ પૂરી થઈ, સ્વણૂ ત્રૈશ અવદાત. સ. ૨૧

### દ્વાહરા

તવ કર દ્વયું નેડી કરી, મહોયારી કહે એમ;  
તમે કારણ ને પૂછીયું, તે સાંલળો ધરી ગ્રેમ. ૧  
મુજ શુઅની એ વાતડી, નથી કહી તુમ પાસ;  
ત્યાં લગે પ્રીતડી દાખવો, સુણ્ણીને મૂક્યો ખાસ. ૨  
એમ કહી સા સુંદરી, કહેવા લાગી વાત;  
આમરહત તવ સાંલળો, મન રાખી એકાંત. ૩

### ઢાળ ૨૪ મી

[ જિન વચ્ચે વૈરાગીયો હો ધના !-એ દેશી. ]

કરનેડી કહે કંથને હો સ્વામી !, સાંલળો માહરી વાત,  
મુદ્રિકા<sup>૫</sup> લેવા તાણું હો સ્વામી !, કારણું કહું એકાંત રે;  
હો મોરા સ્વામી !, વાત સુણ્ણો અલિરામ. ૧

૧ એ હાથ. ૨ સ્વી. ૩ બાકી રહેલ. ૪ એ. ૫ વીટી.

આશા છે ઈહાં માહરે હો સ્વામી !, માસ થયા ત્રણુ આજ,  
એ સુજ ગુઝની વાતડી હો સ્વામી ! તુમને કહી છોડી લાજ રે;  
હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૨

જ્યારે સુજ સુત જનમશે હો સ્વામી !, ત્યારે ધડાવીશ હાર,  
તેહ વિચે આ સુદરી<sup>૧</sup> હો સ્વામી !, રાખીશ હું ધરી ઘ્યાર રે;  
હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૩

તુમે તો સુજને છોડશો હો સ્વામી !, એ સુજ મન અંદેશ,  
ક્રી સામે જોશો નહિ હો સ્વામી !, મૂકશો નહિ સંદેશ રે;  
હો મોરા સ્વામી ! વાત સુણો અલિરામ. ૪

એટદે એ વીંગી જેઈને હો સ્વામી !, સંભારીશ તુમ નામ;  
માંગી છે એ કારણે હો સ્વામી !, અવર નહિ કાંઈ કામ રે.  
હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૫

એમ સુણીને શેઠળ હો આતમ !, મનમાં થયો તે ઉદાસ;  
હુંએ તો મારી ઈહાં કને હો આતમ !, જાણે લાજ તે ખાસ રે.  
હો મોરા આતમ !, વાત પડી રે વિચાર. ૬

જગત્માં આ સુજ વાતડી હો આતમ !, જનગણુ<sup>૨</sup> બાણુશે જામ;  
સુજને વિશ્વમાં<sup>૩</sup> લુલું રે આતમ ! સુસ્કેલ થાશે તામરે.  
હો મોરા આતમ !, વાત પડી રે વિચાર. ૭

વદન<sup>૪</sup> કમળ આંખું થયું હો શ્રોતા !, શેઠનું તિહાં તે વાર;  
આ રે અજાણ્યા શહેરમાં હો આતમ !, કોણું કરે મારી સાર રે ?.  
હો મોરા આતમ !, વાત પડી રે વિચાર. ૮

હુળે રહીને બાલીયો હો લામા !, નારનિ કહે એમ;  
કમળા ! તેં લારે કરી હો લામા !, હું કરલું છે હેમ ? રે.  
હો મોરી લામા !, વાત સુણો અલિરામ. ૯

૧ વીઠી. ૨ સમાચાર. ૩ ધણુ માણુસો. ૪ જગતમાં. ૫ મોહું,  
મુખ. ૬ ખ્રી.

મહારી લાજ જશે ખરી હો ૧લામા !,  
સુખ બતાવીશ કેમ ?;  
એ કરતાં મરવું લડું હો ૨લામા !,  
લાજ ન જાઓ જેમ રે.

હો મોરી લામા, વાત સુણો અલિરામ. ૧૦  
એવાં વિવાયક સાંભળી હો ૩લામા !, બોલી કંસ્તુરી તામ;  
વાત સાંભળતાં કેમ થયા હો ૪ સ્વામી !,  
આકળા તે તુમે આમ રે.

હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૧૧  
વાત સુદ્ધયાથી આગળે હો સ્વામી !, કેવો બતાવતા પ્રેમ ?;  
એ સર્વે તે કયાં ગયો હો સ્વામી ! ?,  
હવે બોલો છો એમ રે.

હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૧૨  
પહેલેથી હું જણુતી હો સ્વામી !, કેવા છો તમે ૫સેષ ?;  
ચણું ચિંતા તમે ભતી કરો હો સ્વામી !,  
સાંભળો મારાં વેણ રે.

હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૧૩  
લાજ તુમારી જગતમાં હો સ્વામી !,  
બ્લવા નહિ દઉં ખાસ;  
ઉપાય એહવો શોધીને હો સ્વામી !,  
રાખો હેડો તુમ સાસ રે.

હો મોરા સ્વામી !, વાત સુણો અલિરામ. ૧૪  
એમ ૬આખ્યાસન આપીયું હો શ્રોતા !,  
શેઠને પાડયો શાંત;

---

૧-૨-૪ સ્થી. ડ વચ્ચનો. ૫ સંજન, પ્રેમી. ૬ હિંમત.

તો પણ અમરના ચિત્તમાં હો શ્રોતા !,  
વિચારે ધોળત રે.

હો મોરા શ્રોતા !, સાંલળો અચરિજ વાત. ૧૫

ભવ્યજનો ! હવે સાંલળો હો શ્રોતા !,  
આગળ વાત રસાળ;

સુષુતાં સાતા ઉપજે હો શ્રોતા !,  
મનનું રાખો જ્યાદ રે.

હો મોરા શ્રોતા !, સાંલળો અચરિજ વાત. ૧૬

કર્મસિંહજ સ્વામીનો ! હો શ્રોતા !,  
શિષ્ય કહે રામચંદ;

આવીશ ઢાળ પૂરી થઈ હો શ્રોતા !,  
નુચ્ચો સંસારના ઝંદ રે.

હો મોરા શ્રોતા !, સાંલળો અચરિજ વાત. ૧૭

## દોહરા

મહીયારી સુખ સાંલળી, અમરદત્ત તેણી વાર;  
ત્યાંથી ડી ચાલીયો, ગેડ લણી આ વાર. ૧

૧કર પકડીને સા કહે, શેઠ ! સુણો સુજ વાત;  
ચિતા કરશો નહિ જરી, મનને રાખજે શાંત. ૨

લાજ હું જવા નહિ દઉં, આપ તણી અહે રેનાથ;  
લધશ ઉપાયો એહવા, રહે સુખે સહુ સાથ. ૩

શેઠ ચાલીને આવીયો, પોતાને રેલવાણુંણ;  
હવે સહુ જન તમે સાંલળો, સા ચિંતે તત ખેણુ. ૪

૧ હાથ નહી. ૨ સ્વામી, પતિ. ૩ ધરે.

## દાળ રૂપ મી

[ ચતુર નર ! સેવો શિપળ નિધાન-એ દેશી. ]

નિધવના ગયા પછી સુંદરી રે, મનશું કરે રે વિચાર;  
જેહ કામે હું નીકળી રે, સક્રણ થયું આ વાર.

ચતુર નર ! જુઓ જુઓ ખુદ્ધિ પ્રકાર. ૧  
 હવે ઈહાં રહેલું નહિ રે, જાલું મુજ રેઆગાર;  
 એમ નિશ્ચય કરી મન વિષે રે, ધરધણીને તે વાર. ચ. ૨  
 લાડું આપ્યું તેહને રે, લેઠ સધળો રે સાજ;  
 અમહિષીયો ઠેંચી કરી રે, ચાલી વેળા સાંજ. ચ. ૩  
 અભૂત્યો જિહાં રાખ્યા હતા રે, તિહાં આવે રે ચાલ;  
 શેડાણું આવી લાળીને રે, સહુ થયા ખુશીઆલ. ચ. ૪  
 હો ચાર દ્વિસો ત્યાં રહી રે, ત્યાંથી ચાલી તે વાર;  
 અનુક્રમે ચાલતાં શાંતિથી રે, ઘોંટી કુંચનપુર સાર. ચ. ૫  
 શેડાણું આવી લાળીને રે, સુનિમ તે હરખ્યો અપાર;  
 પ્રકુશળાલાપ પૂછે તદા રે, મળીયો સહુ પરિવાર. ચ. ૬  
 દસાજન ઊંઢ હુદ્ધિત થયો રે, હુર્જન મન પડે ગ્રાસ;  
 સુનિમ કહે તેહને હવે રે, સાંભળો મુજ અરદાસ. ચ. ૭  
 હવે સંભાળી હ્યો તમે રે, લેતી હેતી આ વાર;  
 જેથી મુજ ચિતા ટળે રે, થાએ સુખ શ્રીકાર. ચ. ૮  
 એમ કહીને ચોપડો રે, કુકુલે હીયો તસ હાથ;  
 કરતૂરીએ પણું તદા રે, હસી કહું તેની સાથ. ચ. ૯  
 બાપા ! એમાં શું જોડિં રે ?, તુમારા કામ મુજાર;  
 મુજને તો તુમ ઉપરે રે, વિશ્વાસ છે પારાવાર. ચ. ૧૦

---

૧ પતિના. ૨ ધેર. ૩ લેંસો. ૪ સેવકાને ૫ ખગર અંતરની  
 વાત. ૬ સગાંસંઅંધી. ૭ સમુદ્ધાય.

તદ્ધિ તુમ મન રાખવા રે, વ્યો જેઉં આ વાર;  
એમ ઉપર ઉપર થકી રે, જેયો સંઘળો સાર.      ચ. ૧૧  
દક્ષતા<sup>૧</sup> તેની લાળોને રે, રાજ થઈ અસરાળ;  
ચુંમ સહસ્ર તે રેમુદ્રિકા રે, આપે અતીવ ખુશાળ.      ચ. ૧૨  
દક્ષતા વાપરીને કર્યો રે, સાહસ એડી વ્યાપાર;  
તેથી અગણિત સુજ થયો રે, લાલ વ્યાપાર સુઆર.      ચ. ૧૩  
કામ તુમારું નિહાળતાં<sup>૨</sup> રે, આ તો નજીવી છે લેટ;  
કુપા કરીને લીજુયે રે, થાએ સુખ સુજ પેટ.      ચ. ૧૪  
કૃતકૃત્ય થઈને હર્ષથી રે, કરે તે લેટ સ્વીકાર;  
કુકલ મનમાં ચિત્તવે રે, લીધી સુજ એણું સાર.      ચ. ૧૫  
શેઠ વાત હવે સાંભળો રે, પાછળ શું થયું તાસ?;  
પચચીશ ઢાળ પૂરી થઈ રે, વાત અધૂરી જાસ.      ચ. ૧૬  
કર્મસિંહ સૂરિરાજનો રે, શિધ્ય કહે રામચંદ;  
શીતથી લીલ થાએ સદા રે, એમ કહે જિનચંદ.      ચ. ૧૭

## દોહરા

આમરદત્ત ધર જઈ કરી, ચિંતે ચિત્ત સુઆર;  
હવે મહીયારીને ધરે, જાંબું નહિ નિરધાર.      ૧  
એહવો નિશ્ચાગ આહર્યો, મન સાથે સંકેત;  
ત્યાં જવાથી માહેરી, જગમાં થાએ ઝનેત.      ૨  
પણ સંદ્યા વેળા થર્ફ, સાંભળીયું પયપાન;  
મન સાથે એમ ચિત્તવે, આમર ભૂલી નિજ લાન.      ૩  
હુંધપાન કરીને તિહાં, પાછો તરત આવીશ;  
એમ વિચારી ચાકીયો, મહીયારી ધર ધશ.      ૪

૧ ડાયણુ. ૨ સોનામહોર. ૩ જેતાં.

લાલચ ભૂંડી ભૂતડી, લાગી નેને મન;  
તેને સુખ નવિ સાંપડે, બળી રહે તસ તન. ૫

આમરદત્ત ચલી આવીયો, મહીયારી ધર જામ;  
આડું અવડું જોઈયું, પણ સા નવ હીઠી તામ. ૬

અંધ સદન<sup>૧</sup> દેખી કરી, મનશું કરે વિચાર;  
કિછાં ગઈ સા સુંદરી ?, સાંજ સમય આ વાર. ૭

કોઈક નરને લાગીને, તેહને પૂછે તામ;  
કિમ સા દેખાતી નથી, મહીયારી આ ધામ ?. ૮

એવાં વચનો સાંલળી, હસીને ઓલ્યો આમ;  
હવે તો તુમ સરશે નહિ, અહિં આવ્યાથી કામ. ૯

વળતું લાંઘે શેઠળ, અહો સુણો સજજન !;

નથી મહારે કોઈ જાતનો, સંધંધ અહિં મુજ મન. ૧૦

તેહ કહે અહો શેઠળ !, જાણું છું તુમ મર્મ;  
પણ નથી મહારા કુળ તણો, શુઝ જોલ્યાનો ધર્મ. ૧૧

એમ સુણી પાછો વળ્યો, આંયો આપણ ધામ;  
મનશું ઈમ તે ચિંતવે, રૂડું કર્યું તેણે કામ. ૧૨

લાજ હવે મારી ઈહાં, નહિ જાંચે નિરધાર;  
વચન દીખું છે તેણીએ, પાજયું ખરીત આ વાર. ૧૩

હવે ભવિયણું ! તમે સાંલળો, કસ્તૂરીની વાત;  
કરે રખે કંચપચ કરી, વ્યાખ્યાને વ્યાધાત. ૧૪

### ઢાળ રૂદ મી

[ દેશી વિધીયાંતી ]

હારે લાલા કસ્તૂરી ધર આંયા પણી,

કરે લોકો માંહા માંહાં વાત રે લાલા;

વ्यापारे એહ લांગશે,

અધુના કયાંથી આવી કમજાત ? લાલા.

વાત સુણો રે વિનોદની. વા. ૧

હારે લાલા હો ચાર દ્વિન એમ વીતીયાં,

શાંતિ ને સમાધિથી ત્યાંહિ રે લાલા;

એહવે શું ત્યાં નીપતુ ?,

હવે તેહ સુણુજો તમે આંહિ રે લાલા. વા. ૨

હારે લાલા ૧જનગણુમાં વાત વિસ્તરી,

એણુ કીધું છે ભૂંડું કામ રે લાલા;

કુળને કલંક ચેડાવીયું,

થવા લાગી તેની વાતો આમ રે લાલા. વા. ૩

હારે લાલા કણ્ણુંપણ્ણું ચાલતાં,

વાત આવી કુકલને કાન રે લાલા;

એહ સાંભળતાં મુનિમને,

મન નવ રહી તવ કાંઈ લાન રે લાલા. વા. ૪

હારે લાલા મનમાં અતિ એહ પામીને,

આવે જ્યાં છે શેઠની નાર રે લાલા.

દિલમાં ૨ઉદ્વેગ લાવીને,

તેહ બોલે આમ તે વાર રે લાલા. વા. ૫

હારે લાલા શેડાણ્ણી ! તુમે સાંલળો,

મુજ વાતડી કહેતાં એમ રે લાલા;

ગામમાં વાતો અતિ ઘણ્ણી,

તુમ થાચે છે નેમ તેમ રે લાલા.

વા. ૬

૧ માણુસોમાં. ૨ એહ લાવીને.

- હારે લાલા સંભળાએ નહિ મુજથી,  
થાય કાનો પણ અપવિત રે લાલા;  
સાચે સાચું તમે એલને,  
નવ બોલશો જૂઠ ખરીત રે લાલા.      વા. ૭
- હારે લાલા કુસ્તૂરી સમજી ગઈ,  
છતાં પણ પૂછે તોણી વાર રે લાલા;  
ખાપા ! એવી ડેવી થાય છે ?,  
ચડી કેથી રીશ અપાર રે લાલા.      વા. ૮
- હારે લાલા કૃપા કરીને કીણુથે,  
કેથી અખર પડે આ વાર રે લાલા;  
તો સાંધે આવે ખરે,  
કદ્દા વિષુ કેમ પામીજે સાર રે ? લાલા.      વા. ૯
- હારે લાલા કોધમાં આવી એમ કહે,  
કહેવી મહારે શી વાત રે ? લાલા;  
નાક કપાંથું જગતમાં,  
હજી પૂછો છો ૧અવદાત રે લાલા.      વા. ૧૦
- હારે લાલા ગામ માંડે હવે મુજથી,  
નાક લઇને ફરાય ન કયાંહિ રે લાલા;  
એહવી અખર જો મુજ હતે,  
તુમ પાસે તો આવત નાંહિ રે લાલા.      વા. ૧૧
- હારે લાલા માંડ માંડ ધૂટયો હતો,  
ફરી મુજને નાંખ્યો આંહિ રે લાલા;  
રહારી લાજ ગમાડવા,  
ધૂડ નાંખ્યો તેં ધોળા માંહિ રે લાલા.      વા. ૧૨

હારે લાલા એહવાં વચનો સાંભળી,  
વળતું બોલી શેડાણી તામ રે લાલા;  
કોધ કરો છો શ્યા ભણી ?,  
તે કારણું ભાંખો તમામ રે લાલા.

વા. ૧૩

હારે લાલા વાત કર્યાથી જણીયે,  
યણું વણું કીધે ન સમજાય રે લાલા;  
માટે બાપાજી ! તમે કહોા,  
તો મન માંદે સુખ થાય રે લાલા.

વા. ૧૪

હારે લાલા સુનિમ કહે શું કહું ધહાં ?,  
નથી સંભળાતી વાતો કાન રે લાલા;  
શું તમને માલમ નથી ?,  
તેથી પૂછો સુજને આમ રે લાલા.  
હારે લાલા તો લ્યો સંભળાલું તુમને,  
એમ કહુને બોલ્યો તામ રે લાલા;  
દાળ છબ્બીશ રામે કહી,  
સફુરુના પ્રસારે તે આમ રે લાલા.

વા. ૧૫

વા. ૧૬

### દોહરા

વાતો થાચે ગામમાં, અમર શેડની નાર;  
બૂંકું કામ એણે કર્યું, આવે સહુને ખાર.  
યાત્રા કરણું મિષે કરી, ગઈ હતી પરદેશ;  
કાળું મોઢું કરી ધહાં, ફરી આવો નિજ દેશ.  
એવી વાતો સાંભળી, તેથી કહું છું આમ;  
સાચે સાચું બોલજો, એમાં શું છે મામ.

૧

૨

૩

મુનિમ મુખેથી સાંભળી, હસી બોલી સા નાર;  
આપા ! એ વાતો મહિં, ગૂઢો છે કંઈ સાર. ૪

ગામ માંડે જે સાંભળી, ખરી વાતો છે સર્વ;  
એમાં ઉંડા લેહ છે, સાંભળો કહું અગર્વ. ૫

જે સાંભળશો મૂળથી, શંકા થાશો નાશ;  
સાડા ત્રણુ મહિના થયા, આશા રહી સુજ ખાસ. ૬

એમ સાંભળી મુનિમજી, થયો અવાચક તામ;  
નયન દ્રારીને સુખની, સન્સુખ જોવે આમ. ૭

આપા ! સાંભળીને તમે, આક્ષર્ય પાખ્યા કેમ ?;  
કહી સંભળાવું મૂળથી, વાત બની છે જેમ. ૮

હવે કુસ્તૂરી સ્વગુમ જે, કહેશે મુનિમને વાત;  
ચહું કો સાંભળનો તમે, મન રાખી એકાંત. ૯

### દાળ રૂજ મી

[ રાજ દ્વારથ દીપતો-એ દેશી. ]

કુસ્તૂરી વળતું કહે, આપા ! સુણો સુજ વાત રે;  
રહુસ્યકારી એ છે ચરી,<sup>૧</sup> તુમને કહું વિખ્યાત રે.  
વાત સુણો ચતુરાઇની. ૧

જનક તુલ્ય તમે અછો, તેથી કહું શુઅ વાત રે;  
એ સાંભળી તુમ હૃદયમાં, બહુ થાશો સુખ સાત રે. વા. ૨  
ધૂરથી<sup>૨</sup> માંડીને અહે, મુનિમને નિજ અવદાત રે;  
વળી દેખાડી મુદડી, કુકવની શંકા જાત રે. વા. ૩  
મુનિમ હસીને બોલીયો, શેડાણી ! ભારે ઝીધ રે;  
સુજ શેડને ધૂતી કરી, કરી આવ્યા કાર્ય સિદ્ધ રે. વા. ૪

૧ વાત. ૨ પ્રથમથી.

હવે શંકા તે ઝડારી ટળી, હુનીયા લહે જખ મારે રે;  
 સાચને આંચ આવે નહિ, સત્ય એ હુઃપથી તારે રે. વા. ૫  
 ઝરી કુસ્તૂરી એમ કહે, સુજ મન એક અંદેશ રે;  
 વિધનસંતોષી જીવડા, જે કહે ભૂધવાં પાસ રે. વા. ૬  
 હુર્ભણ કન્ના રાજવી, શાસ્ત્રે કદ્યા છે તેહને રે;  
 ભરમે ભરમાવ્યા લમે, દીર્ઘ<sup>૨</sup> વિચાર ન જેહને રે. વા. ૭  
 જે મહીધરડને શંકા પડી, સર્વ ઇદ્ધિ લેશે લુંટી રે;  
 વળી કર પકડી સુજને, ખાહિર કાદશે ફૂઠી રે. વા. ૮  
 અસત્ય કાર્ય પર ભૂપને, વર્તે છે અતિ રીશ રે;  
 સમજાવ્યો સમજે નહિ, પાછળથી છાવનીશ રે. વા. ૯  
 માટે તમે ત્યાં જઈ કરી, રાનજણી પાસ રે;  
 છાની માની વાતડી, સર્વ કહો તસ ખાસ રે. વા. ૧૦  
 ડાદ્યા હોય ને માણુસો, બાંધે પાણી પહેલી પાર રે;  
 રહસ્યકારી ને વાતડી, સમજાવો તસ સાર રે. વા. ૧૧  
 જો મહીપાળ<sup>૪</sup> એ સમજશો, તો નવી આપશે હુઃખ રે;  
 સર્વ રીતે વળી આપને, થાશે ઈંડાં ક્ષેમ સુખ રે. વા. ૧૨  
 સુનિમળ મનમાં ચિંતવે, કહે ને શેડાણી વાત રે;  
 જાણુ કરવી તો રાયને, જેથી થાય સુખ સાત રે. વા. ૧૩  
 અહો શેડાણી તણ્ણી ઈંડાં, દીશે મતિ કેવી ઝડી રે!;  
 વાત કર્યે જશે નહિ, ઝડારા શેડની મૂડી રે. વા. ૧૪  
 એમ નિશ્ચય કરી સુનિમળ, જશે હવે રાજ પાસે રે;  
 એક ચિત્તે શ્રોતા! સાંભળો, અચરિજ શું ઈંડાં થાશે રે? વા. ૧૫  
 નિયતિહરિ સ્તુરિરાયનો, રામેંદુ કહે એમ રે;  
 સત્યાવીશ્વરી ઢાળમાં, સહુને થાશે એમ રે. વા. ૧૬

મુનિમજી ઉઠી ચાલીયો, મહીપતિને<sup>૧</sup> દરખાર;  
લેટણું લીધું હાથમાં, આવ્યો રાજ હુવાર. ૧

પગે લાગી ઉલ્લો રહ્યો, લેટણું મેલ્યું પાસ;  
ભૂષે<sup>૨</sup> તવ બોલાવીયો, આણ્ણી મન ઉલ્લાસ. ૨

કેમ દેખાયા ઘણ્ણું દિને, અહો બાપા ! ઈહાં આજ ?;  
કહો કેમ ભૂતા પડ્યા ?, કહો હોય ને કાજ. ૩

કરકજી<sup>૩</sup> જેડીને કહે, ભૂધવળને<sup>૪</sup> એમ;  
તુજ પ્રથ્યામે આવીયો, મનમાં લાવી પ્રેમ. ૪

મહીપાળ<sup>૫</sup> વળતું કહે, મુજ ઝેણી છે કેમ ?;  
સુજને તે કહો સુનિમજી !, સુષુતાં થાએ એમ. ૫

ચુંમ કર જેડી કહે, અંજળી કરીને લાલ;<sup>૬</sup>  
તુમ ઝેને આશીષડી, આપી છે મહીપાળ !. ૬

તેમની એક વિનંતિ છે, તે સાંભળો મહારાય !;  
તે કહેવાને આવીયો, મનમાં અતિ ઉમાય. ૭

સુખે કહો હે સુનિમજી ! મુજ ઝેણીની વાત;  
સાંભળવા તૈયાર છું, લગિનીનું અવધાત. ૮

સુનિમ કહેશે ને હવે, તે સાંભળો સહુ કોય;  
રસ પ્રપૂરિત એ ઊચરી, સાંભળતાં સુખ હોય. ૯

### \* ઢાણ ૨૮ મી \*

[ દેખો ગતિ દૈવતી રે-એ દેશી ]

સુનિમ કહે હવે રાયને રે, ચાલો એકાંતે મહારાયકે !;  
રાજન ! સાંભળો રે.

વાત કરવી છે ખાનકી રે, કહું છું શીશ નમાય કે. રા. ૧

૧-૨-૪-૫ રાજ. ૩ એ હાથ. ૬ મર્સ્ટકે. ૭ રસથી ભરેલી વાત..

એમ સુણીને રાયજી રે, ધર ૧લિતર તવ જાય કે; રા.  
 સુનિમ પણું પાછળ ઉઠીયો રે, આવ્યો ધરની માંય કે. રા. ૨  
 એકાંતે એસી કરી રે, ભૂધ્વને કહે વાત કે; રા.  
 ધૂશથી માંડીને કહે રે, રવસ્તુ સ્થિતિ સમજાય કે. રા. ૩  
 સુનિમ સુખેથી સાંભળી રે, અચરિજ પામ્યો રાય કે; રા.  
 ખીની મતિ દુંકી કહી રે, કવિજને શાસ્ત્રની માંય કે. રા. ૪  
 પણું સુજ ૩લગિનીયે ઈહાં રે, લારે કર્યું એ અમ કે; રા.  
 પતિ-વચન પણું પાળીયું રે, રાખી પોતાની ૪મામ કે. રા. ૫  
 હર્ષિત વદને ઓલીયો રે, સુનિમજીને મહીપાળ કે;

સુનિમજી ! સાંભળો રે.

જઈ કહેનો સુજ ઘેનને રે, હવે ગઈ તુમ જંબળ કે. સુ. ૬  
 વાત કહેયે ડોધ સુજને રે, તો એ પામશે દંડ કે; સુ.  
 ચિતા લવ હવે મતી કરે રે,

નહિ નડ ડોધ એને ઝંદ કે. સુ. ૭

લલે સીધાવો ધર ભણી રે, ચિતા ટળે સુજ ઘેન હે; સુ.  
 કહેનો મહારા તરક્ખથી રે, આણું ન મનમાં કુચેન કે. સુ. ૮  
 પગે લાગીને ઉઠીયો રે, સુનિમ તે તેણી વાર કે;

સંજગન સાંભળો રે.

હળવે હળવે ચાલતો રે, આવ્યો કુસ્તૂરી પદ્ધાર કે. સ. ૯  
 મુનિક કહે તેહને હવે રે, વીતી વાત તમામ કે;

શેઠાણી ! સાંભળો રે.

તુમચે ધર્મના બંધુએ રે, રાયે કદ્યું છે આમ કે. શેઠા. ૧૦

૧ ધરની અંદર. ૨. બંધી બાખનોનું ઉત્પત્તિ કરણું ૩ ઘેને.  
 ૪ સત્ય-શિક્ષણ, લજા-મર્યાદા. ૫ ધરને બારણું, ધરે.

ਤੁਮੇ ਕਾਂਝ ਚਿੰਤਾ ਮਤੀ ਕਰੋ ਦੇ,  
ਸਵ੍ਰ ਥਾਥੇ ਛਹਿਂ ਸ਼ੁਭ ਕੇ; ਸ਼ੋਠ।  
ਆਖਾਸਨ ਏਮ ਆਪੀਧੁਂ ਦੇ,  
ਮਨ ਨਵਿ ਆਖੁਥੋ। ਕ੍਷ੋਲ ਕੇ. ਸ਼ੋਠ। ੧੧  
ਮੁਨਿਮ ਮੁਖੇਥੀ ਸਾਂਭਣੀ ਦੇ, ਕੁਟੂਰੀ ਥਾਹ ਰਣੀਧਾਤ ਕੇ;  
ਸ਼ੁਭਜਨ ! ਸਾਂਭਣੋ.

ધરમધોકારે ગામમાં રે, થાવા લાગી વાત કે.      સ. ૧૨  
શેઠ દ્વેર જખ આવશે રે, કાદશે ધરથી બણાર કે.      સ.  
એ જલ્લતાં સવી આપણું રે, જશે હુઃખ અપાર કે;      સ. ૧૩  
જન મુખથી એમ સાંલળે રે, જેદ ન આણે લગાર કે સ.  
મનમાં ચિંતે એણી પરે રે, એ શું સમજે ગમાર કે ?      સ. ૧૪  
એમ આનંદથી રવાસડો રે, કાઢે કુસ્તૂરી તામ કે;      સ.  
શ્રોતાજન ! હુંવે સાંલળો રે, જે ને થાય ઈહાં કામ કે      સ. ૧૫  
નિયતિહંરિ સૂરિરાયનો રે, શિષ્ય કહે રામચંદ કે.      સ.  
ઢાળ અક્ષાવીશુ એ થઈ રે, હો લવિજનને આનંદ કે.      સ. ૧૬

ੴ ਪ੍ਰਾਤਿ

કસ્તૂરી આનંદ્યો, રહેવા લાગી ત્યાંય; .  
 એમ હિન ઉભ્યતીકુમતાં થકાં, સમય પ્રસૂતિ આય. ૧  
 શુલ વેળા શુલ વારનો, પ્રસબ્યો પુત્ર રતન;  
 લક્ષણું લક્ષિત દેહડી, દેખી થાત પ્રસત. ૨  
 ચંદ્ર સૂર્યનાં દર્થનો, કરાંયાં ત્રીજે હિત;  
 છઢી જાગરિકા કરી, મનમાં થાય અદીન. ૩

૧ ઘેદ. ૨ દિવસો કાળતાં. ૩ પસાર કરતાં. ૪ સુઆવડ, બાળક  
જરૂર-મવાતો ટાઈભ, વખત.

બારમે હિવસે તેણીએ, અશુચિ કર્મને ટાળ;  
નામ તેહનું આપીયું, કુમળ ઈતિ ઉજમાળ. ૪  
ચંદ્રકળા જિમ વાધતોા, કુમર દૃપ નિધાન;  
પંચ વર્ષનોા તે થતાં, લે થયું તે સુણો ઐખ્યાન. ૫  
એહુ વાત ઈહાં રહી, હવે અમર અધિકાર;  
અહેં ભવિયણુ ! તમે સાંભળો, મન કરી એકાકાર. ૬

### ટાળ ૨૯ મી

[ હરિતનાગપુર વર જલો, નિહાં પાંડુ રાજ સાર રે-એ દેશી ]

અમરદાત મન ચિંતવે,  
હવે જાવું નિજ ધર દ્વાર રે;  
કરતૂરી મુજ વલ્લભા, ૧  
વાટ જોતી હશે સાર રે;  
વાટ જોતો હશે સાર,  
સુણો ભવિ પ્રાણીયા ! સર્વનેહ રે.  
ઈહાં રહેતાં મુજને હવે,  
કરતાં વર્ષ છ થયાં વ્યાપાર રે;  
હુઃખ્યારી થઈ ગઈ હશે,  
મન સમળ હશે સા નાર રે. મન. સુ. ૨  
ધરમાં દાણું એક માસનાં,  
ખાવા મેં મેલ્યાં હતાં ત્યાંય રે;  
વિષુ ઓરાક સા ટળવળી,  
બહુ હુઃખી થઈ હશે પ્રાય રે. હુઃખી. સુ. ૩

૧ વાત. ૨ ખી.

હવે જઈ પૂછું તેણુને,  
 ધૂર આડો છે કે મોલ રે?;  
 તેં આડી ધૂર દેખવી,  
 જેનાં ઇળ લોગવ્યાં સહ ક્ષોલ રે. જેનાં. સુ. ૪  
 એમ વિચારી ચિત્તમાં,  
 અમરદાત ગમન ઉજમાળ રે;  
 નિજ વ્યાપારો સમેટીને,  
 સાથે લીએ તે સર્વ માલ રે. સાથે. સુ. ૫  
 વળી મનમાં એમ ચિત્તવે,  
 ઝૂારે ખખર મોકલવી તેહ રે;  
 ચેતવણી આપી જવું,  
 નારી તો મન સમજે એહ રે. તો મન. સુ. ૬  
 તેથી મનમાં મુંજાઈને,  
 ખહુ પામશે લજા સાર રે;  
 જેથી નિશ્ચય માનશે,  
 ઝૂારી વાત હવે નિરધાર રે ઝૂારી. સુ. ૭  
 ઝૂારે કહેવું સહેલું થશે,  
 ઈમ અલિમાને ચડયો શેઠ રે;  
 કાગદ લખી મોકલાવીને,  
 ઉતારી હીધી એમ વેઠ રે. ઉતા. સુ. ૮  
 ધ્વન પત્ર આવ્યો લાળીને,  
 થઈ સા મનમાં અતીવ ખુશાળ રે;  
 મુનિમને તામ ઓલાવોને,  
 સર્વ વાત કહી તે રસાળ રે. સર્વ. સુ. ૯

એહ સાંભળી સુનિમળ,

ચિત ચિતે એણ્ણી પરે તેહ રે;  
વાત સ્ટેટ<sup>૧</sup> હુદે થશો,

તેથી દુનીયા જાણુશો એહ રે. તેથી. સુ. ૧૦  
કુરી કસ્તૂરી કહે તેહને,

આપા ! જાઓ રાજહુવાર રે;  
રાજળુની આગળે,

સર્વ વાત જાણુવો સાર રે. સર્વ. સુ. ૧૧  
રાયને કહેજો એણ્ણી પરે,

તુમ લગિનીનો ભરથાર રે;  
પરદેશથી જયારે આવશો,

વસ્તુ જેશો અમને તે વાર રે. વસ્તુ. સુ. ૧૨  
ચામર ને છત જોઈશો,

નેજન ને સાથે નીશાન રે;  
હાથી ઘાડા તોમ વળી,

દૈવા આવીશ મૂકી માન રે. દૈવા. સુ. ૧૩  
તુમ લગિનીના સ્વામીને,

સામૈયો કરવાને કાજ રે;  
એ કારણુથી આવીયો,

તુમ પાસે હું મહારાજ રે !. તુમ. સુ. ૧૪  
એહ આદેશ કસ્તૂરીનો,

સુનિમ સુણ્ણી ગયો રાજ દરખાર રે;  
રાયે આદર આપીયો,

કુકલ કહે સર્વ વાત વિસ્તાર રે. કુકલ સુ. ૧૫

એમ સુણ્ણિને રાજવી,

હુસી બોલ્યો ગ્રેમે તેણી વાર રે;  
આપા ! દેઈ જને ભાવે,

એમાં નથી કાંઈ અમ નાકાર રે. એમાં સુ. ૧૬  
સર્વ વસ્તુ એ માહરી,

સુજ ઘેનની છે નિરધાર રે;  
એ આખ્યાથી તો મુજને,

થાય આનંદ હુર્ઝ અપાર રે. થાય. સુ. ૧૭  
એમ સુણ્ણિને કંકલ કહે,

રાજન ! કૃપા કરી તુમે આજ રે;  
સધળાં તુમ ઘેની તણું,

તેથી સિદ્ધ થશે હવે કાજ રે. તેથી. સુ. ૧૮  
કરકર્જ જેડી મુનિમ કહે,

રાજન ! અમને એ જોશે જે વાર રે;  
દેવા આવશું વસ્તુઓ,

અમી આપની પાસ તે વાર રે અમે. સુ. ૧૯  
મહીધર<sup>૨</sup> પાસેથી નીકળી,

આવ્યો બાપો કસ્તૂરીની પાસ રે;  
વીતી વાત સધળી કહી,

સાંલળિને સા પામી ઉલ્લાસ રે. સાં. સુ. ૨૦  
હવે ભવિયણ ! તમે સાંલળોા,

શું શું ઈહાં કુતૂહળ થાય રે ?;  
અમરદા જથ આવશો,

નિજ ધરમાં જ્યારે મૂકશે પાય રે. નિજ. સુ. ૨૧

૧ એ હાથ. ૨ રાજ.

આગણુત્રીશમી દાળ એ,

સુનિ રામેંદુ કહે ઉજમાળ રે;

નિયતિહરિના પસાયથી,

હોશે સહુને મંગળ માળ રે. હોશે. સુ. ૨૨

દોહરા.

ઠાણુપુરથી નીકળ્યો, અમરદાત ધરી જ્યાર;

ઘંથ પરિશ્રમ ટાળતો, આવ્યો નિજ પુર સાર. ૧

તોચો નાંખી ડેંસથી, થયા ધુખાકા તેહ;

અહે સાંલળી જન કહે, અમર આવ્યો નિજ ગેહ. ૨

કુસ્તૂરી હવે સુનિમને, તેડી કહે સસનેહ;

રાજક્ષારે જઈ કરી, લાવો વસ્તુ તેહ. ૩

ઘણી કરો તુમે શેઠને, સામૈયુ ભરપૂર;

અમ સુણ્ણીને સુનિમળ, આવે રાય હળ્ણૂર. ૪

રાય કનેથી સર્વ તે, વસ્તુ લાવ્યો જમ;

આડંખરથી શેઠને, કરે સામૈયું તામ. ૫

સાજન મહાજન સહુ મળી, ચાલ્યા બંદરે એહ;

આડંખર એ દેખીને, અચરિજ પામ્યો તેહ. ૬

દાળ ત૦ મી

[ શુભ જાન રસીલી રૂઢી દેશના રે લોલ-એ દેશી. ]

સર્વ સાજન મહાજને પરિવર્યો રે લોલ,

અમરદાત આવ્યો નિજ ગેહ જો;

આ તે ધરમાં હું શું દેખી રહ્યો રે ? લોલ,

છે શું સ્વર્પન કે સાચું એહ જો ?.

અમ અચરિજ મન માંડે થયું રે લોલ. ૧

- ધહાં ભુરી નારીએ ઘર રહી રે લોલ,  
કર્યો નિશ્ચય શીત વિનાશ જો;  
નહિ તો ઠાડ માડ દૃષ્ટિ એવડી રે લોલ,  
હોવે કયાંથી એ એહની પાસ જો ?      અમ. ૨
- મનમાંડે એવા અનેક શોઠળ રે લોલ,  
કરે કુતર્કો તેણી વાર જો;  
એમ અનુક્રમે ચાલતાં આવીયારે લોલ,  
સર્વ મળીને ઘરને દ્વાર જો.      અમ. ૩
- માંહાંમાંહ વાતો એહવી કરે રે લોલ,  
થઈ મનમાં અતીવ ઉજમાળ જો.  
જો જો અમર હવે કરશે સહીરે લોલ,  
કસ્તૂરીના તો એ હાલ જો.      અમ. ૪
- એને ઘરથી એ બાહિર કાઢશે રે લોલ,  
વળી દેશે બહુ તસ માર જો;  
આપણુને તો હવે તેથી થશે રે લોલ,  
જંનણો સર્વ એ દૂરજો.      અમ. ૫
- તવ કસ્તૂરીએ તિહાં શું કર્યું રે લોલ ?,  
તેડી કાંખમાં પોતાનો બાળ જો;  
રહી ઉલ્લી સા ઘરના દ્વારમાં રે લોલ,  
કરે બાળા બાળક શું ખ્યાલ જો.      અમ. ૬
- જન્મયા ! સાંભળજે મુજ વાતડી રે લોલ,  
જે આવે ઓ તાહરા બાપ જો;  
જઈ સાગે પગે તું લાગજે રે લોલ,  
તુને ઓળે એસાડશે આપ જો.      અમ. ૭

નિજ ત્રિયાનાં વયણો સાંભળી રે લોલ,  
શેડ મનમાંહિ કોધે લરાય જે;  
જુઓ જુઓ એ રંડે શું કર્યું રે લોલ,  
ઝારી લાજ ગમાવી હાય જે !

અમ ૮

આ નિર્મળ ઝારા કુળને રે લોલ,  
ડાધ એણે લગાડયું અપાર જે;  
એને સાચી સતી હું માનતો રે લોલ,  
જૂઠી જાણી હવે આ વાર જે.

અમ. ૯

અમ વિવિધ વિચારે કરે યદા રે લોલ,  
કસ્તૂરી ઉલ્લી તસ સામ જે;

તાસ દૃષ્ટ પુષ્ટ દેખી શરીરને રે લોલ,  
વળી અમર વિચારે મન આમ જે.

અમ. ૧૦

અમાં ભૂલ જરી એહની નહિ રે લોલ,  
સર્વ મારી જ છે ઈહાં ભૂલ જે;  
તત્કાળ પરણી મેં પરિહરી રે લોલ,  
થયું એથીજ અમ પ્રતિકુળે.

અમ. ૧૧

યતઃ—વિદ્યા વનિતા નૃપ લતા, ઉંચ નીચ ન ગણંત;  
પાસે રહે તસ પ્રેમથી, તરત તિર્હા લપદંત.

૧

### પૂર્વ ઢાળ

અમ અનેક વિચારે કરે યદા રે લોલ,  
વળી કસ્તૂરી એલી તામ જે;  
અહો પુત્ર ! તું તહારા ખાપને રે લોલ,  
લાવ તેડીને ધરમાં આમ જે.  
અટ સ્નાન કરી લેવા કહે રે લોલ;  
વળી કોજન પણ છે તેયાર જે;

અમ. ૧૨

|                                    |        |
|------------------------------------|--------|
| તમે સાથે એસીને એહુ જણારે લોલ,      |        |
| પિતા પુત્ર જમનો આ વાર જો.          | એમ. ૧૩ |
| એમ વયણુ સુણી વળી શેડને રે લોલ,     |        |
| કરી અતિથય વ્યાઘ્રો કોધ જો;         |        |
| હુવે શિક્ષા કરવી એહને સહી રે લોલ,  |        |
| કરી શક્યો ન મનનો રોધ જો.           | એમ. ૧૪ |
| એહ ત્રીશામી ટાળ પૂરી થઈ રે લોલ,    |        |
| સુરિ નિયતિહરિનો કહે બાળ જો;        |        |
| મુનિ રામચંદ્ર કહે ભવિજનો રે ! લોલ, |        |
| સુણો આગે થઈ ઉજમાળ જો.              | એમ. ૧૫ |

### દોહરા

|                                           |   |
|-------------------------------------------|---|
| જનની વયણો સાંલળી, કુમળ કુમર તે વાર;       |   |
| કાંખ માંહેથી ઉત્તરી, હોડી આવ્યો બહાર.     | ૧ |
| કરની અંગુજિ આલીને, જનક લણ્ણી કહે એમ;      |   |
| જમવાને ચાલો તમે, ઢીલ કરો છો કેમ ?         | ૨ |
| એહ દેખીને મન મહિં, કોધે ધમધમ્યો જામ;      |   |
| તે નેતાં સજજન સહુ, ઉઠવા લાગ્યા તામ.       | ૩ |
| તમે જમી લ્યો શેડળ !, અમે જઈએ સહુ ઘર;      |   |
| વળી પાછા અમે આવણું, કરણું વાતો ફેર.       | ૪ |
| મહાજન લોક ગયા પંચી, અમર આંદો ધર માંય;     |   |
| નયનો લાલ કરી તિહાં, નારીને કહે આમ.        | ૫ |
| એ શું ભૂંકું તેં કર્યું, કુળને લગાડી લાજ; |   |
| કેનો એ છૈયો અછે ?, બાલ્યો એમ તે જાજ.      | ૬ |

૧ પુત્ર, દીકરો, બાળક.

ઘડાર જઈને માણુસો, કહેવા લાગ્યા તામ;  
જુઓ હવે એ શેઠળ, કેવું કરશે કામ ? ૧  
નિશ્ચય ધરથી કાઢશે, કુટીને નિજ વામ;  
આપણું સહુ જોશું ઈંડાં, રાણ થઈ તમામ.  
સહુને નીચા નાંખીયા, બદ્દલો મળશે આજ;  
એમ સહુ બોલે તિંડાં, મૂકીને નિજ લાજ. ૨

### દાળ ઉંમા ભી

[ ગોકુળની ગોનાલણી, મહિ ઠેંચવા આવે—એ દેશી ]

કર્તૂરી એમ સાંભળી, કર જોડીને તામ;  
પતિ પ્રત્યે એમ બોલતી, સ્વામી ! બોલો શું આમ ? ૧  
જૂઠો આળ ન આપીએ, કોઈ માથે સ્વામ !;  
આળ આપ્યાથી જીવને, મળે હુઃએ અકામ. ૨  
પુત્ર અછે એ તુમારડો, એમાં ફેર ન કાર;  
હું સતીએમાં શિરોમણું, નવી લોખું કાર. ૩  
વગર વાકે સુજને અહો, સ્વામી ! દીયો કાં આળ ?;  
જો મારવું હોય સુજને, થાએ મારી ઝુશાળ. ૪  
હું છું દાસી તુમારડો, ઉલ્લી તુમ આગે;  
જો કરવું હોય આપને, તે કરો લીયો રાગે. ૫  
પણ એટી વાતો કરી, કાં હુલાવો સુજને ?;  
હું જૂહું નથી બોલતી, સાચું કહું છું તુજને. ૬  
એહવાં વયણો સાંભળી, શેઠ માંડયો એકથવા;  
સો સો ચૂઆં<sup>૪</sup> મારકે, બિલ્લી બેડી તપવા. ૭

૧ ખ્રી. ૨ અણુધાર્યાં. ૩ લાજ-મર્યાદા. ૪ કહેવા. ૫ ઉદ્દર.

- એહવો ન્યાય બન્યો ઈહાં, તદ્પી<sup>૧</sup> તું છૂપાવે;  
જગ સધળો જણ્ણું અછે, છતાં સતી તું થાવે. ૮
- પરણીને હું ગયો હતો, પરદેશમાં લ્યારે;  
તે હિન્થી માંડી કરી, હું આંદો અત્યારે. ૯
- તદ્પિ તું તો એમ કહે, એ બાળક તુમારો;  
એવહું જૂદું વદી<sup>૨</sup> કહે, મહારા આચાર સારો. ૧૦
- ચાર ઉઠી કેટવાળને, દંડવાને લાગે,  
તું પણ ઈહાં તેમ કરી, ઘૂટવાને માગે. ૧૧
- શાસ્ત્રમાંહે પણ એમ કહું, નારી વિષની ચેલી;  
આંખે સમજલે અન્યને, અન્યથી કરે કેલિ ૩ ૧૨
- એ માહેલી તું પણ અછે, સર્વ માંહે છે ધૂર;  
રે હુધા ! કમજાત ! તું, સુર્ધ કેમ નહિ પયઃપૂર ?. ૧૩
- નિર્મણ મહારા વંશને, તેં કલાંક લગાઉયો;  
જગતમાંહે મુજને અરે !, તેં નીચો જ પાડયો. ૧૪
- એહવાં વચ્ચને તેણુંને, નિષ્ઠાંધી ભારી;  
હવે કસ્તૂરી કહેશે ઈહાં, નિજ વાત સંભારી. ૧૫
- એહ એકત્રીશમી ઢાળમાં, રામ મુનિ કહે એમ;  
નિયતિહરિ સુપસાયથી, સહુને થાએ એમ. ૧૬

### દોહરા

- એહવાં વચ્ચો સાંલળી, કસ્તૂરી કહે તામ;  
કોધારણું નયનો કરી, શું બોલો છો સ્વામ ! ?. ૧
- એ નંદન છે તુમ તણ્ણો, શંકાને નહિ સ્થાન;  
ઈહાં જૂદું નથી બોલતી, કરો નહિ સયતાન. ૨

૧ તોપણ. ૨ બોલીને. ૩ કીડા—અનાચાર. ૪ પાણીના પૂરમાં.

નીતિમાં દાખણું અછે, તાણયે કૂઠી જાય;  
કૂઠયા પછી નો સાંધીએ, ગાંડ વચ્ચે રહી જાય. ૩  
માટે સ્વામી ! વીનવું, એકર નોડી આપ;  
ભીનામાં સંકેલીએ, નવી થાએ સંતાપ. ૪  
ધી અભિમાં સિંચતાં; જવાળા વધતી જેમ;  
તેમ શેડના મન મહિં, વ્યાપ્યો કોથ અશેમ. ૫  
શેડનું રૂપક હેખીને, સા બાલી ધરી ધીર;  
મુજ વીતી તમે સાંભળો, મુજ નાણું દીના વીર!. ૬

### ઢાળ ઉર મી

[ વાડી ઝૂલી અતિ લદી, મન અમરા રે ! - એ દેશી. ]

|                                           |           |    |
|-------------------------------------------|-----------|----|
| આમર કહે સાચું કહો, સુણો સાચું રે !;       |           |    |
| નહિ તો થાશે વિનાષુ, અહો સુણો સાચું રે !;  |           |    |
| એહ સુણું કસ્તૂરી કહે, સુણો સાચું રે !,    |           |    |
| રે મુજ જીવન પ્રાણુ !, અહો સુણો સાચું રે ! |           | ૧. |
| એહ પુત્ર કોનો અછે ?,                      | સુ. સ્વા. |    |
| તેહ ખતાવું આ વાર;                         | અ. સ્વા.  |    |
| એ જયાના ડોકમાં,                           | સુ. સ્વા. | ૨. |
| જુઓ તમે નિરધાર.                           | અ. સ્વા.  |    |
| એંધાણું સહી તેહની,                        | સુ. સ્વા. |    |
| નોયા પછી કહો મુજ;                         | અ. સ્વા.  |    |
| ધણું મુખથી એમ સાંભળો,                     | સુ. સ્વા. |    |
| શેઠ થર્ફ ને અખુગ્ર;                       | અ. સ્વા.  | ૩  |

|                                         |            |   |
|-----------------------------------------|------------|---|
| સુતના ગળામાં નિરખીને,                   | સુ. શ્રો.  |   |
| જંખવાણો તવ શેડ;                         | અ. શ્રો.   |   |
| એહ સહી સુજ મુદ્રિકા, <sup>૧</sup>       | સુ. શ્રો.  |   |
| કેમ આવી છણાં નેઠ ?.                     | અ. શ્રો.   | ૪ |
| હખિંત વદને સા તદા,                      | સુ. સ્વા.  |   |
| કહે પતિને તે આમ;                        | અ. સ્વા.   |   |
| એહ રમુદ્રિકા હેખીને,                    | સુ. સ્વા.  |   |
| સ્તરધ્ય <sup>૨</sup> થયા કેમ સ્વામ ! ?. | અ. સ્વા.   | ૫ |
| હિંમત હારી શેડળ,                        | સુ. સા.    |   |
| કહે રમુદ્રિકા છે સુજ;                   | અ. સા.     |   |
| ક્યાંક પડી સુજ કર થકી,                  | સુ. સા.    |   |
| હાથ આવી હશે તુજ.                        | અ. સા.     | ૬ |
| તેથી પુત્ર એ માહરો,                     | સુ. સા.    |   |
| કેમ માની શકું આજ ?;                     | અ. સા.     |   |
| સુજ ઉપર હોષ નાખતાં,                     | સુ. સા.    |   |
| કેમ નવી આવે લાજ ?.                      | અ. સા.     | ૭ |
| સાચી વાત કહે હવે,                       | સુ. સા.    |   |
| જેમ સુજ થાએ પ્રતીત;                     | અ. સા.     |   |
| એમ સુણુને સા કહે,                       | સુ. સ્વા.. |   |
| સાંખણો વાત ખચીત.                        | અ. સ્વા.   | ૮ |
| મહીયારી કુમળા હતી,                      | સુ. સ્વા.  |   |
| કોઈ આવી તુમ પાસ ?;                      | અ. સ્વા.   |   |
| તેના પાશમાં પડી તમે,                    | સુ. સ્વા.  |   |
| રહ્યા હતા તસ વાસ ?.                     | અ. સ્વા.   | ૯ |

૧-૨-૪ વાટી. ૩ વિચારોમાં તલ્ખીન. ૫ ખાત્રી.

|                                  |           |    |
|----------------------------------|-----------|----|
| તાસ ફૂધની લાદચે,                 | સુ. સ્વા. |    |
| શું કર્યું ત્યાં તુમે સ્વામ ! ?; | અ. સ્વા.  |    |
| વીશ સહસ્ર નિષ્કો ? વળી,          | સુ. સ્વા. |    |
| આપી હતી તેણે તામ ?.              | અ. સ્વા.  | ૧૦ |
| એમ સુણીને શેડળ,                  | સુ. શ્રો. |    |
| મનમાં કિયારે આમ;                 | અ. શ્રો.  |    |
| એ મહીયારી ઈંડાં કને,             | સુ. શ્રો. |    |
| નીશ્ચય આવી આ ધામ.                | અ. શ્રો.  |    |
| મહારા શુઅની એ વાતડી,             | સુ. શ્રો. |    |
| કણી હશે એહુને એકાંત;             | અ. શ્રો.  |    |
| નહિ તો કેમ ખમર પડે ?,            | સુ. શ્રો. |    |
| છાની હતી જે વાત.                 | અ. શ્રો.  | ૧૧ |
| નીચી નજરે નિરખતો,                | સુ. શ્રો. |    |
| તવ કેસ્તૂરી કહે એમ;              | અ. શ્રા.  |    |
| કાં શરમાઓ છો ઈંડાં ?,            | સુ. સ્વા. |    |
| ઉત્તર નાપો કેમ ?                 | અ. સ્વા.  | ૧૨ |
| સર્વ વાતની સ્ક્રેટર હું;         | સુ. સ્વા. |    |
| કરું છું તમારી પાસ;              | અ. સ્વા.  |    |
| તે મહીયારી જાણુણો,               | સુ. સ્વા. |    |
| હું પોતે છું ખાસ.                | અ. સ્વા.  | ૧૩ |
| તમે જે બોલ્યો કીધા હતા,          | સુ. સ્વા. |    |
| કરી તે દેખાડ્યા આજ;              | અ. સ્વા.  |    |
| મુજ અપરાધો જે થયા,               | સુ. સ્વા. |    |
| તે ખમજો મહારાજ !.                | અ. સ્વા.  | ૧૪ |
| ૧ સોનામહોરો. ૨ ઝુલાશો.           |           |    |

ધૂરથી માંડીને કહ્યાં,  
 જે જે કીધાં હતાં કામ;  
 એહ સાંભળી શેડજ,  
 અચરિજ પામ્યો તામ.  
 વિસ્તમય પામીને તદા,  
 જેવા લાગ્યો લામ;  
 કુસ્તૂરી એહ દેખીને,  
 કહેવા લાગી આમ.  
 જે સુજ વચનમાં કહિ,  
 નાવે તુમ વિશ્વાસ;  
 તો તુમ મિત્રના ઘેરથી,  
 મંજૂષ મંગાવો ખાસ.  
 જેથી તુમ ખાત્રી થશો,  
 નારી કહે કર જોડ;  
 અમરદટ એમ સાંભળી,  
 તુજમાં નહિ કોઈ ઓડ.  
 મુનિમે ચણુ એહ અવસરે,  
 લાંખી સધળી વાત;  
 મંજૂષ લાવી દેખાડીયો,  
 એથી થયો રળીયાત.  
 વળતું અમરદટ એમ કહે,  
 હું હાર્યો તું જીતી;  
 ઝારા કુળની લાજ તે,  
 વધારી રાખીને નીતિ.

|           |    |
|-----------|----|
| સુ. શ્રો. | ૧૬ |
| અ. શ્રો.  |    |
| સુ. શ્રો. |    |
| અ. શ્રો.  |    |
| સુ. શ્રો. |    |
| અ. શ્રો.  |    |
| સુ. શ્રો. |    |
| અ. શ્રો.  |    |
| સુ. સ્વા. |    |
| અ. સ્વા.  |    |
| સુ. સ્વા. |    |
| અ. સ્વા.  |    |
| સુ. સ્વા. |    |
| અ. સ્વા.  |    |
| સુ. સ્વા. |    |
| અ. સ્વા.  |    |
| સુ. સ્વા. |    |
| અ. સ્વા.  |    |
| સુ. સા.   |    |
| અ. સા.    |    |
| સુ. સા.   |    |
| અ. સા.    |    |

|                        |           |
|------------------------|-----------|
| એમ સાંકળી સા કહે,      | સુ. સ્વા. |
| હું છું દાસી તુમારી;   | અ. સ્વા.  |
| એમ કહેતું તુમ નવી ધરો, | સુ. સ્વા. |
| વાત નહિ એ સારી.        | અ. સ્વા.  |
| નિયતિહંસિ સૂરિરાજનો,   | સુ. શ્રો. |
| રામચંદ્ર કહે એમ;       | અ. શ્રો.  |
| અત્રીશ દાળ પૂરી થઈ,    | સુ. શ્રો. |
| આગે સુણો ધરી પ્રેમ.    | અ. શ્રો.  |

૨૨

૨૩

### દોહરા

|                                                |   |
|------------------------------------------------|---|
| અમર કહે સુણ સુંદરો !, એહ વાત નહિ જૂઠ;          | ૧ |
| તેં કરી જેહ અતાવીસું, નજરો નજર મેં દીઠ.        |   |
| દીપતિ બેહુ વિનોદથી, વાતો કરી ધરી ખ્યાર;        | ૨ |
| સનાન કરાવ્યો પ્રેમથી, કુસ્તૂરીએ તે વાર.        |   |
| લોજન પીરસ્યા ભાવથી, જેમે અમર જે વાર;           | ૩ |
| વામા પંખો લહી કરી, નાંખો પવન ઉદાર.             |   |
| ધન્ય માને અવતારને, વળી ધન્ય સુજ દીંહ;          | ૪ |
| શેઠ કહે નિજ નારીને, થાય ખુશી સા લુંહ.          |   |
| સુજ અપરાધો જે થયા, તે ખમજે તું આજ;             | ૫ |
| એમ સુણ્ણી કહે સુંદરો, એમ ન કહો શિરતાજ !.       |   |
| ત્રિય સ્વલાવે મેં તદા, હુહવ્યા પ્રલુ ! તે વાર; | ૬ |
| તે મનમાં નવી આખુશો, અવિનય થયો અપાર.            |   |
| એમ વાતો કરતા હતા, એહવે અન્યો ભનાવ;             | ૭ |
| શ્રોતાજન ! હવે સાંલયો, મનમાં રાખી ભાવ.         |   |

## દાળ તર ભી

[ આવોને નંદલાલ ! રમવા આવોને રે-એ દેશી ]

એહુવે આંધ્રો રાયનો દાસ, કરજોડીને ઠરે અરદાસ;  
રાય તેડે તુમ ખાસ, દિલમાં પ્રેમ ધરીને.

પ્રેમ ધરી પુરનાથ, દિલ. ૧

દંપતિને હું તેડવા આંધ્રો, સાથે મ્યાનો પણ ઈહાં લાંધ્રો;  
નૃપે મૂક્યો મન લાંધ્રો, દિલ. ૨

એમ સુણ્ણીને દંપતિ ચાલ્યા, મન માંહિ અતિ હર્ષે રહાલ્યા;  
રાજકારે ધામા ધાલ્યા, દિલ. ૩

ભૂપતિએ તવ સન્માન કીધું, સલા ભરીને તેને પ્રસિદ્ધું;  
સહુ સાંભળતાં નૃપે હીધું, દિલ. ૪

અમરદાની રવલભા એહ, થાએ છે મુજ ઘેણી તેહ;  
વાતો કરો તુમે જેહ, દિલ. ૫

એણે ભૂંડું કામજ કીધું, જગમાં અપજસ ઠોણી લીધું;  
તુમને એ કેણે કહી હીધું ?, દિલ. ૬

કાંઈ નથી રે ! વિચારો કરતા, જેમ આવે તેમ તમે ઉચ્ચારતા;  
તમે કોઈથી નથી ડરતા, દિલ. ૭

સતી શિરોમણ્ણુ નાર છે એહ, એહ વાતમાં નથી સંદેહ;  
જે હોય તો કહો તેહ, દિલ. ૮

અમરદાસ સામે તવ જોઈ, રાય કહે હવે સાંભળો સોઈ;  
પણી વાતો ન કરશો કોઈ, દિલ. ૯

શેડળ ! ઈહાં હવે કહો તમે, જેહ સહુ સાંભળીયે અમે;  
જેથી શંકા અમારી શમે, દિલ. ૧૦

- ધૂરથી માંડીને વાત ઉચ્ચરણે, જેવી ઘની હોય તેવીજ કરળે;  
સર્વના સંશય હરળે. દિલ. ૧૧
- એમ સાંભળી ભાંખે અમરદાત, સાંભળે ૧ સભ્યજનો એક ચિત્ત;  
વાત કહી સર્વ સત્ય, દિલ. ૧૨  
તેહ સાંભળીને જન સર્વ, મૂકી હીધેા પોતાનો ગર્વ;  
સર્વ મળી કરે રખર્વ, દિલ. ૧૩
- ભૂલ અમારી થઈ ઈહાં આરે, જે હવે કરવું હોય તમારે;  
તે સુખે કરો આ વારે. દિલ. ૧૪
- એમ સાંભળીને તવ ૩ નરવર, કહે જાઓ જલે હવે સહુ તુમ ધર;  
કરી નાવે નિંદા અવસર. દિલ. ૧૫
- નમન કરીને રાય કનેથી, ચાલી ગયા સર્વ એક મનેથી;  
અમરને અનેહ ધણેથી, દિલ. ૧૬
- નૃપ કહે રોજ તમારે આંહિ, આવી એસવું ૪ પર્વદ માંહિ;  
તુમને કહું છું ચાહી, દિલ. ૧૭
- ચાર ગામો મેં જે ઈહાં હીધાં, મુજ બહેનીને તેહ પ્રસિદ્ધાં;  
તેણુંએ ગ્રેમથી લીધાં, દિલ. ૧૮
- તેની સંભાળ કરો હવે લાય !, પચાભ્યજનોને જિમ સુખ થાય;  
મુજ દિલ ચિત્તા જાય, દિલ. ૧૯
- આમરદચે તવ માની વાત, તેથી ૬ નૃપતિને દિલ સુખ થાતાં;  
આગે સુણો અવહાત, દિલ. ૨૦
- શેઠ પગે લાગી ધર જાવે, પ્રતિદિન રાજકારે આવે;  
એમ વખત વીતાવે, દિલ. ૨૧

૧ સભામાં એઠેલા લોકા. ૨ વિનંતિ. ૩-૬ રાજ. ૪ સલા.  
૫ ગામડાંનાં માણુસોને.

કુમળ કુમર પર ગાઢો પ્રેમ, અમરદત્ત રાખે બહુ રહેમ;  
દિવસે દિવસે થાય શેમ, દિલ. ૨૨

સ્વર્ગસમાં સુખ દંપતિ <sup>૧</sup>મહાણુ, જાતો કાળ તેઓ નવી જાણુ;  
દાન પુષ્ટય કરે ટાણુ, દિલ. ૨૩

રાજક્ષારે હમેશાં આવે, તેથી અભૂધવને સુખ થાવે;  
કરે જાન જોઠી ચિત્ત રહ્યાવે, દિલ. ૨૪

એકદા સલામાં વનપાળક આવી, નૃપતિને વિનયે શીશ નમાવી.  
અરજુ કરે મન લાવી, દિલ. ૨૫

ધર્મયશા મુનિ પુંગવ આંધ્યા, સહુ જનને મન માંહિ ભાંધ્યા;  
ચાર જ્ઞાને તે સુહાંધ્યા, દિલ. ૨૬

એહુ સુણ્ણી નૃપ રાજ થાવે, દાન આપે તવ ચડતે ભાવે;  
વંદન કરવા જાવે, દિલ. ૨૭

અમરદત્ત પણ સાથે સિધાવે, કંસ્તરી પણ વાંદવા આવે;  
દેશના સુણ્ણે ચિત્ત ચાવે, દિલ. ૨૮

દાળ તેંત્રોશભી પૂરી થાય, રામચંદ્ર મુનિ કહેવે ઉમાય;  
નિયતિહરિ સુપસાય, દિલમાં પ્રેમ ધરીને. ૨૯

## દોહરા

ધર્મયશા શુરૂરાજની, દેશના પરમ પવિત્ર;  
૩નાગરજન અતિ પ્રેમથી, નિસુણુ સહુ દત્તચિત્ત. ૧

ને ૪અધ્ય ૫એાધ નિવારણી, તારણી નાવ સમાન;  
૬લાંધ્યાંદોજ ૭વિષોધિની, માનું ૮અમીનું ૯પાન. ૨

૧ ભોગવે. ૨ રાજ. ૩ નગરના લેઝા. ૪ પાપનું. ૫ સમૂહ.  
૬ અવિજ્ઞવ રૂપી કુમળ. ૭ તેને જગાડનારી. ૮ અમૃતનું. ૯ પીવું તે.

## દાળ ત૪ મી

[ ચેતન ! ચેતા રે, કામ ન મેદે, કેડો-એ દેશી. ]

ચાર અંગ મળવાં અતિ હુર્લાલ, જિનવરળુ એમ લાંખે;  
 તેમાં પણ માનવ લવ હુર્લાલ, કહું એમ પ્રવચન લાંખે.  
 સુનિવર લાંખે રે, અમીય સમાણી વાણી;  
 લવિજન ! નિસુણો રે, હેડે અતિ રસ આણી. એ ટેક. ૧  
 માનવ લવની હુર્લાલતા વિષે, દશ દ્વારાંતો લાંખ્યાં;  
 દેવો પણ જંખે એ લવને, ન્યાય ચોરાશી દાખ્યા. સુ. ૨  
 નવ પદવી મહોટી ને લાંખી, તે પણ માનવ પામે;  
 એમ માનવ લવને પરસંસ્થો, અરિહંતે અલિરામે. સુ. ૩  
 એવો ઉત્તમ નર લવ લહીને, રમિથ્યા ઉત્તિભિર નિવારે;  
 કુશરૂ કુદેવ કુધર્મ છંડીને, સમકિતને ચિત્ત ધારે. સુ. ૪  
 પંચાસ્તવને અળગા કરીને પંચ સંવર આદરને;  
 ૫ અષ્ટાદશ પાપો પરિહરીને, ચાર ધર્મ ચિત્ત ધરજો. સુ. ૫  
 દાન દેતાં કૃપણુ નવ બનશો, પચપળા સમ એ માયા;  
 તન જાતાં ધન કામ ન આવે, ધનથી કોઈ ન પ્રાપ્યા. સુ. ૬  
 ચિત્ત વિત્ત ને ૭પાત્ર વિશુદ્ધે, દેતાં દાતા કહાવે;  
 દાનને દેતાં દેલત વાધે, દાને દરિક્રિતા જાવે. સુ. ૭  
 અભય સુપાત્ર દાન ઉત્તમ કહ્યાં, ને જીવે એ આખ્યાં;  
 મેધુરથ શાળિલદ્ર પરે તેણુ, હુર્ગતિનાં હુખ કાખ્યાં. સુ. ૮  
 શીતિ ધર્મની શીતળ છાયા, ને સેવે નર નારી;  
 અસ્થયારી લગવંત સમ લાંખ્યો, ૯સંવર દ્વાર સુઝારી. સુ. ૯

---

૧. શાસ્ત્રની વાણી. ૨. મિથ્યાત્વરૂપ. ૩. અંધકાર. ૪. અદાર. ૫. વીજળી.  
 ૬. દેવાતી વરતુ. ૭. યાચક-લેનાર. ૮. પ્રશ્ન વ્યાકરણ સૂત્રના દારમાં.

અત્રીશ ઉપમા આપી શિયળને, આગમમાં જિનરાજે;  
 ઉત્તમ નવ વાડો વળી લાંખી, નેહના રક્ષણુ કાજે. સુ. ૧૦  
 ખ્રદ્યારી નવ વંધી નારી, ધન્ય ! ધન્ય ! જંખુ સ્વામી;  
 આપદ પડતાં શિયળ ન ખંડ્યું, રહ્યા ઉત્તમ પરિણામી. સુ. ૧૧  
 અંજના, સીતા વળી સુલદ્રા, ઈત્યાદિક સતી વૃંદ;  
 હુઃખ સસુદ્રનો પાર પામીને, પામી મહા સુખ કંદ. સુ. ૧૨  
 કુર્થીલ તણું જે થયા અનુરાગી, અપકીર્તિં જસ જામી;  
 સુંજ રાવણુ પદ્મોત્તરની પરે, હુર્ગતિના થયા ગામી. સુ. ૧૩  
 તપથી કઠીન કર્મ ક્ષય થાએ, તપથી પાપ પુલાએ;  
 આત્મ વિશુદ્ધિ થાએ જેથી, પુષ્ય ઉદ્ય પણ થાએ. સુ. ૧૪  
 ધત્તા સુનિને વીરે વખાણ્યો, તેમ હુંદણુ અણુગારો;  
 મુક્તિ વધુને<sup>૧</sup> કેદી મુનિ વરીયા, કરી સક્રણ અવતારો. સુ. ૧૫  
 ભાવ ધર્મ આરાધો સાદર, ભાવથી સિદ્ધિ થાવે;  
 મુક્તિ મહેલની નિઃસરણી એ, સેવો એ ભવિ ! ભાવે. સુ. ૧૬  
 ભરત, એતાચી, દઠ-પ્રહારી, ઈત્યાદિક મુનિવૃંદો;  
 શુલ ભાવે ભવજળ તે તરીયા, ત્રોડી લનના કંદો. સુ. ૧૭  
 ઈત્યાદિક ઉપદેશ દિયો મુનિ, સુણી રંજ્યા નરનારી;  
 રામ મુનિ કહે ટાળ ચોંત્રીશમી, ભવિ જીવે ઉર ધારી. સુ. ૧૮

### દોહરા:

અમરહત્ત દેશન સુણ્ણી, અતિ હુણ્ણો મનમાંય;

વિનયે વંદી પૂછતો, મુનિવરને ઉમય. ૧

કહો શુરૂ ! પૂરવ લવે, કોણુ હતો હું આપ ?;

શ્યાં શ્યાં ધર્મધર્મને, આરાધ્યાં પુષ્ય પાપ ? ૨

૧ મુક્તિ ઇપ સ્વીને.

|                                                       |   |
|-------------------------------------------------------|---|
| બુદ્ધિમત્તા મુજ નારીએ, કેળવી બુદ્ધિ અપાર;             |   |
| ધન અનર્ગણી મેળોયું, શોભાઓયો સંસાર.                    | ૩ |
| મુજ પાસેથી મેળોયો, બુદ્ધિ વડે વર પુત્ર;               |   |
| લજણ શીલ સંભાળીને, રાખ્યું ધરનું સ્કુત્ર. <sup>૨</sup> | ૪ |
| તે સહુ શાથી સાંપડયું ?, કહેા પૂર્વ ભવ વાત;            |   |
| એહુવી નારી વિત મળ્યું, તે પણ કહેા અવદાત.              | ૫ |
| ચઉનાણી વાણી વહે, સુષુ શ્રાવક ! સુવિનીત;               |   |
| ગત ભવની કહું વાતડી, સંભળ તું હતચિત્ત.                 | ૬ |

### ઢાળ ઉપ મી

[ આ ભવ રત્ન ચિંતામણિ સરીએ-એ દેશી. ]

પૂરવ ભવ ચરી ભુનિવર ભાંએ, નિસુણે દંપતી હેઠલે રે;  
તેમ નાગર<sup>૩</sup> જન પણ તિહાં નિસુણે,

ભાવ ભવે ચિત્ત હેઠલે રે. પૂ. ૧

જંખુ ભારહવાસમાં રે, કંચનપુર વર જાણ્યો રે;  
નરસિંહ નામે નરવર<sup>૪</sup> ઝડો, રાજ્ય કરે મહી રાણ્યો રે. પૂ. ૨  
વિપુણ રાણી ગુણુ ગણુ ખાણી, પતિલક્તા વર નારી રે;  
સદ્ગુણુ ધારિણી પ્રિય<sup>૫</sup> સુખ કારિણી, ઝે રંભા હારી રે. પૂ. ૩  
તે પુરમાં વસે ગુણુચંદ એકી, ધીમંતો<sup>૬</sup> ઇદ્ધિવંતો રે;  
ગુણુ સુંદરી તેહની વર વામા,<sup>૭</sup> દંપતી છે શુભ સંતો રે. પૂ. ૪  
ગ્રેમ વિલુદ્ધા<sup>૮</sup> સુખ વિલસંતા, જાણે ન ધર્મનું ભર્મ રે;  
સંગતિ નહિ છે સાધુજનની, તેથી ન જાણે ધર્મ રે. પૂ. ૫

૧ અપાર-અતિ ધાર્યું. ૨ ધરનો વારસદાર. ૩ નગરના લોકા. ૪ હેઠળતથી. ૫-૬ રાજ-પૃથ્વીનો પતિ. ૭ પતિને સુખકારી. ૮ બુદ્ધિવાળો. ૯ ખી. ૧૦ આસક્તા-તલ્ખીન.

માર્ગનુસારી તે જીવો, ચાલે નીતિ રાહે<sup>૧</sup> દે;  
 દાન પુષ્ય કરતાં તે અહેનિશ,<sup>૨</sup> દાન ધર્મને બહાએ રે. પૂ. ૬  
 દીન હુઃખી પર કરુણા આણો, હુઃસ્થિત<sup>૩</sup> જન આધારો રે;  
 દાનશાળા એક મહેઠી સ્થાપી, દાન હે વિવિધ પ્રકારો રે. પૂ. ૭  
 ભૂખ્યો હુઃખ્યો અજ્ઞને પામે, રોગીને ઔષધ આપે રે;  
 વખ્ત વિહુણુને વસતો<sup>૪</sup> આપે, હુઃખ્યાનાં હુઃખ કાપે રે. પૂ. ૮  
 નાત જાતમાં નિરાધારને, શુલ પરે સહાય કરંતો રે;  
 દૈશી વિદેશીને આશ્રય હાતા, નુપત્નુ ભાન લહંતો રે. પૂ. ૯  
 ગુણુચંદ્ર છે ગુણુનો ગિરવો, પ્રેમદા<sup>૫</sup> પણુ છે તેહવી રે;  
 મધ્ય અવસ્થાએ તે આંયાં,

સંગતિ ક્રો જુઓ કેહવી ? રે. પૂ. ૧૦  
 એકદા શ્રીમુનિયંદ્ર મુનીશ્વર, પાઉધાર્યી તે પુરમાં રે;  
 ભાવિક જનો મુનિ-આગામ જણી,

આનંદ પામ્યા ઉરમાં<sup>૬</sup> રે. પૂ. ૧૧  
 નિર્દેષ વસતિ<sup>૭</sup> યાચી મુનિવર, રહિયા તેહિજ સ્થાને રે;  
 સાધુ સંગતિ જે સુખ-કારી, હળુકમી એમ માને રે. પૂ. ૧૨  
 ભાવિક જીવાને સહયોધ આપે, ધર્મ ભાવના જગાવે રે;  
 અણુદ્ર<sup>૮</sup> જનોતે એધિ<sup>૯</sup> આપીને,

સમકિત ધારી કરાવે રે. પૂ. ૧૩  
 મુનિ પરસંસા સુણી ગુણુચંદ્ર, આવે મુનીદ્ર સમીપે રે;  
 ઉપદેશ નિસુણી સમજ્યો ધર્મને, મિથ્યા ભ્રમને કાપે રે. પૂ. ૧૪  
 પતિ સુખથી પરસંસા નિસુણી, ગુણુસુંદરી પણુ આવે રે;  
 એધ સુણીને મુનિવર કેરો, તે પણ રાજ થાવે રે. પૂ. ૧૫

૧ માર્ગો. ૨ રોગ. ૩ હુઃખી. ૪ કપડાં. ૫ ખ્રી. ૬ હંદ્યમાં.  
 ૭ જગ્યા. ૮ અર્ગાની. ૯ સમકિત-સત્ય વરતુની પિણાણ.

હેવ શુરૂ ને ધર્મની ઉપરે, શ્રદ્ધા રાખી સુપરે રે;  
 ધર્મ તણ્ણી કરણી તે કરતાં, ઉદ્વલટ આણુને ઉરે રે. પૂ. ૧૬  
 મુનિચંદ્ર મુનિ સંઘના આથહે, ચોમાસું તિહાં કીધ રે;  
 હળુકમીં કેઈ નર નારી, લાલ અલબ્યો લીધરે. પૂ. ૧૭  
 ગુણુચંદ્ર પણુ લાવ વિશુદ્ધે મુનિની સેવા કરતો રે;  
 દાન પુણ્ય શુલ કરણી કરતો, પાપ ૧૫ કને હરતો રે; પૂ. ૧૮  
 ગુણુસુંદરી કરે ધર્મની કરણી, પણુ માયા મન રાખે રે;  
 માયા સહિત જે કરણી કરતા,

તે શુલ ઝળ નવિ ચાખે રે. પૂ. ૧૬  
 મ્હોટ્ય લેવા માયા કેળવે, સાધુ શ્રાવક પાસે રે;  
 તેમજ શ્રાવિકા પાસે પણુ કરે,

પ્રત લેઈ રમિથ્યા ઉલાખે રે. પૂ. ૨૦  
 સરળતા વિષુ સફળી નહિ કરણી,

ભવ ૪ લવ થાય ન તેહના રે;  
 ચાર કષાયમાં માયા મ્હોટી,

૫ વિરુદ્ધાં ઝળ કદ્યાં જેહનાં રે. પૂ. ૨૧  
 આસ માસ કરે તપ પારણું, જે છે માયાવંત રે;  
 તો પણ ભવ અન'તા કરતાં,

૬ આયારે કહે ભગવંત રે. પૂ. ૨૨  
 ઉદ્દૃષ્ટ માયાનું એ જાણું, ટાળો એ ૭ અજઅત્થ દોષ રે;  
 સરળતાથી છે સફળી કરણી, થાયે આતમ પોષ રે. પૂ. ૨૩  
 શ્રાદ્ધ તણી કરણી શુલ કરીને, ૮ પરિધળ આપી દાન રે.  
 ગુણુચંદ્ર આશુદ્ધ પૂર્ણ કરીને, તું ઉપનો એ સ્થાન રે. પૂ. ૨૪

૧ કાદ્વને. ૨ ઝોડું. ૩ ઝોડે. ૪ ઓછા. ૫ કડવાં. ૬ આચારાંગ  
 સૂતમાં. ૭ માહું. ૮ આત્માને તુકદ્યાન કરનાર દોષ. ૯ ધારું.

આમરદત્ત એલિધાન ઠીઠું શુલ, દાનથી પામ્યો રિદ્ધિ રે;  
ધર્મથી ઉત્તમ કુળ તું પામ્યો,

૨ વિપુળ મળી સમૃદ્ધિ રે. પૂ. ૨૫

ગુણસુંદરી પતિ મરણ લહ્યા પણી, ધરતી મનમાં શોક રે;  
શુલ ક્ષેત્રોમાં વિત્ત વાવરતી, ઓમોદે થોકના થોક રે. પૂ. ૨૬  
પુણ્ય પ્રકૃતિ બાંધી રૂડી, પણ માયાને લોગે રે;  
ત્રિયા વેદ ન ટળીયો તેહનો,

૩ ભાવિ ભાવને લોગે રે. પૂ. ૨૭

ત્યાંધી ચવી તુજ નારી થઈ એ, માયાથી માયા કીધી રે;  
દાન ધર્મથી માયા મળી બહુ,

૪ જગમાંહે કીર્તિ લીધી રે. પૂ. ૨૮

એહ પૂરવ ભવ વાત સુણુવી, ધર્મયથા ગુરૂરાજે રે;  
દાળ પાંત્રીશમી રામ પયંપે, ૫

૫ સદગુરને શુલ સહાજે રે. પૂ. ૨૯

દોહરા

૬ મુનિ વાણી શ્રવણું સુણું, ભવી પામ્યા ઉદ્વાસ;

૭ પતિના સંશય ટજ્યા, સક્ષળ ધર્ઢ મન આશ. ૧

૮ માયાના સેવન થકી, ન ટજ્યો નારી—વેદ;

૯ દાને લક્ષ્મી સાંપડી, શ્રવણું તણો એ લેદ. ૨

૧૦ માયા કપટ ન કીળુએ, કડવાં કળ સુણું તાસ;

૧૧ સરળ થયા કેદ જનો, છોડ્યો માયા પાસ. ૩

૧૨ દાન તણો મહિમા સુણું, દાનેથરી કેર્દ થાય;

૧૩ એહવા લાલો મેળવ્યા, સંગતિ તણો સુપસાય. ૪

૧ નામ. ૨ ધર્માં. ૩ ઉત્તસાહથી. ૪ સ્ત્રી. ૫ કહે. ૬ કાને.

૭ સાંલળગવાનો.

નારી સહ અમરદાતો, શ્રાવકનાં વ્રત ખાર;  
આદરીયાં આદર પણે, સફળ કરણું ૧ અવતાર. ૫  
શુરૂનું જ્ઞાન પ્રશ્નસતા, કરતા અતિ ગુણુથામ;  
નમન કરીને આવીયા, પોત પોતાને ધામ. ૬  
ધ્રૂમ્યથા શુરૂરાજજી, રવિહૃર્યા અન્ય પ્રદેશ;  
લગ્નનો પ્રતિષ્ઠાધતા, આપી ઉવર ઉપરેશ. ૭

### ઢાળ તેથી મી

[ આદર જી ! ક્ષમા-ગુણ આદર-એ દેશી. ]

અમરદાત નિજ નારી સંચુતો,  
અર્હદ ધર્મ આરાધે જી;  
દાન પુણ્ય કરતો મન પ્રીતે,  
ત્રણે ધર્મને સાધે જી. ૧ પુણ્ય ૧  
પુણ્યવંતનાં ચરિત્ર સુણો લની !  
પવિત્ર થાય છે પ્રશ્રવણાં જી;  
ધર્મ તણું પ્રગટે ઉવર ભાવના,  
એહુ પ્રવચનનાં વયણું જી. ૨ પુણ્ય. ૨  
સામાધિક પોખા પડિજીમણું,  
કરતાં ચડતે ભાવે જી;  
સાધર્મિક લાઇયોની સેવા,  
કરતાં તે વડહાવે જી. ૩ પુણ્ય. ૩  
કમળ પુત્ર નવયોવને આવ્યો,  
કુલીન કન્યા પરણુવે જી;

૧ કરવા. ૨ વિચરવા લાગ્યા. ૩ એષ્ટ, ઉતમ. ૪ ધર્મ, અર્થ-  
ચૈસો અને કામ-દિનદ્ય સુખો. ૫ કાન. ૬ ઉતમ. ૭ શાસ્ત્રનાં. ૮  
મહોયા ઉસાહથી.

વિપુળ વિત્ત ખર્ચું તે વેળા,

જન રળીયાયત થાવે જી. પુણ્ય. ૪

વિનયવતી વધુ લાભ્યા ગેડે,

પૂર્ખ ધર્મની રાગી જી;

સાસુ સસરા વડિલ જનોની,

સેવા કરે વડભાગી જી. પુણ્ય. ૫

પંચ વર્ષ વીત્યા પછી એકદા,

અમરદટ્ટ વિચારે જી;

આ રે ૧વિનશ્વર ૨વિશ્વની માંડે,

ધન્ય ! તે આતમ તારે જી. પુણ્ય. ૬

હું પણ પદિમંથું છોડીને હવે,

શ્રમણુપણુંછ સ્વીકારું જી;

ચારિત્ર વિષુ મુક્તિ નહિ મળશે,

તે ભણી આતમ તારું જી. પુણ્ય. ૭

એહુવી ઉત્તમ ભાવના ભાવે,

એહવે કસ્તૂરી આવે જી;

યદ્યપ્ય પ્રણમીને પ્રીતમં આગે,

એહજ ભાવ જણુંબે જી. પુણ્ય. ૮

અગવતીજ દીક્ષા લેવા કેરી,

ઉલયનીજ ભાવના થાવે જી;

એહવે તેમના ભાગ્ય ઉદ્ઘયથી,

ધર્મયશા શુરૂ આવે જી. પુણ્ય. ૯

આગમ સુણું શુરૂરાજનો પુરમાં,

દંપતી ઉલ્લંસ્યા તનમાં જી;

૧ નાથવંત. ૨ જગતમાં. ૩ પરિથિં-ઉપાધિ. ૪ સાધુપણું.

૫ પગ. ૬ પતિ. ૭ તીર્થ-કરોએ ખતાવેલો-પવિત્ર. ૮ બન્નેતી.

વંદન કરવા આવે ભાવે,

હરખાતાં અતિ મનમાં જી. પુણ્ય. ૧૦

નગર તથાં રાજી નર નારી,

આવે સુષુવા વાણી જી;

મુનિવર આપે તેહ જનેને,

દેશના અમીય સમાણી જી. પુણ્ય. ૧૧

દેશન અંતે શ્રેષ્ઠી<sup>૧</sup> અમરદાત્ત,

વિનયથી કહે એમ વાણી જી;

ઓ શુરૂ ! અમને ઘો ફીક્ષા,

પતીત<sup>૨</sup> પાવન<sup>૩</sup> કલ્યાણી<sup>૪</sup> જી. પુણ્ય. ૧૨

શુરૂ કહે સંયમ માર્ગ પાળવો,

હૃષ્કર છે પ્રાણીને જી;

પુહગલાનંદી<sup>૫</sup> છે જે જીવો,

ન લહે નિર્વાણીને<sup>૬</sup> જી. પુણ્ય. ૧૩

શેડ કહે સ્વામી ! એ સાચું,

પણ જે જ્ઞાનાનંદી જી;

તેહને સંયમ પાળવો સહેલો,

મોહ જોહુ<sup>૭</sup> નિકંદી<sup>૮</sup> જી. પુણ્ય. ૧૪

સાચો રંગ દંપતીનો ભાણી,

થથા<sup>૯</sup> સુખ<sup>૧૦</sup> કહે શુરૂ જી;

વંદન કરી દંપતી ધર આવે,

અલી મતિ તસ સૂત્રી જી પુણ્ય. ૧૫

૧ શેડ. ૨ ચાર ગતિનાં દુઃખથી સાંઘર્ષતાને. ૩ પવિત્ર-સુખી કરનાર. ૪ કલ્યાણ કરનારી. ૫ પૌર્ણગલિક સુખમાં આનંદ માનનાર. ૬ મોક્ષને. ૭ મોહ ઇય યોજાનો. ૮ નાશ કરીને. ૯ જેમ સુખ ઉપને તેમ કરો.

પરિજ્ઞન<sup>૧</sup> તેડી કમળ પુત્રને,  
સોંપે ધરનો ભારો છુ;  
સાજન<sup>૨</sup> જન સમજવે રાગે,  
રાખવા તસ આગારો છ. પુષ્ય. ૧૬  
અચળ લાવ છે મેરુ સમ તસ,  
તે કિમ અટકે તેહથી છ ?;  
મહા મહોત્સવ કરે દીક્ષા કેરો,  
કુમળ કુમર અતિ સ્નેહથી છ. પુષ્ય. ૧૭  
ગુરુ સમીપે આવે લાવે,  
પરસંસે નર નારી છ;  
છતી ઋદ્ધિ ત્યાગી વૈરાગ્યે,  
આછા<sup>૩</sup> એહ અવતારી છ. પુષ્ય. ૧૮  
ગુરુને કહે આપો હવે દીક્ષા,  
જેહથી ભવ જળ તરીએ છ;  
વિશુદ્ધ લાવે કરણી કરીને,  
સત્ત્વર<sup>૪</sup> શિવવધૂ<sup>૫</sup> વરીએ છ. પુષ્ય. ૧૯  
નિર્મળ લાવ જાણી દંપતીના,  
સંયમ સ્વરૂપ સમજવી છ;  
અમણું તણું ક્રત આપે લાવે,  
ગુરુલુ કૃપા વર લાવી છ. પુષ્ય. ૨૦  
ધર્મનો મહિમા પ્રસરો લારી,  
સરળ થયા કેર્દી પ્રાણી છ;  
દાળ છત્રીશમી એ થઈ પૂરી,  
રામ સુનિની વાણી છ. પુષ્ય. ૨૧

૧ કુદુંઘીએને. ૨ સનજ્ઞન. ૩ સારા. ૪ જણ્ણી. ૫ મુક્તિ સ્વી.

## દોહરા

|                                            |   |
|--------------------------------------------|---|
| કુમળ કુમર શુરૂ સંનિધે, શ્રાવકનાં પ્રત લીધ; |   |
| ભીજ પણ કેર્છ જને, લીધા નિયમ વિવિધ.         | ૧ |
| ધન્ય હિવસ તેહ માનતા, મુનિ વંદી નર નાર;     |   |
| આવે નિજ નિજ મંહિરે, પ્રશંસતા અણગાર.        | ૨ |
| શ્રીમતી ગુરુણીને હવે, ધર્મ-ચંશા સુનિરાજ;   |   |
| આર્યાલુ કસ્તૂરીને, સોંપે આપી સહાજ.         | ૩ |
| કર્યો વિહાર મુનિ મંડળો, રજતપદમાં વિચરંત;   |   |
| ઉસ્થવિર કને નૂતન મુનિ, અંગ ધૃગ્યાર લખુંત.  | ૪ |
| વિનય કરે સહુ મુનિ તણો, અંગે તળ પ્રમાદ;     |   |
| સાધુ પવિહિત આચારને, પાળે તળને વાદ.         | ૫ |
| દ્યતિધર્મ આરાધતા, પરિષહ સહે બાવીશ;         |   |
| દંલ રહિત કિરિયા કરે, ને લાંખી જગહીશ.       | ૬ |

## ઢાળ ઉઠ મી

[ એ પ્રત જગમાં દીવો મેરે ઘાર-એ દેશી. ]

અમરદા મુનિ મહા વૈરાગી, સિંહ પરે સંયમ પાળે;  
દ્વિપુળ જાન મેળંચુ ગુરુ પાસે,

આતમ શુણુ અજવાળે. હો ભવિકો !

સંયમ પદ આરાધો,

નેહુથી શિવ પદ સાધો. હો ભવિકો ! સંયમ. એ ટેક. ૧

૧ ગુરુ સમાપે. ૨ દેશમાં. ૩ શાલેના જાથુકાર અનુભવી વૃદ્ધ  
સાધુઓ. ૪ નવ દીક્ષિત. ૫ સાધુને આચરવા યોગ્ય. ૬ સાધુના ધર્મને  
૭ તીર્થકરોણે. ૮ ધાર્યા.

તપ વિવિધ પ્રકારે કરતા, કર્મ નિર્જરા હેતુ;  
કર્મ નિવિડ પણ એહથી તૂટે,

જે લખ સાથર રેસેતુ. હો. લ. સં. ૨  
વંદ્ક નિંદકને સમ ગણુતા, માન સન્માને તેવા;  
સમલાની સમતા ગુણ લીના,

સદ્ગ કરે શુરૂ સેવા. હો લનિકો ! સં. ૩  
ગુરુ આદેશે ભવી પ્રતિબોધે, મધુર વહે પ્રિય વાણી;  
જેહ અખૂજ અભાણી પ્રાણી,

તેહને કર્યા શુલ નાણી. હો. લ. સં. ૪  
ધર્મ જાગૃતિ કરે વિધ વિધ પરે, ધર્મ લાવ પ્રગટાવે,  
વિવિધ જાતિના નિયમ કરાવે,

આત્મિક ગુણ વિકસાવે. હો. લ. સં. ૫  
ધ્યાન ઝસ્વાધ્યાયે મર્ય રહે નિત્ય, આધ્યાત્મિક રસ ચોષે;  
રમણ કરે નિજ લાવમાં પણેનિશ,

પરભાવોને શોષે. હો. લ. સં. ૬  
વીશ વર્ષ સંયમ પર્યાયને, પાળીને સંદ્ભાવે;  
ગુરુ આણુા લહી કીધ સંથારો,

ચડોયા ક્ષાયક નાવે. હો. લ. સં. ૭  
નિર્મળ લાવે કેવળ પામ્યા, લોકા-લોક-પ્રકાશી;  
સંઘળાં કર્મી નાશ થયાં તિહાં,

રાગ દ્રેષ ગયા નાણી. હો. લ. સં. ૮

૧ આકરાં. ૨ સંસાર સમુદ્ર ઉત્તરવાને પૂલ ૩૫. ૩ પાંચ પ્રકારની  
સંજાય. ૪ આત્મસ્વરપમાં લીનતા ૩૫. ૫ રાત દિવસ. ૬ ક્ષૃપક-  
શ્રેણી ૩૫.

આયુષ્ય કર્મનો અંત કરીને, ૧૫ંચમી ગતિને પામ્યા;  
શાશ્વત સુખડાંને તે પામી,

સકળ હુઃએને રવામ્યાં. હો. લ. સં. ૬

અશરીરી અવિકારી અરૂપી, અંયાણાધૃ સુખ લોણી;  
મુનજ્ઞન્મણ કરવો નથી જેહને,

વર્તે સહા કે અશોણી. હો. લ. સં. ૧૦

સંયમ પદથી સિદ્ધ પદ પામ્યા, સંયમ પદ જ્યકારી;  
સંયમ પદ આરાધ્યા ગ્રાણી !,

સંયમ પદ સુખકારી. હો. લ. સં. ૧૧

હવે સાધ્વી શ્રી ઉસ્તૂરીનો, નિસુણો લવી ! ૫અવદાતો;  
ગુરુષીલુંને શરણે રહીને,

કાળ ન જણો જાતો. હો. લ. સં. ૧૨

શાસ્વાલ્યાસ કાર્યો પરિપૂર્ણ, વિનય કરી સહલાવે;  
કર્મ નિર્જરા કરવા કારણ,

તપ કરતા વડદાવે. હો. લ. સં. ૧૩

ગુરુષી સંગે જનપદેં વિચરે, જિનવર આણુ આરાધૈ;  
ધર્મ-ઓધ આપી કેઈ જનને,

સ્વપર કાર્યો સાધે. હો. લ. સં. ૧૪

વિવિધ અભિથહ ધારે અહેનિશ, વિવિધ તપો આચરતા;  
શાંતિ સમાધિ સરળતા રાખે,

પરિષહુથી નવ ડરતા. હો. લ. સં. ૧૫

જિનશાસન અજવાણે ઉત્તમ, જન્મ કૃતારથ કીધેણા;

---

૧ મોદ્દા. ૨ કાણ્યાં. ૩ બાધા-પીડા રહિત. ૪ ફરીથી. ૫ હક્કિકત.  
૬ દેશમાં.

અતિતા<sup>૧</sup> પાવન<sup>૨</sup> કીધા કેર્દ જન,

નરભવ લાહો લીધો. હો. લ. સં. ૧૬

ત્રીશ વર્ષ<sup>૩</sup> એમ સંયમ પાળી, અનશન કરવા છયાછે;  
કરકુજૃ<sup>૪</sup> જોડી વિનય કરીને,

ગુરુણ્ણિલને પૂછે. હો. લ. સં. ૧૭

આચુષ્ય અદ્વય જાણીને ગુરુણ્ણી, અનશન આણ્ણા આપે;  
તન-માયા<sup>૫</sup> છોડીને સત્તવર,

અનશને પ્રતને સ્થાપે. હો. લ. સં. ૧૮

સર્વ ઉપાધિ છોડી મનથી, શાંતપણે જિન જ્યતા;  
રમણુ કરે આત્મક સદગુણુમાં,

વિકૃત<sup>૬</sup> ભાવો વમતા.<sup>૭</sup> હો. લ. સં. ૧૯

સમતા ભાવે કર્મ નિર્જરતા, શુક્લ ધ્યાનને ધ્યાવે;  
અપૂર્વ-કરણો<sup>૮</sup> ઉપશમ<sup>૯</sup> છોડી,

બ્રેણ્ય ક્ષપક પર આવે. હો. લ. સં. ૨૦

ધનધાતિક<sup>૧૦</sup> ચંડા<sup>૧૧</sup> કર્મ ખપાવી, કેવળ કમળા વરીયા;  
ભાવ પ્રચ્છન્ન<sup>૧૨</sup> પ્રગટ પણે જાણ્યા,

સકળ દોષને હન્તીયા. હો. લ. સં. ૨૧

સિદ્ધ બુદ્ધ પારંગત થધને, લોકાંત્રે જર્દ વસીયા;  
અજર અમર પદને તે પામ્યા,

થયા અનંત સુખ રસીયા. હો. લ. સં. ૨૨

૧ દુઃખીજનોને. ૨ પવિત્ર-સુખી. ૩ હાથ રૂપ કમળ. ૪ શરીરરોનો  
મોહ. ૫ પૌરુણ્ણિક સુખોની ઘંથાઓ. ૬ દૂર કરતા. ૭ આડમા  
ગુણુદ્ધાણે. ૮ ઉપશમ બ્રેણ્યને. ૯ આત્મગુણોનો ધાત કરનારાં. ૧૦  
ચાર. ૧૧ જાતા.

## ઉપસંહાર

શિયળ સંયમથી સિદ્ધ પદ પામ્યા, વામ્યાં હુર્ગતિ હુઃખડાં;  
એણી પરે ને લવિ જીવો કરશો,

પામશો તે શિવ-સુખડાં. હો. ભ. સં. ૨૩  
એ અધિકાર સુણ્ણી લવી ! લાવે, પાળજે સંયમ શીલા;  
આ લવ પર લવ સુધરે જેથી,

પામશો જેમ સુખ લીલ. હો. ભ. સં. ૨૪  
કૃથા-મહેદાધિ અંથથી ઉદ્ધરી, રચીયો. એહ સંખંધ્યો;  
આળ બુદ્ધિએ રચના કીધી,

છોડી વિકથા ધંધ્યો. હો. ભ. સં. ૨૫  
મુજ ઉપકારી <sup>૧</sup>પ્રજ્ઞાવંતા, માણ્ણેકચંદ્રજી સ્વામી;  
તસ આથહુથી રાસ એ રચીયો,

સ્વ-પરને હિત કામી. <sup>૨</sup> હો. ભ. સં. ૨૬

## પ્રશસ્તિ

કુચ્છ ભૂમિને પાવન કર્તા, અમરાલિધજી<sup>૩</sup> સ્વામી;  
આચારે ઉજળા<sup>૪</sup> આચારજ,

નવિ કોઈ ગુણુમાં ખામી. હો. ભ. સં. ૨૭  
તસ પાટે આચારજ ઉત્તામ, રંગજ સ્વામી નામી;<sup>૫</sup>  
તેહના શિષ્ય પ્રવર<sup>૬</sup> વૈરાગી,

પાનાચંદ્ર સ્વામી. હો. ભ. સં. ૨૮  
શિષ્ય શિરોમણિ તેહના સુંદર, પૂજ્યપાદ વડલાગી;

૧ બુદ્ધિવાળા. ૨ ધર્માવાળા. ૩ દેવજ. ૪-૫ શ્રેષ્ઠ. ૬ અસંત.

સદગુર કર્મસિંહજી સ્વામી,

સાધુ વૃદ્ધે<sup>૧</sup> સોલાળી. હો. લ. સં. ૨૬

તસ પદ સેવક રામ મુનિયે, લભ્ય જનોને હેતે;

પ્રજારીલ ઉપર કરી રચના,

ગુરુ ભાતા સંગ રહેતે. હો. લ. સ. ૩૦

મુનિજ નિધિ<sup>૨</sup> અહું શરીર સાથે સેષે, વિજયાદશમી તિથિયે;

ગુરુવારે અજ્ઞાનપુરે<sup>૩</sup> રહીને,

કવિતા કરી શુલ વિધિએ. હો. લ. સ. ૩૧

સાડનીશ દળોની એ રચના, કીધી તે લવી ! જોણે;

તેમાં ઓછું અધિકું ભણાયું,

મિથ્યા ફુઝુત હોણે. હો. લ. સં. ૩૨

સુરગિરિ<sup>૪</sup> સુરસરિતા<sup>૫</sup> અહમંડળ,<sup>૬</sup> જથ્વંતા ભૂતળમાં,<sup>૭</sup>

ત્યાં લગે હોણે રાસ એ અવિયળ,<sup>૮</sup>

શુલ પરે એહ જગમાં. હો. લ. સં. ૩૩

વાંચશે સાંલળશે જે લવિ પ્રાણી, શ્રદ્ધા રાખી જિવિલાસે;

મંગળ પ્રાસિ તેહને હોણે,

રામ વચન સુવિલાસે. હો. લ. સં. ૩૪

ધતિશ્રી-જૈન-શ્વેતાંધર-સ્થાનકગારી-કંઠાષ્ટ કોટિ-બૃહૃત્પક્ષીય  
સંપ્રદાય-ભૂષલુ-પૂજયપાદાચાર્ય-શ્રીકર્મસિંહજિત્સ્વામી-  
ચરણાંધુજ-મધુકર-મુનિશ્રી રામચંદ્ર-વિરચિતો ગુજર્ર-  
લાષાયાં ઘૌપપાતિકી બુદ્ધિ-પ્રલાનદર્શક-શ્રી  
અમરહાતા-કસ્તૂરીસતી-રાસોયં સમાતે:

૧ સમુદ્દરમાં. ૨ અંનરમાં. ૩ મેરુ પર્વત. ૪ ગંગા નદી.

૫ તારામંડળ. ૬ પૃથ્વી પર. ૭ અખંડ.

દાન અને ધર્મની અટલ શ્રદ્ધા દર્શાંક-

## લલિતાંગ કુમરનો રાસ

૫

રચયિતા:-

સ્વ. આચાર્યશ્રી કર્મસિંહલુસ્વામીના શિષ્ય-  
સુનિ સમયંદ્રળ (કૃદ્ધી)

-

દન્ય સહાયકઃ

કૃદ્ધ-વાંકીના રહીશ શાહુ હીરળ મોણુશીએ  
પોતાના સ્વર્ગસ્થ બહેન લીલબાઈના  
પુણ્ય-સમરણાથે આ રાસ છપાવી,  
પોતાના સ્વર્ધમી ણંધુઓને  
લેટ કરેલ છે.



સર્વ જીવાય નમઃ

ભમ ગુરૂભ્યો નમઃ

ધર્મ પ્રકાશ દર્શાંક-

# શ્રી લલિતાંગ કુમારનો રાસ લિખ્યતે દોહરા

સુખકર સાહેબ શાન્તિલુ, શાન્તિ તણું દાતાર;  
શાન્તિ પસારી જગતમાં, જપતાં જ્ય જ્યકાર. ૧

સરસ્વતી માતા નમી, સદગુર લાગું પાય;  
ધર્મના ગુણ વર્ણિંદું, જિમ મુજને સુખ થાય. ૨

સંકટ ધર્મને હુવે, પાપી બહુ કૂલાય;  
પણ અંતે જ્ય ધર્મનો, અધર્મથી ક્ષય થાય. ૩

પરની લલાઈમાં તમે, સમજો આપ લલાઈ;  
અવરની ખૂરાઈ થકો, થાશો નિજ ખૂરાઈ. ૪

અથ તે ઉપર વર્ણિંદું, લલિતાંગ અધિકાર;  
સ્નેહળ થઈ શોતા ! સુણો, આળસ નિદ્રા નિવાર. ૫

## ઢાળ હી લી

[ ભોલીડા હંસા રે ! વિષયે ન રાચીએ-એ દેશી. ]

૧ જાણ્યુદ્ધીપે રે રખારહવાસમાં, પ્રાંચાળ દેશ મુઅર;  
શ્રીવાસ પત્તનપુર અતિશય લલું, ગઠ મઠ પોળ પ્રાકાર.

લવિજન ! ભાવ ધરીને સાંલળો. ૧  
નંરવાહન રાજ તિહાં રાજતો, ન્યાય ધર્મ પ્રતિપાળ;  
દાની માની રે જ્ઞાની અતિ લદો;

સદગુણુ ધારી દ્યાળ. લ. ૨

રાણ્ણી ઉસાણ્ણીરે કુમળા તેહને, પતિલક્તા સુકુમાળ;  
ધર્મ કર્મનાં રે કાર્ય સમાચરે,

નાતો ન જણે રે કાળ. લ. ૩

એકદા રાણ્ણી રે સૂતી સેજમાં, હેણે ઈસુમિષુ પ્રમોદ;<sup>૫</sup>  
કાનનમાંથી રે ડેશરી આવીને, એઠો હેણે રે ગોદ. લ. ૪  
સ્વર્ણ હેખીને રે જાગૃત થઈ તદા, ચિંતે સા મનમાંહિ;  
ઉતમ ઉસુહણું રે એ છે માહરું,

લાભ હોશે શ્યોરે આંહિ ? લ. ૫

એમ આલોચી રે આવી નૃપ કને, મધુર કરે રે આલાપ;  
એહ સુણીને રે નૃપ અવલોકતો, હેણે રાણ્ણીને આપ. લ. ૬  
આગમ કારણુ તેહને પૂછીયું, સા કહે સ્વમની વાત;  
ક્યું ક્રણ હુશે રે સ્વામી ! મુજને ?,

કહેને મુજ અવદાત. લ. ૭

૧ જાણ્યુ. નામા વૃક્ષથી ઓળખાતો અને સર્વ દોપેના વચ્ચે-  
મધ્યમાં રહેલો. દ્વિપ. ૨ ભરતક્ષેત્રમાં. ૩ ડાલ્ચા, અતુર. ૪-૭ સ્વર્ણ.  
૫ આતંકદાયક. ૬ જગલ, વન. ૮ ગાયત. ૯ આવવાતું.

રાય વિચાર કરી કહે રાણુને, કેશરી સમ ખળવંત;  
કુળાધાર ૧અંગજ તમે જનમશો,

રાણુ સુષ્ણુ હરખંત. લ. ૮

૨કરકજ જોડી રે નૃપને એમ કહે,

આપ વચન હો ! પ્રમાણુ;

તિહાંથી ચાલીને નિજ ધામે જઈ,

કરે ધર્મ જાથીકા સુભાણુ. લ. ૯

૩કોવિદ ૪પ્રાતે રે ૫નરવર તેડીને, પૂછે ૬સુમિષુ વિચાર;

શાસ્ત્ર વિદોકીને સ્વર્ણ પાઠક કહે,

એહ ઊસ્વાળ છે ૮શ્રીકાર. લ. ૧૦

૪૪સ્વર્ણ પ્રમાણુ રે હોશે તુમ ધરે, પુત્ર શુણુ સુખકાર;

એહ સુષ્ણુને રે ૯ભૂધવ હરખીયો,

ઉછળયું હૃદય તે વાર. લ. ૧૧

૧૦સુક્રિતકની પરે ૧૧મોહિતક ઉપતું,

૧૨મહિષી ઉદ્દરે રે તામ;

ગર્ભ તાણું સા પ્રતિપાળન કરે,

રાણુ શાણુ રે આમ. લ. ૧૨

જે જે હોહળા રે ઉપજે રાણુને, તે તે પૂરે રે રાય;

સુખે સમાધે રે ગર્ભ વૃદ્ધિ હોવે,

૧૩પ્રમદ્દા મન ઉચ્છાય. લ. ૧૩

પૂરણ માસે રે કુંવર જનમીયો, રાણુ હરખ ન માય.

૧ દીકરો. ૨ એ હાથ. ૩ સ્વમપાદક. ૪ સવારમાં. ૫-૬ રાજ.

૬-૭ સ્વર્ણ. ૮ ઉતામ-શ્રેષ્ઠ. ૧૦ છીપતી જોમ ૧૧ મેતી. ૧૨-૧૩  
રાણુ.

ઢાસી વધાઈ રે આપે રાયને,

નૃપ હીથે દાન ઉમાય. લ. ૧૪

જન્મ મહોત્સવ કરીને ભાવથી, ચાચકને હીથે દાન; વધામણું આવે નૃપ આંગણે, સત્કારે રાજન. લ. ૧૫  
સૂતક ટાળી રે ખારમે વાસ રે, સ્વજન સંતોષી રે ત્યાંય; દુલિતાંગ અલિધા સ્થાપે ગ્રેમથી,

સહુ જન હર્ષિત થાય. લ ૧૬

રામચંદ્ર કહે પહેલી દાળમાં, જન્મ તણો અધિકાર; નિયતિહરિ સૂર્યિરાજ પસાયથી, હોશે જય જય કાર. લ. ૧૭

### દોહરા

પંચધાવે કરી વાધતો, કુંવર રૂપ નિધાન;

અનુક્રમે વધતાં તે થયો, વર્ષ સાત શુલ વાન. ૧

ભૂપતિ મનમાં ચિંતવે, ભણુવા મૂકવો બાળ;

નૈથી અવિષ્ય તેહતુ, સુધરે અતિ ઉજમાળ. ૨

### અંતર દોહરા

સે વરસનો માનવી, જે વિદ્યા ન લણુલ;

બાળ બુદ્ધિ તેમાં હશે, થશે નહિ સુધરેલ. ૧

યત:-વિદ્યા નામ નરસ્ય રૂપમધિકં પ્રચ્છત્ત્ર ગુપ્તં ધન,

વિદ્યા ભોગકરી યશ: સુખકરી વિદ્યા ગુરુણાં ગુરુઃ ।

વિદ્યા બન્ધુજનો વિદેશગમને વિદ્યા પરં દૈવતં,

વિદ્યા રાજસુ પૂજિતા ન તુ ધનં વિદ્યા વિહીન: પશુ: ॥૧॥

ન ચૌર ચોર્ય ન ચ રાજગ્રાહં, ન ભાતુભાજયં ન ચ ભારકારી ।

વ્યયે કૃતે વર્દ્ધત એવ નિત્યં, વિદ્યાધનં સર્વે ધનં પ્રધાનમ् ॥૨॥

૧ દ્વિસે. ૨ નામ.

## પૂર્વ દોહરા

- એમ આદોયો<sup>१</sup> મોક્ષે, પઠનશાળામાં<sup>૨</sup> તામ;  
સ્વદ્ધ્ય સમયમાં બાળ તે, શીખ્યો કળા તમામ.      ૩
- પાઠક<sup>૩</sup> નંદન<sup>૪</sup> તેડીને, આવે રાય હજૂર;  
મહીપતિ<sup>૫</sup> દેખી હરખીયો, પુત્ર કળા લરપૂર.      ૪
- દાન દેખ્ય સંતોષીયો, પાઠકને<sup>૬</sup> ધરી ખ્યાર;  
અયારાક<sup>૭</sup> તેહને કર્યો, માને ધન્ય અવતાર.      ૫
- સુખમાંહે કુંવર રહે, વિનયી દિવેકી સાર;  
પિતરીની<sup>૮</sup> ભક્તિ કરે, મનમાં આણ્ણી ખ્યાર.      ૬
- હુવે તમે લવિયણુ ! સાંલળો, આગે શુ બને વાત ?;  
એહ સાંલળતાં સર્વને, ઉપજશે સુખ સાત.      ૭

## દાણ ર ૭

[ કૃપૂર હોવે અતિ ઉજળો રે-એ દેશી. ]

- રાયને લૂતયો<sup>૧</sup> છે ધણ્ણા રે, તેહમાં વડેરો ભૃત્ય;  
સુરહાત એહવે નામથી રે, અનેક ગુણોતું નિધાન. ચતુર નર !.

છોડો હુર્જન સંગ. એ આંકડી. ૧

- રતનમંજરી નામે લક્ષી રે, તેહ તણ્ણી વર નાર;  
તેહની કુક્ષીથી ઉપનેં રે, પુત્ર એક તેણ્ણી વાર. ચ. છો. ૨
- નામ તો સભજન આપીયું રે, પણ શુણુ નહિ તસ અંગ;  
હુર્જન માંહ શિરેમણુ રે, વિપરીત દંગ ને રંગ. ચ. છો. ૩
- કુંવર ને સભજન તણ્ણી રે, માંહો માંહ થઈ પ્રીત;  
જીવ એક દેહ જુગુઆ રે, જળ મીન<sup>૧૦</sup> કેશી રીત. ચ. છો. ૪

૧ વિચારીને. ૨ નિશાળે. ૩-૬ માસતર. ૪ પુત્ર. ૫ રણ.

૭ કદી પણ માંગવાપણું ન રહે તેવો—અદરિદ. ૮ માતા-પિતાની.

૯ નોંધરો. ૧૦ માછલાની જેમ.

પણ એહુમાં એક આંતરો રે, છે અતિ મોટો એહુ;  
 જૈન ધર્મે અનુરાગીઓ રે, કુંવર તન મન તેહુ. ચ. છો. ૫  
 કિશુહિં ચળાંયો નવી ચળે રે, નો આવે 'સુરરાય;  
 સજજન મહામિથ્યાત્વી છે રે, ધર્મે દ્રેષ લરાય ચ. છો. ૬  
 ભૂધવર્ સુત નિત્ય આપતો રે, મિત્રને ઓધ અપાર;  
 પણ તેહુને નવી રૂચતો રે, ઉંટને જેમ સહકાર. ૭ ચ. છો. ૭  
 પણ મિથ્યાત્વના જોરથી રે, ધર્મ ઓધ ન સુહાય;  
 જિમ પયપાન્ ૮ અમૃત છતાં રે, અહિપ સુપે ઝેરજ થાય ચ. ૮  
 તિમહિંજ સજજનને થચો રે, કુંવર ઓધ વિપરીત;  
 સુખથી મીડો દીશતો રે, મનમાં નહિ તસ પ્રીત. ચ. છો. ૯  
 કુંવર હુમેશાં આપતો રે, દીન જનોને દાન;  
 સજજન દેખી નવી શકે રે, તે કહે મિત્રને કાન. ચ. છો. ૧૦  
 એહુવાને શું આપવું રે ?, કથો છે એમાં લાલ ?;  
 ખાવું પીવું પહેરવું રે, એહુજ છે સર્વ લાલ. ચ. છો. ૧૧  
 નૃપ સુત કહે સુણુ બંધવા રે !, જગમાં મહાદું પુષ્ય;  
 આપે આગળ પામોયે રે, લવોલવ સૌખ્ય. ૧૨ ચ. છો. ૧૨  
 સજજન કહે સુણો રાયજી રે !, જગમાં નહિ પુષ્ય પાપ;  
 સ્વર્ગ નરક પણ છે નહિ રે, તો કથાં દાન નેણપ. ચ. છો. ૧૩  
 મૂર્ખ દોકેની માનતા રે, છે હુનીયાની માંય;  
 તોહથી કહું છું તુમ પ્રત્યે રે, સાચી છે મુજ વાય. ચ. છો. ૧૪  
 એમ સુણી નૃપ નંદજી રે, મનશું ચિતે એમ;  
 ભારે કર્મી એ જીવડો રે, એને સમજાવું કેમ ?. ચ. છો. ૧૫  
 એમ આવોચી કુંવર કહે રે, છે પુષ્ય અને વળી પાપ;  
 લોગથી તો દોગજ હુવે રે, કરીએ દાન અમાપ. ચ. છો. ૧૬

૧ ધન્દ. ૨ રાજન. ૩ આંશો ૪ દૂધ પીવું ૫ સર્વ. ૬ સુખ. ૭ અપાર.

यतः—भोगे रोग भयं कुले च्युतिभयं वित्ते नृपालादभयं,  
 मौने दैन्य भयं बले रिपुभयं रूपे जराया भयम् ।  
 शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्तादभयं,  
 सर्वे वस्तु भयान्वितं भुविनृणा वैराग्यमेवाभयम् ॥१॥

### પૂર्व ઢાળ

એમ વાતો કરતા ખને રે, નિજ નિજ સહને<sup>१</sup> જાય;  
 પણ સજજન મન ચિંતવે રે, કરવો કાંઈ ઉપાય. ચ. છો. ૧૭  
 એમ આદોચી ચાલીયો રે, આંયો ભૂપ હજૂર;  
 નીસાસા અતિ નાંખતો રે, મહીપતિની<sup>૨</sup> નહિ હર. ચ. છો. ૧૮  
 એહ દેખીને રાયજુ રે, પૂછે સજજનને એમ;  
 શયા વિચારમાં તું અછે રે, નીસાસા મૂકે છે કેમ ? . ચ. છો. ૧૯  
 સજજન કહે સુણુ સાહેભા રે !, શી કરવી ઈંડાં વાત ? .  
 ભરમ કોઈનાં ઘોલવાં રે, એવી નથી મારી જત. ચ. છો. ૨૦  
 તોપણુ તુમચી આગળે રે, સાચું કહું છું એહ;  
 કુંવર ઉડાઉ નીકળ્યો રે, કરશે રાજ્યનો છેહ. ચ. છો. ૨૧  
 ચાચકેને અતિ આપતો રે, વગર વિચાર્યુ ઢાન;  
 ધૂતારા ધૂતી કરી રે, કુદું આપે છે માન. ચ. છો. ૨૨  
 રાય કહે સજજન પ્રત્યે રે, લક્ષી કહી તે વાત;  
 શીખ દેશું હવે કુમરને રે, સજજન થયો રળીયાત. ચ. છો. ૨૩  
 ઢાળ થીજુ રામે કહી રે, નિયતિહરિ સુપસાય;  
 રાય શીખામણ આપશે રે, તેહ સુણોને ઉમાય. ચ. છો. ૨૪

### દોહરા

ભૂધવ<sup>૩</sup> મનમાં ચિંતવે, જતને<sup>૪</sup> કહેવી નીતિ;  
 એમ વિચાર કરે યદા, આંયો કુંવર ધરી પ્રીતि. ૧

૧ ધરે. ૨-૩ રાજ. ૪ પુત્રને.

પય પ્રણુભી ઉલો રહ્યો, મનમાં ધરીને જ્યાર;  
રાય ઓળે એસાડીને, પૂછે વાત કુમાર. ૨

અહો વચ્છ!<sup>૧</sup> તુમે કેમ છો ?, સુત કહે આપ પસાય;  
આનંદથી હું નિર્ગમું,<sup>૨</sup> સુખનાં હિન મહારાય!. ૩

રાય કહે મેં સાંલજ્યું, તુમે કરો અહુ દાન;  
સાચી કે ઓઠી અછે ?, સાંલળી છે મેં કાન. ૪

કરનોડી કુંવર કહે, સાચી તુમચી વાત;  
એહ સુષ્ણુને રાજ્યની, જાતને<sup>૩</sup> કહે અપીયાત.<sup>૪</sup> ૫

હવે કહું છું તુજ લણ્ણી, સાંલળ મારી વાત;  
સ્વદ્ધપ<sup>૫</sup> દાન હવે આપને, અહો મોરા સુલત!. ૬

કુંવર કહે હવે વિનયથી, માનીશ વચ્ચન રસાળ;  
સુષ્ણી ભૂપ રાજ થઈ, આપે મૌકિતાક<sup>૬</sup> માળ. ૭

### ઢાળ ઉ ૭

[ આ છે લાલની-દેશી ]

માળા લઈ તે વાર, આવે કુંવર જહાર;  
આછે લાલ, માંગણુ દોકો તિહાં કને જુ. ૧

માગે દાન જિવાર, કુંવર વિચારે તે વાર;  
આછે લાલ, તાતે મનાઈ મુજને કરી જુ. ૨

એમ આદોચી કુમાર, નવ દીયે દાન લગાર;  
આછે લાલ, તે દેખી થાયક કહે જુ. ૩

કેમ નવી આપો દાન ?, થયા દોલી અસમાન;  
આછે લાલ, એમ કેમ તુમને પરવડે જુ ?. ૪

૧-૩ પુત્રને. ૨ પસાર કરે છું. ૪ ખુલ્લી રીતે. ૫ થાકું.  
૬ મોતીની માળા.

|                                            |    |
|--------------------------------------------|----|
| હતા ચિતામણું તુલ્ય, કેમ થયા કાચને મૂલ્ય ?; |    |
| આછે લાલ, ૧ગજ ટળી રાખજ દ્વારે કેમ થયા જુ ?. | ૫  |
| ચિંતે રાજ-કુમાર, લઘુતા થાય આ વાર;          |    |
| આછે લાલ, તેથી દાન દેવું સહી જુ.            | ૬  |
| એમ આલોચી ચિત્ત, માળા ત્રોડી ખરીત;          |    |
| આછે લાલ, દાન હીયે યાચક લણું જુ.            | ૭  |
| સંજગન દેખે તામ, મનમાં બોલે આમ;             |    |
| આછે લાલ, રાયને હવે કહેવું જઈ જુ.           | ૮  |
| ભૂધવ ચીવાસ સુઅાર, સંજગન આન્યો તે વાર;      |    |
| આછે લાલ, એ કર જોડી ઉલો રહ્યો જુ.           | ૯  |
| ભૂધવ પૂછે તે વાર, ઇજત તણો અધિકાર;          |    |
| આછે લાલ, સર્વ વાત સુજને કહે જુ.            | ૧૦ |
| નીસાસો નાંખી તે વાર, કહે સંજગન આવાર;       |    |
| આછે લાલ, એહ મ પૂછો સુજ કને જુ.             | ૧૧ |
| મિત્ર થાચે છે સુજ, તેથી ન કહું તસ ગુજ;     |    |
| આછે લાલ, માર્ક કરો ઈહાં સુજને જુ.          | ૧૨ |
| એમ સુણુને રાય, કહે સંજગનને ઉમાય;           |    |
| આછે લાલ, સ્વામી કને ન ધૂપાવીએ જુ.          | ૧૩ |
| સંજગન કહે જોડી હાથ, નિસુણો તમે નરનાથ !;    |    |
| આછે લાલ, વ્યાઘ નહીનો ન્યાય ઈહાં જુ.        | ૧૪ |
| જો કહું મિત્રની વાત, તો થાય વિશ્વાસધાત;    |    |
| આછે લાલ, ન કહું તો સ્વામી દ્રોહી થઈ જુ.    | ૧૫ |
| નીતિ વિરુદ્ધ છે એહ, સ્વામીને કહું નહિ તેહ; |    |
| આછે લાલ, તો સુજ સમ પાપી નહિ જુ.            | ૧૬ |

૧ હાથી. ૨ ખકરો. ૩ મહેલ. ૪ પુત્ર.

|                                                                              |    |
|------------------------------------------------------------------------------|----|
| તेथી કહું છું સત્ય, સાંભળો તેહ અગત્ય;<br>આછે લાલ, કુમર ન માને તુમ એગિરાજ.    | ૧૭ |
| માળા આપી તમે જેહ, હીધી ચાચકને તેહ;<br>આછે લાલ, તેમજ રાજ્ય ખોઈ બેસશે જુ.      | ૧૮ |
| એહ સુણ્ણીને રે રાય, કોધે અતીવ ભરાય;<br>આછે લાલ, પુત્ર કહું માને નહિ જુ.      | ૧૯ |
| શિક્ષા આપવી તાસ, મનમાં રાખોદોચે ખાસ;<br>આછે લાલ, એમ નિશ્ચય રાચે કીયો જુ.     | ૨૦ |
| ૩પ્રાતે રાજકુમાર, આવે કચેરી મુઅાર;<br>આછે લાલ, પગે લાગી ઉલો રઘો જુ.          | ૨૧ |
| હેઠી કુમાર તે વાર, ભૂધવ ધરીને ખ્યાર;<br>આછે લાલ, આદર આપે રાયજુ જુ.           | ૨૨ |
| ઓળે બેસાડી જાત, પૂછે તેહને વાત;<br>આછે લાલ, કહો પુત્રજુ તમે ! કેમ છો જુ ?.   | ૨૩ |
| જાત કહે તે વાર, એકર ચુગલ્ય શિર ધાર;<br>આછે લાલ, તુમ પસારે આનંદ છે જુ.        | ૨૪ |
| વાત કરી ધણ્ણી આમ, કુમરને કહે તામ;<br>આછે લાલ, પુત્ર પુંદે કર ફેરવી જુ.       | ૨૫ |
| માળા આપી હતી કાલ, હમણા મુજને જાલ;<br>આછે લાલ, ઝીજુ કરાવવી છે ધહાં જુ.        | ૨૬ |
| નંદન કહે જેડી હાથ, સાંભળો તુમે નર નાથ !;<br>આછે લાલ, માળા છે નહિ મુજ કને જુ. | ૨૭ |

૧ વચન. ૨ નિયારે. ૩ સવારમાં, પ્રાતાતે. ૪-૮ પુત્ર. ૯ હાથ.

૬ એ. ૭ આપ.

|                                        |    |
|----------------------------------------|----|
| નિસુષ્ણી નૃપ તે વાત, કહે કુવરને તાત;   |    |
| આછે લાલ, કિહાં ગઈ સુજને કહે જ.         | ૨૮ |
| ૧૫૪ પ્રણમીને એમ, પુત્ર કહે ધરી પ્રેમ;  |    |
| આછે લાલ, યાચકને આપી સહી જ.             | ૨૬ |
| એહે સુષ્ણી કોધ લરાય, વચન કહે મહારાય;   |    |
| આછે લાલ, નીકળ મહારા રાજ્યથી જ.         | ૩૦ |
| હજી નાનો છે બાળ, ન કરે તું કાંઈ ખ્યાલ; |    |
| આ છે લાલ, એ સુજને નહિ પરવડે જ.         | ૩૧ |
| નાકારા મેં કીધ, છતાં પણુ તેં હીધ;      |    |
| આ છે લાલ, સુજ વચનોને અવગણી જ.          | ૩૨ |
| જેથી તૂરે કાન, તે હેમતુરે નહિ માન;     |    |
| આ છે લાલ, તેવો તું પણ નીકળ્યો જ.       | ૩૩ |
| નિયતિહરિનો બાળ, રામ કહે ઉજમાળ;         |    |
| આછે લાલ, ઢાળ એ ત્રીજી પૂરી થઈ જ.       | ૩૪ |

### દોહરા

|                                                         |   |
|---------------------------------------------------------|---|
| નૃપનાં વયણ્ણો સાંભળી, મનમાં ચિંતે કુમાર;                |   |
| હવે ઈહાં રહેલું નહિ, જાઉ વિદેશ સુઝાર.                   | ૧ |
| એમ મનમાં આદોચીને, નમન કરીને રાય;                        |   |
| વિદ્યા વદને <sup>૩</sup> આવીને, પ્રણમે જનની પાય.        | ૨ |
| માતા હેઠી પુત્ર તવ, પુછે અતિ ધરો ખ્યાર;                 |   |
| વચ્છ! <sup>૪</sup> ! કેમ ઉદ્ઘાસ તું ?, કહે સુજને આ વાર. | ૩ |
| કરનોડી કુંવર કહે, નિસુષ્ણો મોરી માય !;                  |   |
| દેશવટો સુજને દીયો, કોધ કરીને રાય.                       | ૪ |

૧ પગે લાગીને. ૨ સોનું. ૩ દીક્ષા મોદાથી-ઉત્તરી ગંગેલ.  
મોદાથી. ૪ દીકરા.

એહ સાંલળતાં નેનથો,<sup>૧</sup> ચાલી અશુની ધાર;  
નહિ જવા દઉં તુજને, અહો જગત આધાર!. ૫  
જત કહે સુણો માતજી!, તાતનુ વચન પ્રમાણ;  
માટે આજા ધો તુમે, ન કરે એમાં તાણુ. ૬  
એમ કહી માતા નમી, જવા લાગ્યો જ્યાર;  
માતા કર સાહી<sup>૨</sup> કરી, પુષ્કળ આપે દીનાર.<sup>૩</sup> ૭  
સુખમાં રહેને વચ્છ!<sup>૪</sup> તું, લહેને લીલા લહેર;  
વહેલો આવી સુજને, મળને કરીને મહેર. ૮  
જનની આરીશ લેઇને, થઈ અશ્વે<sup>૫</sup> અસ્વાર;  
લલિતાંગ ત્યાંથી નીકળી, આવે મિત્રાગાર.<sup>૬</sup> ૯

### ઢાળ ૪ થી

[ દેશી સખીરોની. ]

સખીરી સજજન દેખો કુમારને, હાંડે હાં કુ.

ઉઠે તે તત કાળ;

અવિક જન! સાંલળો.

સખીરી કર<sup>૭</sup> સંપુટ જોડી કરી, હાં. જો.

નમન કરે ઉજમાળ.

સ. ૧

સ. વિનય કરી પૂછે તદા, હાં.. પુ

આમ કેમ તુમે લાય!;

લ.

સ. કુંવર કહે તર મિત્રને, હાં. મિ.

દેશવટો દીયો રાય.

લ. ૨

સ. એહ સુણી સજજન કહે, હાં. સ.

કેમ થયું એ કાજ?;

લ.

૧ આંખથી. ૨ હાથ જલીને. ૩ સેનામહેરો. ૪ દીકરા.

૫ ધોડા ઉપર ઘેસીને. ૬ મિત્રને વેર. ૭ હાથ. ૮ એ.

|                                   |       |
|-----------------------------------|-------|
| સ. તમે જો જાઓ વિહેશમાં, હાં. વિ.  | લ. ૩  |
| સાથે આવીશ પિચરતાજ !               |       |
| સ. તુમવિષુ મુજથી એકલી, હાં. એ.    | લ. ૧  |
| કેમ રહેવાએ આંય ?;                 |       |
| સ. તે માટે તુમને કહું, હાં. તુ.   | લ. ૨  |
| તુમ વિરહે જીવ જાય.                | લ. ૪  |
| સ. વળતું કુમર કહે તદા, હાં. ક.    | લ. ૩  |
| સુખમાં રહે ઈહાં મિત્ત !;          |       |
| સ. માત ને તાતની સેવના, હાં. સે.   | લ. ૫  |
| કરતો રહેજે ઘચીત. ૨                |       |
| સ. સજજન આંસુ ઢાળીને, હાં. ઠ.      | લ. ૬  |
| મુજ સામે તમે જોય;                 |       |
| સ. કુદુંબ સવી મારે તુમે, હાં. મા. | લ. ૭  |
| તુમ વિષુ અવર ન કોય.               |       |
| સ. એમ કહી સાથે ચલ્યો, હાં. સા.    | લ. ૮  |
| મૂકી નિજ ધરખાર;                   |       |
| સ. એહુ મિત્ર આગળ ચલ્યા, હાં. આ.   | લ. ૯  |
| વાતો કરી ધરી જ્યાર.               |       |
| સ. સજજન કહે કુમારને, હાં. કુ.     | લ. ૧૦ |
| અપૂરવ કરો ડોઈ વાત;                |       |
| સ. રાજકુમર કહે મિત્રને, હાં. મિ.  | લ. ૧૧ |
| ધર્મ તણો અવદાતૃ.                  |       |
| સ. એહ સુણી સજજન કહે, હાં. સ.      | લ. ૧૨ |
| એ તુમ જૂઠી વાત;                   |       |

१ माथाना मुगट समान. २ सारी रीते. ३ धर्मनी वात.

|                                                              |       |
|--------------------------------------------------------------|-------|
| સ. ધર્મથી જીવો હુઃખ લહે, હાં. હુઃ.                           |       |
| પાપે છે સુખ સાત.                                             | લ. ૬  |
| સ. એમ સુણ્ણી નૃપ <sup>૧</sup> સુત <sup>૨</sup> કહે, હાં. નૃ. |       |
| એ તુમ વાત અસત્ય;                                             | લ.    |
| સ. પાપે હુઃખ લહે પ્રાણીયા, હાં. પ્રા.                        |       |
| ધર્મ એકજ છે સત્ય.                                            | લ. ૧૦ |
| સ. એમ વિવાદ કરતાં થકાં, હાં. ક.                              |       |
| માંહેા માંહે પ્રચૂર <sup>૩</sup>                             | લ.    |
| સ. એક કહે ધર્મજ વડો, હાં. ધ.                                 |       |
| સુખ મળો ભરપૂર.                                               | લ. ૧૧ |
| સ. લલિતાંગ મનમાં ચિંતવે, હાં.. ચિ.                           |       |
| એ છે પાપી જીવ;                                               | લ.    |
| સ. એને કેમ સમજવવો ?, હાં. સ.                                 |       |
| કરે ચિંતવણા અતીવ.                                            | લ. ૧૨ |
| સ. કુંવર કહે સુણુ બાંધવા !, હાં. બાં.                        |       |
| એમ ન કરવો વિવાદ;                                             | લ.    |
| સ. એમ જો કરશું આપણો, હાં. આ.                                 |       |
| નવ રહેશો મર્યાદ.                                             | લ. ૧૩ |
| સ. નીતિ પણ કહે છે ઈહાં, હાં. ક.                              |       |
| જો પ્રીતિ રાખવી હોય;                                         | લ.    |
| સ. તો વિવાદ ન કીજુએ, હાં કી.                                 |       |
| જેથી આનંદ મન મોય.                                            | લ. ૧૪ |
| સ. જો તુજ મનમાં એહંબું, હાં. એ.                              |       |
| કરાવીએ તો ન્યાય;                                             | લ.    |

૧ રાજ. ૨ પુત્ર. ૩ મોટો, સારી રીતે.

ੴ ਪ੍ਰਾਤਿਸ਼ਥ

કહે સજજન સુણો મિત્રજી, થાએ ને તુમ હાર; ૧  
 તો ઘાડો એ તુમ તણો, લહું વળી એ રહીનાર.  
 ને હું હારે વાદમાં, તો તુમ વચન પ્રમાણું;  
 મુજ જુંદ્ગી સેવા કરે, માર્યું તુમચી આણુ. ૨  
 રાય નંદન એમ સાંલળી, માની તેહની વાત;  
 એમજ કરલું આપણો, ચાલો આગળ ભાત !. ૩  
 એમ કહી આગે ચલ્યા, હીનું તવ એક ગામ;  
 સજજન કહે રે મિત્રજી !, પૂછીએ એહીજ ધામ. ૪

१ शरत-होड. २ सोना महोर.

કુંવર કહે ચાલો ભલે, થામના ચૌટા માંય;  
લોકોને પૂછી કરી, નિર્ણય કરશું ત્યાંય.

૫

### ઢાળ અ મી

[ દેશ મનોહર માગવો—એ દેશા. ]

એમ કહી આગળ ચલ્યા, આવે ગામ સુઅર; લલના.  
ચૌટામાં આવી કરી, સજજન કહે ધરી ખ્યાર. લલના.

દ્રોહ ન કીલુએ માનવી !. ૧

- રે માનવ ! તમે સાંલળો, તમે છો ચતુર સુભાષુ; લલના.  
ન્યાય અમારો કીલ્યે, તો આનંદ અમ પ્રાણુ. લ. દ્રો. ૨  
સજજનની વાણી સુણ્ણી, લોકો કહે તેણી વાર; લ.  
સાચો ન્યાય કરશું અમે, વાત કરો તુમ સાર. લ. દ્રો. ૩  
ઉદ્વત્તસિત થઈ સજજન કહે, સાંલળો વાતતુ મર્મ; લલના.  
સુજ મિત્ર કહે છે એહું, સુખ થાયે કર્યો ધર્મ. લ. દ્રો. ૪  
હું કહું છું કે પાપથી, જીવ સદા સુખી થાય; લ.  
એમ અમારા એહુમાં, વાદ થયો છે આંય. લ. દ્રો. ૫  
હુવે એ તમે સાચું કહો, તુમચી વાત પ્રમાણુ; લ.  
એવાં વયણો સાંલળી, લોકો કહે એમ વાણુ. લ. દ્રો. ૬  
ધર્મ કર્યાથી પ્રાણીયા, હુઃખ લહે 'ઠામોઠામ'; લ.  
બુએ અમ ગામના લગતડા, એ છે હુઃખીયા તમામ લ. દ્રો. ૭  
અમે તો પાપમાં રાચીએ, કરીયે છીએ અત્યાચાર; લ.  
ચોરી દારી કરીએ સદા, છઠુએ સુખીયા અપાર. લ. દ્રો. ૮  
ધર્મ કર્યાથી નવી મળે, પૈસો અને વળી સુખ; લ.  
પૈસા વિણુ નર પશુ સમા, વેઠે તિંહાં ખહુ હુઃખ. લ. દ્રો. ૯

૧ ટેકાણુ ટેકાણુ,

તેથી છે લાઈ! તુમ તથ્યો, સાચી વાત તમામ; લ.  
 એહવાં વયણો સાંલળી, સજજન હરખણો તામ લ. દ્રો. ૧૦  
 તિહાંથી બાહિર ચાલીયા, કહે સજજન તે વાર; લ.  
 તુમે હાર્યા હું જીત્યો, આપો અશ્વ રેવસુ સાર. લ. દ્રો. ૧૧  
 નહિ તો તુમ કહે ધર્મથી, હુઃખ પામે નરનાર; લ.  
 તો તુમ અશ્વ નવો લહું, ન લહું તેમ દીનાર.<sup>૩</sup> લ. દ્રો. ૧૨  
 રાજ સુત કહે મિત્રને, એ ગામડીયા ગમાર; લ.  
 આગે ન્યાય કરાવીએ, કહે એમ રાજકુમાર. લ. દ્રો. ૧૩  
 સજજન કહે સુણો મિત્રજી!, ન્યાય હવે શું થાય?, લ.  
 ઘોટક ધન દીયો સુજને, દીલ ન કરો હવે કાંય. લ. દ્રો. ૧૪  
 એહવાં વયણો સાંલળી, આપે સર્વ દીનાર; લ.  
 સજજન બેઠો ઘોડે ચડી, કુમર થયો <sup>૪</sup>પદચાર. લ. દ્રો. ૧૫  
 આગળ જાતાં બેહુ જણ્યા, વળી સજજન કહે એમ; લ.  
 નવલી વાત કોઈ કરો, પંથ એ ખૂટે જેમ. લ. દ્રો. ૧૬  
 કુમર કહે વાત એક છે, ધર્મે જય જય કાર; લ.  
 એવાં વયણો સાંલળી, સજજન હસી કહે સાર. લ. દ્રો. ૧૭  
 દોાહ વણિક સમ છે તમે, છો દુરાથડી અપાર; લ.  
 ધર્મે આપદ પામીયા, હજુએ ન મૂકો લગાર. લ. દ્રો. ૧૮  
 હજુ પણ માનો સુજ કહું, તો વ્યો તુમ <sup>૫</sup>તુખાર; લ.  
 પણ જો હજ મનમાં હુંવે, ન્યાય કરાવીએ સાર. લ. દ્રો. ૧૯  
 એહ સુણી કુંવર કહે, મારી કયાં છે મનાડ ?; લ.  
 સજજન કહે હું નવ કરું, હોડ વિનાતુ કાંઈ. લ. દ્રો. ૨૦  
 કુંવર કહે લલે કીજુએ, જે ધૂચા હોય તુજ; લ.  
 સજજન કહે સુણો રાજવી!, મહારી વાત છે એજ. લ. દ્રો. ૨૧

૧-૪-૫ ઘોડા. ૨-૩ સેના મહોર-પૈસો. ૫ પગપાળો.

જે હારે તે આપે સહી, નિજ લોચન તે હોય; લ.  
 પણ કરીને તે ચાલીયા, સજજન આનંદી હોય. લ. દ્રો. ૨૨  
 નિયતિહરિ સૂરિરાજનો, રામેંક કહે એમ; લ.  
 પાંચમી ઢાળ પૂરી થઈ, આગે સુણો ધરી પ્રેમ. લ. દ્રો. ૨૩

### દોહરા

કોલ કરાર કરી તદી, ચાલ્યા આગામ જમ;  
 ફૂરથી દીકું ગામડું, બોલ્યો સજજન તામ. ૧  
 મિત્ર ! સુણો મુજ વાતડી, ન્યાય કરાવીયે આંહિ;  
 કુમર કહે તુમ હોય જે, ધર્છા ચાલો ત્યાંહિ. ૨  
 એમ કહીને ચાલીયા, આંધ્યા ગામ સુજાર;  
 પૂર્વ પરે પૂછે તિહાં, સજજન થઈ તૈયાર. ૩  
 તેહ સુણું એમ બોલીયા, થઇને તવ હુશીયાર;  
 તત્ત્વા તત્ત્વ સમજે નહિ, ગામડીયા ગેમાર. ૪  
 તું કહે છે તે સત્ય છે, સહુ સુખ પાપથી થાય;  
 ધર્મ કર્યાથી પ્રાણીને, સર્વ હુઃખો મળે ભાય !. ૫  
 વયણો સાંલળી ચાલીયા, આંધ્યા ગામની બહાર;  
 રલસપણો,<sup>૧</sup> સજજન કહે, સાંલળો રાજ-કુમાર !, ૬  
 ન્યાય થયો મુજ પક્ષમાં, તુમે હાર્યી મહારાય !;  
 નયનો આપો હવે તમે, તુમ નાકાર ન થાય. ૭  
 ભૂધવ સુત કહે મિત્રને, સાંલળ મોરી વાય;  
 ગામડીયા સમજે નહિ, ન્યાય અને અન્યાય. ૮  
 તેથી આપણે ચાલીએ, કોઠિક કોવિદ<sup>૨</sup> પાસ;  
 તેહ કહે નહિ માહરે, કોવિદની કાંઈ ખાસ. ૯

૧ ઉતાવળે. ૨ વિદ્ધાન્-ડાલ્યો.

- જે નયનો આપો નહિ, તો ભાંખો તુમે એમ;  
ધર્મ કરો હુઃખ ઉપજે, પાપે હાવે એમ. ૧૦
- ન્યથોધાં તર્દ તળે બેસીને, કુમરે સંલારો ધર્મ;  
સાગારી<sup>૨</sup> અણુસણુ કરી, ઉરમાં આણું શર્મ.<sup>૩</sup> ૧૧
- ધીરજ મનમાં ધારીને, છુરિકા લેઈ કુમાર;  
આપે નયનો કાઢીને, સજજન હુર્ઝ અપાર. ૧૨

### ઢાળ ૬ ટી

[ ધોણીડા ! તુ ધોણે મનનું ધોતીયું રે-એ દેશી. ]

- આંખો લેઈ ધોડે ચડી રે, સજજન ચાલ્યો જામ રે;  
લોગવ હવે કુળ ધર્મનાં રે, હે આંધળા ! ગત ૪માસ રે.  
કર્મ ન કીલુયે પ્રાણીયા રે !. ૧
- જે તે ધર્મ પ્રશંસીયો રે, તો નયન તુરી<sup>૪</sup> નિષ્કર્ષ ખોય રે,  
એમ મુખે લવતો<sup>૫</sup> ધાણું રે, સજજન ચાલ્યો તવ સોય રે. ક. ૨  
લલિતાંગ મન એમ ચિંતવે રે, મેં કીધાં કર્મ અધોર રે;  
તેહનાં કુળ મુજને ઈહાં રે, મણ્યાં છે અથ લોર<sup>૬</sup> રે. ક. ૩  
રે આતમ ! ઈહાં કોઈનો રે, જોઈશ ન વાંક લગાર રે;  
તારાં કીધાં તું લોગવે રે, હવે મત થાજે ગમાર રે. ક. ૪  
એહવી લાવના ભાવતાં રે, વખત ગમાવે તેહ રે;  
ધર્મી જીવ ! એ સાંલળી રે, આતમ નિંદે ધરી નેહ રે. ક. ૫  
એહવે રવિ<sup>૭</sup> પણુ આથભ્યો રે, વ્યાખ્યો ધોર અંધાર રે;  
જેમ જેમ વીતતી રાતડી રે, તેમ તેમ પીડ અપાર રે. ક. ૬

૧ વડનું ઝાડ. ૨ આગાર સહિત-અમુક મુદ્દત સુધીનો. ૩ સુખ-શાંતિ. ૪ લાજ વગરના. ૫ ધોડો. ૬ સોનામડોર. ૭ બોલતો. ૮ ધાણું. ૯ સુરજ.

સમલાવે સહેતો ઈહાં રે, વેદના તે અસરાળ રે;  
 શરણું ધર્મનું ધારતો રે, અવર ન આણુ મન આળ રે. ક્ર. ૭  
 એમ ભાવતાં રાત્રિ ગઈ રે, 'જમ તિહાં તવ હોય રે;  
 એહુવે તિહાં શું નીપનું રે ?, તે સુણુને સહુ કોય રે. કર્મ. ૮  
 વન દેવી પ્રગટી તદા રે, કહે કુમારને એમ રે;  
 સુજ આણું વિષુ પાપીયા રે !, તું બેઠો છે કહે કેમ રે ?. ક. ૯  
 એહુવાં વયણો સાંલળી રે, કહે કુંવર ધરી ખ્યાર રે;  
 તુમે પોતે પણું કોણું છો રે ?, તે ભાંખો નિરધાર રે. ક. ૧૦  
 તવ સા કહે સુણુ માનવી રે !, હું વટ્ટ યક્ષિણી<sup>૩</sup> વિષ્યાત રે;  
 મેં સુજ કહી ઈહાં વાતડી રે, હવે કહે તુજ અવદાત<sup>૪</sup> રે. ક. ૧૧  
 અથથી માંડીને કહી રે, વીતી પોતાની વાત રે;  
 તે સાંલળી દેવી કહે રે, સુણુ સુજ વાત એકાંત રે. કર્મ. ૧૨  
 જો સુજ વયણું અંગીકરે રે, તો આપું નયનો સુનાન રે;  
 પ્રથમ પ્રણામ કરે સુજને રે,

પછી હીએ સુજ ખળિદાન રે. કર્મ. ૧૩  
 એટલું કરી સુખથી કહે રે, ધર્મથી દુઃખ લહે જરૂરે;  
 પાપથી સુખ હોવે સદા રે,

માન સુજ વચન અતીવ રે. કર્મ. ૧૪  
 ઈમ જો નવ કરશો કહિ રે, તો મારીશ તુજ આ વાર રે;  
 તવ કુંવર મન ચિંતવે રે, એ ધર્મ પર રાખે છે ખાર રે. ક. ૧૫  
 લલિતાંગ વળતું એમ કહે રે, સાંલળ 'સુરી ! સુજ વાય રે,  
 તું દેવી મિથ્યામતિ રે, નવી લાણું તુજ પાય રે. કર્મ. ૧૬  
 તો પૂજાની શી વાતડી રે ?, લોણ ન આપું લગાર રે;  
 તુજને કાંઈ સમજણું નહિ રે, તું છે મૂઢ ગેમાર રે. કર્મ. ૧૭

૧ પહોર. ૨ વડનું જાડ. ૩-૬ દેવી. ૪ હકીકત. ૫ સુંદર.

ને મારવો હોય તાહુરે રે, તો એઠો છું તુજ પાસુ રે;  
 એમ કહુને તિહાં કને રે, મૌન ધરીને ખાસ રે. કર્મ. ૧૮  
 કર્મસિંહ સ્વામી પસાયથી રે, રામ કહે ઉજમાળ રે;  
 દાળ છટ્ઠી પૂરી થઈ રે, આગળ વાત રસાળ રે. કર્મ. ૧૯

### દોહરા

એહલાં વયણો સાંભળી, હેચો કોપી તે વાર;  
 મુજ કહું માને નહિ, આપીશ કળ નિરધાર. ૧  
 એમ કહી હેવી તિહાં, હસ્તી રૂપ ૧ખનાય;  
 શૂંઠે સાહી ઉછાળીએ, જોરથી ૨અંખરમાંય. ૨  
 ઉપરથી પડતાં થકાં, ૩દંતૂસળે તે વાર;  
 ઓલી લીધો અધરથી, પડયો નીચે ને વાર. ૩  
 પીડા અતુલી ઉપની, ૪વપુએ તેણું વાર;  
 ધારી રૂપ વળી સિંહનું, આપે હુઃખ અપાર. ૪  
 વિધ વિધ હુઃખ એમ આપીયાં,

તોએ ન ચહ્યો લગાર;

દેખી હેવી ચિંતવે, મન આણુને વિચાર. ૫  
 ૫સુરી જ્ઞાનમાં જોઈને, સમજુ ગઈ મન માંય;  
 દદ ધર્મી એ પ્રાણું છે, નવી ચળાવ્યો જાય. ૬  
 એવા ધર્મી જીવને, કરવી મહારે સહાય;  
 તો મુજને પૂરણુ ઈહાં, મળો ૬સૌખ્ય સમુદ્ધાય. ૭  
 કરજોડી ૭અમરી કહે, તૂઠી તુજ પર ધીર!;  
 માંગ માંગ કહું તુજને, કૃપા કરી અહો વીર!. ૮

૧ હાથીનું રૂપ. ૨ આકાશમાં. ૩ દાંત વચે. ૪ શરીરે. ૫-૭

દેની. ૬ સુખ.

## દળ ઉ મી

[ નાનો નાહલો રે-એ દેશી ]

એહવાં વયણુ તે સાંભળી રે, હેવોને કહે વાત કે;  
 સુરી ! તમે સાંભળો રે.

ધર્મ વિના ઈચ્છાં નહિ રે, શું માંગું ઈહાં માત ! ? કે સુ. ૧  
 જે માંગ્યું આપો મુને રે, ધર્મ આપો ધરી ખ્યાર કે; સુ.  
 એમ કહી કુંવર તદા રે, મૌન ધરી રહ્યો સાર કે. સ. ૨  
 તે દેખી દેવી તદા રે, મન વિચારે આમ કે; સંજગ્ન.  
 એ નિર્બેલી માનવી રે, કાંઈ નહિ. મન હામ<sup>૧</sup> કે. સ. ૩  
 તેહવે દેવીયે તિહાં રે, આખ્યાં દોયનર દોય કે; સ.  
 દિવ્ય કચેરા જેહવી રે, નિર્મળ આંખો હોય કે. સ. ૪  
 વળી પણ દેવી વીનવે રે, કંઈક આપો આદેશ કે; સ.  
 એમ સુણ્ણી કુંવર તદા રે, આખ્યી હર્ષ વિશેષ કે. સુરી. ૫  
 કહે દેવી પ્રત્યે એહવું રે, જે તુમ ઈચ્છા હોય કે; સુ.  
 તો માંગું હું તુમ કને રે, આપો મુજને સોય કે. સુ. ૬  
 મિથ્યાત્વ મૂકી વેગળું રે, અંગીકરે. તુમે ધર્મ કે; સુ.  
 સમકિત સહિત એ ધર્મ જે રે, સમજુને તેનું મર્મ કે. સુ. ૭  
 લોગ લેવો નહિ કોઈનો રે, જાણુને અધર્મ કે; સુ.  
 લોગ લેવાથી લાગશે રે, ભૂંડાં જે જગ કર્મ કે. સુ. ૮  
 તેથી આતમ આપણો રે, જાએ નરક મુગાર કે; સુ.  
 હુઃખો તિહાં કને લોગવે રે, મુખથી પાડે પુકાર કે. સુ. ૯  
 એહ સુણ્ણી દેવી તદા રે, વિચારતાં મન માંય કે; શ્રોતા.  
 જાતિ સમરણજ ઉપનું રે, તેથી રાજ અતિ થાય કે. શ્રો. ૧૦

૧ ઈચ્છા. ૨ આંખો.

ઉપકારી શુરૂ મુજ થયા રે, વળી તમે ધર્મના લાઈ કે; સ. આગલા લખમાં હું હતી રે, પરમ શ્રાવિકા લ્યાંધ કે. સ. ૧૧ ધર્મથી બ્રહ્મ હું થઈ તદા રે, મિથ્યાત્વમાં પડી લ્યાંય કે; સ. સમકિતને અંડિત કરી રે, હું ઈણાં ઉપની આય કે. સ. ૧૨ તમે મુજને જે આપીયું રે, સમકિત ઇપી રત્ન કે; સ. હવે નિશ્ચય કહાં તે હવે રે, પાળોશ હું કરી યત્ન કે. સ. ૧૩ મિથ્યાત્વને હું ઈણાં હવે રે, વોસરાવી દઉં છું આજ કે; સ. સર્વે પ્રાણ્યુ ભૂતને રે, હું આપીશ હવે સહાજ કે. સ. ૧૪ એમ કહી પગમાં પડી રે, અમાવે વારંવાર કે; સ. મેં હુઃઝો જે તુમ દીયાં રે, તે અમને આ વાર કે. સ. ૧૫ તમે જે ધર્મ મુજને દીયો રે, એથીંગણુ ન થવાય કે; સ. તેથી કહું છું તુમ પ્રતે રે, સાંભળો મહારા લાય। કે. સ. ૧૬ અમરી કહે મુજ લેટણું રે, લોળ્યે ઔષધિ એહુ કે; સ. કુંવર કહે હું શું કરે ? ઔષધિને ઈણાં દેહ કે. સુરી. ૧૭ તમે જે ધર્મ અંગીકર્યો રે, એજ છે લાલ અપાર કે; સુ. અવરે કશું ખપતું નથી રે, રે ! સુરી ! ગુણુ ગણુ ધાર કે. સુ. ૧૮ તવ કરનોડી હેવો કહે રે, સાંભળો મહારા વીર કે; સજણ. એહ માંહિ શુણુ છે ધણું રે;

સાંભળાવું એહો ધીર ! કે. સ. ૧૯

આ જે ધોણી ઔષધિ રે, તેહનો! શુણુ છે એહ કે. સ. ટાળે કોઠ સહુ જાતના રે, કરે એ રનિરામય દેહ કે. સ. ૨૦ બીજી વળી રાતી અછે રે, તેને ઉવારીમાં ધોય કે. સ. અંધ જનેને આંજતાં રે, નયનો નિર્મણ થાય કે. સ. ૨૧

૧ દેવી. ૨ રોગ રહિત. ૩ પાણ્યીમાં.

એમ કહી આચહુ કરી રે, આપે કુંવરને હોય કે;  
 વળી કહેા તે આપું સહી રે, કહેને કારજ જે હોય કે. સ. ૨૨  
 એવાં વયણુ સુણ્ણી કરી રે, તવ મન કરતો વિચાર કે; શ્રોતા.  
 ઔષધિ એહ અમૂલ્ય છે રે, થાશો સહુ ઉપકાર કે. શ્રો. ૨૩  
 એમ ચિંતી અંગી—કરે રે, ઔષધિ હો સુખદાય કે; શ્રો.  
 ઉપકાર કામે આવશો રે, એથી સહુને સુખ થાય કે. શ્રો. ૨૪  
 અહેા શ્રોતા ! તમે સાંલળો રે,

જુઓ જુઓ પુષ્ય પ્રકાર કે. શ્રો.  
 ધર્મી પ્રાણ્ણી જાએ જિહાં રે, તિહાં સુખના લંડાર કે. શ્રો. ૨૫  
 માટે ધર્મ તુમે કરો રે, આળસ નિદ્રા વાર કે. શ્રો.  
 તો તમે બહુ સુખ પામશો રે,

લલિતાંગની પરે સાર કે. શ્રો. ૨૬  
 દેવી કહે સુણુ બંધવા ! રે,

સમરજે સુને કોઈ વાર કે; શ્રો.  
 એમ કહી દેવી તદા રે, અદૃષ્ટ થઈ તે સાર કે. શ્રો. ૨૭  
 હવે શ્રોતા ! તમે સાંલળો રે, આગે ધરીને પ્રેમ કે; શ્રો.  
 સાતમી દાળ પૂરી થઈ રે, રામચંદ્ર કહે એમ કે. શ્રો. ૨૮

### દોહરા

હવે લલિતાંગ કુમર તદા, મનશું કરે વિચાર;

જાંબું કોઈક વસ્તીમાં, કરું કાંઈક ઉપકાર.

૧

વળી દેવી પરગટ થઈ, કિહાં જાંબું છે વીર ! !;

તે સધળું મુજને કહે, ઘેણાંયાડું લાં ધીર !.

૨

કુંવર કહે દેવી પ્રત્યે, મહારે જવું શુલ ઠામ;

ઘરચીશ જોજને આંહિથી, ચાંપાપુરી છે ધામ.

૩

એહવાં વયણો સાંલળી, કુંવરને લઈ શિર નામ;

ચંપાપુરીને પરિસરે, ભૂકૃદ્યો દેવીએ તામ. ૪

વિનયે કરજોડી કરી, પ્રણુમે સુરો નિષ્કામ;

કોઈ કામ હોય સુજસમું, સમરણુ કરજે સ્વામ !. ૫

એમ કહી દેવી ગઈ, પ્રણુમી કુંવર પાય;

હવે લાલિતાંગ તિહાં થકી, આંદો નગરની માંય. ૬

### ઢાળ ઈ મી

[ કે ગુણવંતાળ-એ દેશા. ]

કુંવર તિહાંથી ચાલીયો, મન મોહન લાલ;

આંદો ચૌટા માંય, લાલ મન મોહના.

પટહ તિહાં કને વાજતો, મ. સાંલળી આનંદ પાય; લા. ૧.

નૃપર નંદ પૂછે તેહને, મ. કેમ વાજે પટ એહ ?; લા.

પટહ વાહક<sup>૩</sup> કહે કુમરને, મ. નિસુણો રે ગુણ ગેહ !. લા. ૨

એહ નયરનો રાજુયો, મ. અદિનશત્રુ લૂપાળ; લા.

રતિમાળા રાણી તેહને, મ. રૂપે રંભા દ્વાળ. લા. ૩

તસ કુક્ષીથી ઉપની, મ. પુત્રી રૂપ નિધાન; લા.

પુષ્પવતી અલિધાનથી, મ. હિન હિન વાધે વાન. લા. ૪

ગિરિ<sup>૪</sup> કંદરમાં<sup>૫</sup> જેમ વધે, મ. ચંપક લતા શુલ જેહ; લા.

પ્રાણ સમાન ખ્યારી અછે, મ. સુખમાંહી વધે તેહ. લા. ૫

કોઈક કારણુ ચોગથી, મ. નેત્રની વેહના થાત; લા.

એમ કરતાં આંદો ગઈ, મ. આંધળી સા થઈ જાત. લા. ૬

ઉપચારો અગણ્યિત કર્યા, મ. કિમપિ ન થઈ કરાર; લા.

પટ એહનો એ વાજતો, મ. વાત કહી એ સાર. લા. ૭

૧ કોઈપણ સ્વાર્થ વિના. ૨ રાજનો દીકરો. ૩ પડાના વગા-જાગા. ૪ નામ. ૫ પર્ણતા. ૬ ગુફામાં. ૭ અનેક. ૮ શાંતિ.

એહને જે સાળ કરે, મ. તે પામે અડધું રાજ; લા.  
 વળી નૃપતિ નિજ ૧અંગળ, મ. પરણું મહારાજ ! લા. ૮  
 એહવાં વયણો સાંભળી, મ. પૂછે કુમર વળી તાસ; લા.  
 તે દેશી કે પરદેશીએ, મ. છે કેહની તુમ આશ ? લા. ૯  
 નૃપ રચનુચરો એમ સાંભળી, મ. વળતું એદે એમ; લા.  
 હેઠા દેશી કે પરદેશી લખે, મ.

પણુ કરી આપે એમ. લા. ૧૦  
 ૩પટહ ષવાહક વચનો સુણ્ણી, મ.

પકડે પડહ તેણું વાર. લા.  
 તેહને નૃપ ૫અનુચરો લઈ, મ. આંધ્રા રાય દરખાર. લા. ૧૧  
 પથ પ્રણુભી ઉલો રહ્યો, મ. મહીધર કહે તેણું વાર; લા.  
 અહેં સજજન ! લખે આવીયા, મ.

ઝહારા રાજ સુઅાર. લા. ૧૨  
 સાળ કરશો કેમ કરી, મ. કુમરીની આંખો એહ ?; લા.  
 એમ સુણ્ણી લલિતાંગ તે, મ. મન ચિંતે ગુણુ ગેહ. લા. ૧૩  
 નૃપને ધર્મ પમાડવો, મ. નાસ્તિકવાહી જેહ; લા.  
 તે આડંખર વિષુ ઈહાં, મ. કામ ન થાએ એહ. લા. ૧૪  
 એમ વિચાર કરી તદા, મ. નૃપને તવ કહે એમ; લા;  
 મંત્ર બળો સાળ કરે, મ. તમે જો જો ધરીને પ્રેમ. લા. ૧૫  
 ભૂપતિઃ સાંભળીને કહે, મ. જલ્દી કરો તમે કામ; લા.  
 જે જેશો તે આપણું, મ. મન માન્યા લેજો ઊદામ. લા. ૧૬  
 હવે શ્રોતા તમે સાંભળો, મ. કાર્ય કરે જે કુમાર; લા.  
 આળસ નિદ્રા પરહરી, મ. વળી વિકથાને વાર. લા. ૧૭

---

૧ દીકરી. ૨-૫ સેવકો. ૩ પંહો-દંદ્રો. ૪ વગાડનાર ( જાહેરાત  
 કરનાર ) ૬ રાજ. ૭ પૈસા.

નિયતિહંસિ રસ્તુરિયાયનો, મ. કહે રામેંહુ ઉજમાળ; લા.  
આડમી દાળ પૂરી થઈ, મ. આગળ વાત રસાળ. લા. ૧૮  
દોહરા

ઉલ્લુધવ વયણો સાંભળો, કુંવર ચિંતે એમ;  
કૌતુક કરવો સહી છિંઠાં, થાએ સહુને પ્રેમ. ૧  
એમ વિચારીને કહે, ઈમહીય ! સુણો મુજ વાત;  
તુમચી પુત્રી કારણો, મંડપ રચવો તાત ! ૨  
અંદર કુંવરી એસાડીને, મંત્ર જયું હું સોય;  
શાંતિ જાપ જપતાં વચ્ચે, વાત ન કરશો કોય. ૩

### દાળ દ મી

[ એક દ્વિત્સ લંકાપતિ, કીડાની ઉપની રતિ-એ દેશી. ]

રાય મંડપ મંડાવીએા, કુંવરીને તિહાં લાવીએા;  
આવીએા, લવિતાંગને કહે ભૂપતિલ. ૧  
અહો સંજગન ! તમે સાંભળો, મનમાં ન રાખો આમળો;  
ઉતાવળો, કુંવરી સાળ કીળુએલ. ૨  
કુંવર કહે સુણો ભૂપ રે !, એહમાં નહિ કાંઈ પચુંપ રે;  
અનુપરે, કામ તમારું અટ કરું છુ. ૩  
લાવો કુંવરી આ સ્થાનમાં, પ્રેમ ધરી બહુ માનમાં;  
કહું સાનમાં, કામ તુમારું પછી કરુંલ. ૪  
કુમર કથનથી રાય એ, કુંવરીને સ્થાપે ઉચ્છાય રે;  
સુખ પાય રે, રાય પ્રમુખ એસે તિહાં છુ. ૫  
રાય કહે કુમારને, હવે મ લાવો વારને;  
કરો સારને, કુંવરી મંડપ આવી ગઈ છુ. ૬

૧ કર્મસિંહજીસ્વામી. ૨ આચાર્ય. ૩ રાજન. ૪ રાજ. ૫ આમી.

- તવ કુંવર કરે તૈયારીયો, સહુ જનને મન ભાવીયો;  
ઠાવીયો, ધ્યાન ધર્યું જિનરાજનું લુ. ૭
- એમ વખત જ ધણો પસારતો, મોટેથી મંત્ર ઉચ્ચારતો;  
સાંભારતો, અં હ્રી કુદ કુદ કરે તદી લુ. ૮
- એમ કરી કરી ઓષધિ લીધી, આગળ ને હેવીયે હીધી;  
કારજ સિદ્ધિ, તત્કષણ આંખે અંજન કરે લુ ૯
- રાય ધુઆને<sup>૧</sup> કહે કૃશ્યુ, સધળે નિરાયો છો કિશ્કું ?;  
છે જિશ્યું, આંખો ઘોલી જુઓ હુકે લુ. ૧૦
- એહવાં વયણો સાંલળી, મનમાંહે થઈ રંગરળી;  
પરવડી, કહે સધળું હેખું સહી લુ. ૧૧
- કુંવરી ઉડી ધાયને, પગે લાગી તવ રાયને;  
ઉમાયને,<sup>૨</sup> મનમાંહિ અતિ ગહુગાઈ લુ. ૧૨
- વળતું પૂછે ભૂપતિ, સધળી વાત કહે છતી;  
આણ્ણી રતિ, તુજ આંખે હવે ફેમ છે લુ ? ૧૩
- કરજેડી કુંવરી લાવે, સધળું હેખું ખું હવે;  
કહું સાવે, સુજ આંખે શાંતિ છે સહી લુ. ૧૪
- એમ સુણીને રાય રે, મનમાં અતિ ઉલ્કસાય રે;  
આય રે, નૃપે કુંવરનું શિર ચુંબીબું લુ. ૧૫
- રાયે મહોચ્છવ માંડીયો, જોખીને તેડાવીયો;  
ભાવીયો, લભ જુઓ પુત્રી તણું લુ. ૧૬
- જોખી જોખને જોઇ રે, કહે રાજને સોઈરે;  
હોઈ રે, આજજ હિન રળીયામણું લુ. ૧૭

૧ હાથમાં. ૨ દીકરીને. ૩ આનંદી ઉછળતા હૃદ્યવાળી. ૪  
ઉલ્કસાહ ધરીને. ૫ આનંદ પામીને. ૬ કહે.

- એમ સુણ્ણી તવ રાય રે, અતિ મનમાં હરખાય રે;  
લાય રે, પરણાવે પુત્રી ભણ્ણી જ. ૧૮
- નૃપ દે કન્યા દાન રે, વળી આપે સન્માન રે;  
સાન રે, અહંકું રાજ દીધું તદા જ. ૧૯
- એક મહોટો આવાસ રે, કરવાને તિહાં વાસ રે;  
આસ રે, દોગુંદક<sup>૧</sup> સુખ લોગવેજ. ૨૦
- હવે શ્રોતા ! તમે સાંલળોા, સજજન તણોા ને મામલોા;  
આમળોા, શું શું વીતક વીતીયાં જ ? ૨૧
- દાળ નવમી પૂરી થઈ, વાત હજુ અધૂરી રહી;  
એ કહી, રામચંદ્ર ઉલ્કાસથી જ. ૨૨

### દોહરા

લાલિતાંગ હવે અન્યદ્દા, જમીને લેવા આરામ;  
આવી બેઠો ગોખડે, નગરને જોવા જમ. ૧

ફરથી આવતો નિરખીયો, એક દુમક<sup>૨</sup> તે મગ;<sup>૩</sup>  
લીખ ઘરેબર માંગતો, ચાલતાં ફરૈ છે પગ. ૨

મોઢે માંખી બડખડે, માથે વધુટા<sup>૪</sup> કેશ;  
સાટિત<sup>૫</sup> વસ્ત્ર અંગે ધર્યાં, મહા કંગાલને વેશ. ૩

લાલિતાંગ મન ચિંતવે, કયાંક જોયો મેં એહ;  
વિવિધ વિચારો એમ કરી, તવ ઓળખીયો તેહ. ૪

દીશો છે સજજન સમો, કે કોઈ અવર એહ ?;  
માણુસને મૂકી કરી, તવ તેડાવે તેહ. ૫

ભૂત્ય<sup>૬</sup> તે સજજન તેડીને, આવે ધરીને પ્રેમ;  
મનમાંહિ તે ભીહતો, હવે કરવું મારે કેમ ?. ૬

૧ ધનદ્રના પુત્ર સ્થાને રહેલા દેવતી સમાન (સુખ). ૨ લીખારી.

૩ માર્ગમાં. ૪ વિખરાયકા. ૫ સડેનાં. ૬ સેવક.

દ્વાલિતાંગ પૂછે તદા, અહો સજજન ! સુણુ વાત;  
કયાંથી તું કહ્યાં આવીયો ?, કહે તારો અવદાત. ૭  
રે લાઈ ! તું ઓળખે, કે નવ ઓળખે સુજ ?;  
કરણેડી સજજન કહે, ઓળખું છું પ્રભુ ! તુજ.  
તમે મોટા છો રાજુયા, અવર ન જાણું કાંઈ;  
હવે કુંવર તે આપશો, ઓળખાણ નિજ આંઈ. ૮

### દાળ ૧૦ મી

[ હરીઆ મન લાગો—એ દેશી.]

તવ કુંવર કહે તેહને, મળીયા આપણે કયાંય રે ?;  
સજજન ! સુણુ વાણી.

કરણેડી વિનયે કહે, મળીયા ન આપણે કયાંય રે. સ. ૧  
તવ કુંવર કહે તેહને, એમ કેમ ભૂલે ભાત રે ! ?; સ.  
૨ ર તેડીને સવી કહી, ધૂરથી માંડી વાત રે.  
ઓહ ચરી<sup>૧</sup> સાંભળી કરી, મનમાં લાજ્યો તામ રે; સ.  
તવ કુંવર કહે તેહને, મત લાજો તુમે આમ રે. સ. ૩  
પણ વીતક જે તુમ તાણું, સઘળું ભાંખો સુજ રે; સ.  
સજજન કહે સુણુ સાહેબા !, સાંભળો મારી શુજ<sup>૨</sup> રે. સ. ૪  
તુમ કનેથી ચાલીને, હું ગયો વન સુઅર રે; સ.  
તિહાં કને લીલો મજ્યા, લૂંટવા લાગ્યા જે વાર રે. સ. ૫  
હું પણ તસ સામો થયો, મહારી વિચારી ન ખેંચ રે; સ.  
તવ તેમણે સુજ મારીને, ગાઢો બાંધ્યો ઘેંચ રે. સ. ૬  
માલ સર્વ તે લૂંટીને, નાશી ગયા સહુ તેહ રે; સ.  
વેદન લોગવતો અતિ, હુઃખે સઘળો દેહ રે. ૭

૧ કુકિકત. ૨ વાત.

એહવે તિહાં કને આવીયો, પથિક કોઈક એક રે; સ. ૮  
 હયા આણીને છોડીયો, નિરાશ થયો હું છેક રે. સ.  
 કામ ન થાએ સુજથી, લીખ મંગું ઘરણાર રે; સ.  
 ભમતાં ભમતાં આવીયો, તુમ પાસે ગુણું ધાર રે. સ. ૯  
 સંજળન ચરી એમ સાંલળી, બોલે કુમર ઉમાય રે; સ.  
 થનારે હતું તે સવી થયું, હવે વિચાર મ લાય રે. સ. ૧૦  
 એમ આખ્યાસન આપીને, હુકમ કિકરને<sup>૧</sup> કીધ રે; સ.  
 કેશ<sup>૨</sup> સમારી નવરાવીને, આભૂષણું<sup>૩</sup> તેને હીધ રે. સ. ૧૧  
 એમ કરી સન્માનથી, રાખે પોતાની પાસ રે; શ્રોતા.  
 પુષ્પવતી લક્ષ્મિતાંગને, કરનેડી કહે તાસ રે. સ્વામી. ૧૨  
 એક અરજ છે સુજ તણું, અવધારો મહારાજ ! રે; સ્વા.  
 એને પાસે નવ રાખીયે, રાખ્યે નિષ્ઠુશે કાજ રે. સ્વા. ૧૩  
 તે માટે કહું આપને, સુજ વિનાંતિ સ્વીકારા રે; સ્વા.  
 એનો દંગ ને રંગ તે, નવી લાગે છે સારો રે. સ્વા. ૧૪  
 નીતિ પણ એમજ કુથે, એહવાથી રહેલું ફર રે; સ્વા.  
 નો તુમને હોય વાલહોા, તો આપો દ્વય પ્રચૂર રે. સ્વા. ૧૫  
 એમ ધણું સમજાવીએ, તો પણ રાખે તાસ રે; સ્વા.  
 કેતાંએક દિન અનુક્ષ્યાં, વસતાં કુમરને વાસ રે. સ્વા. ૧૬  
 ઈષ્યાં વ્યાપી મન મહિં, લક્ષ્મિતાંગ તે સુખીયો અધારરે; ભવિ.  
 તેહવેા ઉપાય કરે ઈષ્ણાં, તે કેમ થાય ખુબાર રે. ભ. ૧૭  
 હવે શ્રોતા ! તમે સાંલળો, સંજળન ને કરે કામ રે; ભ.  
 હુજ્જન હુઃખ્યા જગતમાં, ન કરે સારાં કામ રે. ભવિ. ૧૮

૧ સેવકને. ૨ હળમત કરાવીને ૩ ધરેણું, દાગીના. ૪ કહે  
 છે. ૫ બણું.

દાળ દશમી પૂરી થઈ, નિયતિહરિ સુપ્સાય રે. ભવિ.  
રામચંદ્ર કહે આગળો, સાંલળો વાત ઉમાય રે. ભવિ. ૧૬

### દોહરા.

- એકદા સજજન આવીયો, ૧ નરવર તણી હળ્ળૂર;  
કરણોડી ઉલો રહ્યો, કરતો સેવ રસનૂર. ૧
- ૩ ધરણીધર પૂછે તદા, શ્યો તુમ કુમર સંબંધ ?;  
તેહ સવી મુજને કહો, તુમચો એહ પ્રબંધ. ૨
- નીસાસો નાંભી<sup>૧</sup> કહે, મુજને મ પૂછો એહ;  
મહારાથો કહેવાય નહિ, અમચી વાત છે જેહ. ૩
- ૪ મહીપાળ એમ સાંલળી, મનમાં થયો સશંક;  
આથડ સહ તવ પૂણીયું, તવ તે કહે નિઃથંક. ૪
- ૫ ધુરથી માંડી આપને, સાંલળાંનું મહારાજ !;  
તો પણ હજ તુમને કહું, મત પૂછો ૬ નરરાજ !. ૫
- પૂછે પસ્તાશો જરૂર, કરણોડી કહું એમ;  
જે થનાર હતું તે થયું, ભાવીએ હનીયું તેમ. ૬
- ૭ ભૂધવ હુઠ મૂકે નહિ, કહે તવ સજજન એમ;  
અતિ આથહે પૂછો તમે, તો સાંલળો ધરી ગ્રેમ. ૭
- વાસપતન પુરના અમે, એહું છીયે મહારાજ !;  
ત્યાં નરવાહન રાજ્યો, તેનો હું છું યુવરાજ. ૮
- વળી છે અમચા રાજમાં, ભૂતદિન ચંડાળ;  
કામ કરે છે રાજનો, એ છે તેહનો ખાળ. ૯
- મુજ ધરે નિત્ય આવતો, હું ધરતો તસ જ્યાર;  
દાન દેઈ સંતોષતો, રહેતો રાજ્ય મુગાર. ૧૦

૧-૩-૪-૬-૭ રાજ. ૨ ઉત્સાહથી. ૫ પહેલેથી.

રાજા પૂછે તેહને, તમે છોડ્યો કેમ દેશ ? ;  
તે સધગું સુજને કહો, તો એણે સુજ ૧થાં દેશ. ૧૧

૨કરકજ જોડીને કહે, સાંલળો મોારી વાત;  
જે કારણું હું નીદિયો, તે કહું તુમ ઉઅવદાત. ૧૨

હું હુમેશાં આપતો, દીન જનોને દાન;  
સુજને દેશવટો દીયો, તે કારણું રાજીન  
અમચી વીતી વાતડી, કહી સંભળાવી તુજ;  
તે કારણું રાજીન ! હુંએ, નવ ખોલો કાંઈ શું. ૧૪

યત :— દુર્જન : પ્રિય વાદી ચ, નૈતદ વિશ્વાસ કારણમ् ।  
મધુ તિલ્લતિ જિહ્વાયે, હૃદયે તુ હલાહલમ् ॥ ૧ ॥

### આંતર દોહરા

હુર્ઝન તજે ન હુષ્ટતા, સંજાન તજે ન હેત;  
કાજળ તજે ન શ્યામતા, પસુક્તા તજે ન દ્યેત. ૧  
અવગુની જન અવગુન થહે, છતા શુન છુપાય;  
માણી ચંદન કાગ દ્રાખ, જાંક્ષિ ઉંટ ન ખાય. ૨

### ઢાળ ૧૧ મી

[ આવોને નંદલાલ ! રમવા આવોને રે-એ દેશી. ]

વાણી સુણી નૃપતિ મન ચિંતે, જમાદ મૂરખ એહ એકાંતે;  
શિક્ષા દેવી ખંતે, દ્વિતિમાં દ્રેષી થયો રે.  
દ્રેષી થયો પુરનાથ, દ્વિતિમાં દ્રેષી થયો રે એ આંકણી. ૧  
જન ગણુને પાપીએ વંચ્યો, સુજને પણ એણું પરપંચ્યો;  
એહ પ્રપંચનો સંચ્યો, દ્વિતિમાં. ૨

૧ શંકા. ૨ હાથ રૂપી કમળ. ૩ હંકીકત. ૪ કાળારા. ૫ મોતી.  
૬ ધોળારા. ૭ શેલડી. ૮ હુંઝો. ૯ બંડાર.

હુદ્વાન ચિંતે મનમાં એમ, કોઈ ખખર નવ પામે જેમ;  
 ઉપાય કરવે તેમ, હિલમાં. ૩  
 ભૂનેતાર મન ચિંતવી એમ, તેડાવે ચંડાળ તે ટેમ;  
 વચન કહે તજુ રહેમ, હિલમાં. ૪  
 આજે મધ્ય રથખું સુઝાર, રાજ માર્ગ કોઈ આવે તે વાર;  
 તેહને હણુંને નિરધાર, હિલમાં. ૫  
 એહું વયણું સુણી ચંડાળ, નૃપની આણ ચડાવે ભાળ; ૬  
 વિસર્જ મહીપાળ, હિલમાં. ૬  
 એહું પાયે પિંડ લરીને, રાજ હિલમાં હર્ષ ધરીને;  
 ભુંકું એ કામ કરીને, હિલમાં. ૭  
 કૂટ્ય લેખ એક તૈયાર કીધો, રાજએ લૃત્યને હાથે દીધો;  
 તેહું પણ ગયો સીધો, હિલમાં. ૮  
 લેખ આપ્યો લલિતાંગને હાથ, એ લેખ આપ્યો છે અભૂતાથ;  
 કહે કુમરને લીડી ખાથ, હિલમાં. ૯  
 કોઈક કાર્ય ઉદેશી અનુપ, મધ્ય રથખુંને ઓલાવે ભૂપ;  
 તુમને આપ સમીપ, હિલમાં. ૧૦  
 હૂંપે દરવજને છાનાં આવહું, સાથે કોઈને નવ લાવહું;  
 એ છે ભૂપનું કહેલું, હિલમાં. ૧૧  
 રાયની આગળ જાવા કુમાર, સજજ થયો તવ ઓલે નાર;  
 સ્વામી! ચિત્ત વિચાર, હિલમાં. ૧૨  
 આ વખતે નૃપ પાસે જાતાં, આપણુંને ખહુ થાય અસાતા;  
 વિનંતિ માનો ત્રાતા!, હિલમાં. ૧૩

૧-૨-૭ રાજ. ૩ રત્ન. ૪ મરતકે-માથે, ૫ ઘોટા. ૬ સેવકને.  
 ૮ રક્ષણ કરનાર.

આ વખતે સજજનને સ્વામ !, નૃપ આગે મૂર્કો અલિરામ;  
તે કરશે તુમ કામ, દિવમાં. ૧૪  
લલના<sup>૧</sup> વયણે ભિત્ર બોલાવી, નૃપ આણુ એને સમજાવી;  
મૂર્કો તેને ન મટે લાવી, દિવમાં. ૧૫  
દાળ ધર્યારમી પૂરી થાએ, રામચંદ્ર મુનિ કહે ઉમાએ;  
નિયતિહરિ સુપસાએ, દિવમાં. ૧૬

### દોહરા

કુમર તણુ આદેશથી, સજજન ચાહ્યો તામ;  
વિવિધ વિચારો ઉદ્ભાવે, હુર્ઝન મનમાં આમ. ૧  
કાદે મેં નૃપ આગળે, કણી હતી જે વાત;  
તે કારણુ મુજ તેડીયો, ભૂપતિએ એકાંત. ૨  
શું શું કહેલું ત્યાં કને ?, મનશું કરે વિચાર;  
હવે લંલેદું રાયને, એમાં ન લાવું વાર. ૩  
કોધારણુરે રાજ થઈ, કરશે તેહની ધાત;  
મુજને આદર આપશે, થાશે ખહુ સુખ સાત. ૪  
રાજ રમણી એ મુજને, આપશે ધરી ણહુ ઘ્યાર;  
તિમું વળી ઉપકાર માહરો, માનશે નૃપ તે વાર. ૫  
હર્મતિ આગે ચાલીયો, હુસ ધરી મનમાંય;  
શ્રોતાજન ! હવે સાંલળો, મનમાં થછને ઉમાય. ૬

### દાળ ૧૨ મી

[ ગોકુળની ગોવાલણી, મહિ રેચવા આવે-એ દેશી. ]

સજજન આગે ચાલીયો, હુસ મનમાં ધરીને;  
રાજ મારગને એળંગીને, આવે ગુમ ક્ષાર તે. ૧

૧ સ્વી. ૨ કોધથી રાતો પીળો.

- કાર પ્રવેશ કરે યદા, ચંડણે શું કીધ ?; ૨  
 અસી<sup>૧</sup> હાથમાં લેઈ કરી, ગાડ પહૂરજ દીધ.  
 હૃષ લઈ મૃત્યુ તદા, રોક ધ્યાનને યોગે;  
 રત્નપ્રલાયે<sup>૨</sup> ઉપનેા, નિજ કર્મના લોગે. ૩  
 ક્ષેત્ર વેદના નરકની, દશધા<sup>૩</sup> અનુભવતો;  
 પરમાધામી તેહને, માર મારે તવ રોતો. ૪  
 ચંડણે તવ આવીને, નૃપને માથું ખતાવે;  
 તે હેણી બૂધવ<sup>૪</sup> તિહાં, મન આનંદ પાવે. ૫  
 કુમરે પ્રલાત સમય તદા, મિત્ર મુશ્મા જાણ્યા;  
 એદ થયો તેને ધણ્યો, સુખ પોદે એમ વાણ્યો. ૬  
 આ શું અધમાધમ કામ તે, રાખાએ કીધ ?;  
 તવ ત્રિય<sup>૫</sup> આવી કંતને, બોલે વચન પ્રસિદ્ધ. ૭  
 સ્વામી ! જો તમે જાત તો, થાતે ખહૂજ અકાંનો;  
 રાજ કાજ મેલા હુંવે, હુંવે હુશીયાર થાંનો. ૮  
 કુંવરજી એદ કરે ધણ્યો, મિત્ર મુશ્મા તે માટે;  
 લાર્તી<sup>૬</sup> પ્રત્યે તવ સા કહે, હુંવે એદ શા માટે ?.  
 પ્રલાત કણે નૃપે સાંખયયું, સાગરનના મરણનું; .  
 શિર ધૂણીને કહે રાજયી, શીશ છેદાણું ગુણીનું. ૧૦  
 જામાતા<sup>૭</sup> મુજ વૈરી તે, ન મુશ્મા હજ ઓહ;  
 તો હવે પ્રગટ પણ્યો સહી, મારનો મહારે તેહ. ૧૧  
 એમ ધારીને નરપતિ, સેના કીધી તૈયાર;  
 બુંગળ લેરી વાજતી, સાંખણે મંત્રી તે વાર. ૧૨

૧ તરવાર. ૨ પહેલી નરક. ૩ દશ પ્રકારે. ૪ રાજ. ૫ ઝી.

૬ પતિ ૭ જમાઈ.

|                                                                 |    |
|-----------------------------------------------------------------|----|
| મહીપતિ <sup>૧</sup> પાસે આવીને, પૂછે તવ કરણોડી;                 |    |
| કેના ઉપરે પ્રભુ ! તમે, ચાલ્યા રથને જોડી ?.                      | ૧૩ |
| મંત્રીને તવ નૃપ કહે, જામાતા અવદાત;                              |    |
| વળી પૂછે તે રાયને, કોણું કીધી એ વાત ?.                          | ૧૪ |
| મહીપાળ <sup>૨</sup> કહે અમાત્યને, <sup>૩</sup> સંજગને વાત કીધી; |    |
| સચિવ <sup>૪</sup> સુણ્ણી નૃપને કહે, વાત એ નહિ સીધી.             | ૧૫ |
| એમાં કંઈ કારણું હશે, સ્વામી ! મન આલોચો;                         |    |
| સંજગન તો હુર્જન સમેા, એણું ધાર્યો તુમ ઘોંચો. ૧૬                 |    |
| વિવિધ પ્રકારે રાયને, મંત્રીએ સમજાવ્યો;                          |    |
| રહીયાણો રઠ મૂકે નહિ, પ્રધાન કંઈ ન ઝોંચો. ૧૭                     |    |
| વળી મંત્રી <sup>૫</sup> નૃપને એમ કહે, જે હોય હુકમ તુમારો;       |    |
| પૂંઠી આવું જામાતને, થાય નિશ્ચય સારો. ૧૮                         |    |
| અમાત્ય ચલાવી આવીયો, લલિતાંગને દ્રાર;                            |    |
| શીશ નામીને વીનવે, સ્વામી ! અરજી સ્વીકાર. ૧૯                     |    |
| નૃપને સંજગને લોળવ્યો, તેથી થયો ઉત્પાત;                          |    |
| રાણને સમજાવવા, કહો તુમ અવદાત. ૨૦                                |    |
| ગ્રટકીને કુંવર કહે, ભાજી પૂછો કાં જાત ?;                        |    |
| રણ મેદાનમાં આવજો, ત્યારે જણ્યાશે નાત. ૨૧                        |    |
| મંત્રીશર વળતું કહે, તમે ધરમી પ્રાણી;                            |    |
| માણુસ મરશો સંચામમાં, એહથી કાં વદો વાણી ?. ૨૨                    |    |
| કુંવરે કંઈ કણી નહિ, પોતાની તવ વાત;                              |    |
| પુષ્પવતીને પૂછીયો, લલિતાંગ અવદાત. ૨૩                            |    |
| અથથી માંડીને કહો, કુંવરનો વૃત્તાંત;                             |    |
| એહ સુણ્ણી રાજી થઈ, રાય પાસે આયાત. ૨૪                            |    |

૧-૨ ગુણ. ૩-૪-૫ પ્રધાન.

|                                             |    |
|---------------------------------------------|----|
| ધૂરથી માંડીને ખાંધી, નૃપને વાત કીધી;        |    |
| એહુ સુણ્ઠિને રાણ્યો, મન જણ્ણુ એ સીધી.       | ૨૫ |
| મંત્રીને પૂછે યદા, હવે કુરતું કેમ ?;        |    |
| અમાત્ય તદા નૃપને કહે, વાત સુણો ધરી પ્રેમ    | ૨૬ |
| શ્રીવાસ નગરે ચર્ચ મોકલી, તિહાં પૂછા કરાવો;  |    |
| તો માહિતી સધળી મળો, ગમ્ય તિહાં લગે આવો.     | ૨૭ |
| ભૂધવે ભૂત્યો મોકલ્યા, નૃપ નરવાહન પાસે;      |    |
| મંત્રીશરી પણ આવીને, પ્રણુમે ઉદ્દાસે.        | ૨૮ |
| રાયને સધળો પૂછીયો, કુંવરનો અવહાત;           |    |
| વળતું મંત્રીને નૃપ કહે, લલિતાંગ મુજ જાત.    | ૨૯ |
| સુરદાલિધ મુજ ભૂત્યો છે, સાજજન તેહનો કુમારો; |    |
| અમાત્યો ચરી એહુ સાંલળી, થયા રાણુ અપારો.     | ૩૦ |
| સત્કારી મંત્રીશરી, દધ ઉતારા સાર;            |    |
| નિજ પ્રધાનને તેડીને, કહે તેણી વાર.          | ૩૧ |
| જાયો તમે વેગે તિહાં, તેડી લાવો કુમરને;      |    |
| નજરે દેખીશ તો થશો, સુખ મુજ અંતરને.          | ૩૨ |
| ધારમી દાળ પૂરી થઈ, નિયતિહરિ સુપસાય;         |    |
| રામચંદ્ર મુનિ કહે હવે, સાંલળો સહુ ભાય !.    | ૩૩ |

### દોહરા

|                                        |   |
|----------------------------------------|---|
| મંત્રી સાંલળી હરખીયો, મળી કુંવરની ભાળ; |   |
| અહોલાંગ અમારડો, હવે સહું જશો જંબળ.     | ૧ |
| સચિવો ત્યાંથી ચાકીયા, સાથે દૈઘ પરિવાર; |   |
| અનુકુમે તિહાં આવીયા, કુંચનપુરને દ્વાર. | ૨ |

૧-૩ સેવક. ૨ સખુર રાખો. ૪ નોકર.

|                                           |    |
|-------------------------------------------|----|
| જઇ સલામાં પ્રણુભીયો, ભૂધવને ધરી ખ્યાર;    |    |
| બેટણું આગળ મૂકીને, કર જોહયા તે વાર.       | ૩  |
| શિર નામી કહે ભૂપને, નરવાન કદ્યા જુહાર;    |    |
| અમચા કુંવરને સાચવી, સુજ પર કર્યો ઉપકાર.   | ૪  |
| જિતશનુ આદર હઈ, આસન આપે તામ;               |    |
| કુશળાલાપ પૂછી કરી, હરખ્યો મનમાં આમ.       | ૫  |
| ભૂપે કુમરને તેડીયો, આદર સહ તેણી વાર;      |    |
| દાલિતાંગ પણ આવીને, નૃપને કરે જુહાર.       | ૬  |
| ભૂપ કુંવરને અમાવતો, મનમાં ધરી ખહુ ખ્યાર;  |    |
| સુજને સજજને લોળન્યો, હું થયો મૂઢ ગમાર.    | ૭  |
| કરજોડી કુંવર કહે, તુમચો ઈંડાં નહિ દોષ;    |    |
| ઘૂર્વ કર્મ સંયોગથી, પ્રાણી લહે હુઃખ રનેસ. | ૮  |
| દોકો સહુ હર્ષિત થયા, સમી ગયો નૃપ દેષ;     |    |
| સચિવ કહે તવ ભૂપને, હવે જશું અમ હેશ.       | ૯  |
| તુમચા જમાધંને પ્રલુ !, શીખ હીયો અમ સાથ;   |    |
| વાટલડી જોતો હશે, કુમરની અમચો નાથ.         | ૧૦ |

### દાણ નૃત મી

[ ધારણી મનાવે રે મેધ કુમારને રે-એ દેશી. ]

ભૂધવ ચિંતવે મનમાં એણું પરે રે, હવે મહારે કરણું કેમ ?;  
જીમાતા ઈંડાં નહિ રાખતાં રે, જશે ધરે ધરો પ્રેમ.

સાંલળજો લવી ! ઈંડાં શું નીપજે રે ?.

એમ વિચાર કરીને નિજ મને રે, ૪પભણે સર્વને તામ;  
જીમાતાને જવા નહિ દઉં રે, એ વિષુ નહિ આરામ. સાં. ૨

૧ એમકુશળનો વાત. ૨ અત્યંત. ૩ જમાધ. ૪ કહે.

કરનોડીને સચિવ એમ વીનવે રે, સાચી તુમચી ૧વાય;  
પણ અમ સ્વામી ૨તતુજ વિષુ હુંખ ધરે રે,

૩કુમર વિષુ જીવે ન રાય. સાં. ૩  
ઇષુ વિધ વાતો પરસ્પર તે કરે રે, તવ વન પાળક આય;  
કરનોડી ભૂધવને એમ કહે રે, સ્વામી ! સુણો મોરી વાય. ૪  
તુમચા બાગમાં પદ્માકર સુનિ રે, સમવસર્યા છે રાય !;  
એહેવાં વચન સુણો ૫પ્રકૃતિલિત થયો રે,

નૃય મન હુરખ ન આય. સાં. ૫  
વનપાળકને આપી વધામણી રે, વંદ્ન કરવા આય;  
ગુરુ પદ પ્રણભી બેઠો સન્નસુણે રે, ૬કરકજ નોડી રાય. સાં. ૬  
લાલ્ય જનોને ધર્મ પમાડવા રે, હીએ મુનિવર ઉપહેથ;  
આચુ અસ્થિર ગત સમય ન સાંપડે રે, ધર્મ કરો ગત ક્રેપ. ૭  
એમ વિવિધ હીધી ગુરુ દેશના રે, સાંકળીને તિહાં રાય;  
વૈરાગ્ય વાસિત મન ભૂધવ થયો રે, ગુરુના પ્રણભી પાય. સાં. ૮  
હું પાછો આંહી આવું નહિ રે, તિહાં લગે રહો હિંણ હાય;  
રાજ્ય વ્યવસ્થા કરીને આવશું રે, લેશું સંયમ તાય !. સાં ૯  
ગુરુ કહે ૫અહાસુહું દેવાણુભિયા રે !, જેમ તુમને સુખ થાય;  
વંદ્ન કરીને તિહાંથી ચાલીયો રે, નગરમાં આવ્યો રાય. ૧૦  
મહોચચ્છ કરીને નિજ રાજ આપીયું રે, જમાઈને તેણી વાર;  
સંજમ લઈ કરણી કરી આકરી રે, ઘોંબ્યો મોક્ષ સુઅર. ૧૧  
સચિવને રાન્ય લળાવી સપ્રેમથી રે, કુમર ચલ્યો નિજ ગપમ;  
અનુકૂળે ચાલતાં આવ્યા નિજ પુરી રે,  
૬ખર થઈ નૃપને તામ. સાં. ૧૨

૧ વાણી-વચન. ૨ દીકરો. ૩ રાજ--દુર્ઘટ પામ્યો. ૪ હાથરૂપી  
કમળ. ૫ જેમ સુખ ઉપજે તેમ કરો

નગર શાણુગારો સામૈયું કરે રે, પુત્ર પિતા મહ્યા તામ;  
 હુર્ધાશ્રુ વડે સુતને નવરાવતો રે, આવે રાજ્યમાં આમ. ૧૩  
 લલિતાંગ આવ્યો માતાજી કને રે, પ્રહમે તેહનાં પાય;  
 પુત્રને હેખી રે નથને આંસુ અરે રે, મનમાં હરખ ન માય. ૧૪  
 નિયતિહંરિ શુદ્ધરાજ પસાયથી રે, પૂરણ તેરમી દાળ;  
 રામેંદુ કહે લવિયણુ ! સાંભળો રે, આગળ વાત રસાળ ૧૫.

### દોહરા

ભૂપતિ મનમાં ચિત્તવે, લેવો સંજમ લાર;  
 એમ રાખોચે ચિત્તમાં, રાજ્ય હેણું કુમાર. ૧  
 એહવે ત્યાં કને આખોયો, વનપાળક તેણી વાર;  
 કર જોડી નૃપને કહે, આપું વધાઈ સાર. ૨  
 ગુણુરીલ નામે ઉદ્ઘાનમાં, ઉસમવસર્યા સુનિરાય;  
 એહવાં વયણો સાંભળી, મનમાં હરખ ન માય. ૩

### દાળ ૧૪ મા

[ દેશી રસીયાની. ]

શ્રીવાસપુરે એહવે મુનિ આવીઆ,  
 ધર્મવોષ અણુગાર; ચતુર નર !

રાય સુણું શુદ્ધવંદન ચાલીથો,

ધરતો હરખ અપાર. ચતુર નર !

નિસુણો સાજન ! સુનિવર હેશના. ૧

૪ હુય ૫ ગાય રથ ૬ પાયકને લઈ કરી, અંતે ઉરશું ભાય; ચ.  
 જઈને વાંદા સુનિવર ભાવણું, કર્મના મળને ધોય ચ નિ. ૨

૧ રામચંદ્ર. ૨ વિચારે. ૩ આગીને બિરાજયા. ૪ ધોડાનું લશકર.

૫. હાથીનું લશકર. ૬ પગપાળા માણુસોનું લશકર.

એમ કરી એઠો શુરૂ સન્મુચ્ચે, દેશના હિયે મુનિરાજ; ચ.  
આ સંસાર અતિ હુઃખથી લાર્યો, ધર્મ કરે તુમે આજ. ત  
આથુ અસ્થિર કહું જિનરાજજી, તળુયે પાપ વિચાર. ચ.  
જરા રાક્ષસી આવતાં જલને, સ્હાય ન કોઈ થનાર. ૪

રમણી<sup>૧</sup> સુતના\* મોહમાં જન કુસ્યા, સંચે પાપ અપાર;  
લોગવતાં કડવા વિયાઠને, આશો જમનો માર. ચ. નિ. ૫  
રચકી તહરિ છહર નારહ રામજી, ધંડ અને જિનરાય; ચ.  
આથુ પૂર્ણ સહુ ચાલ્યા ગયા, ડોષુ રંક ડોષુ રાય?. ૬

ઉંગે તે તો અસ્તા થવા લાણી, જન્મે તેનો રે નાશ; ચ.  
ક્ષણુ ક્ષણુ આયુષ્ય ઘટતું જથ છે, ત્યાગો હવે મોહ પાશ. ૭  
એમ સમજુને ધર્મ કરણી કરેલા, જે જવ તરણી<sup>૮</sup> ગણ્યાય;  
એક ટેકથી ધર્મ આરાધતાં, શાશ્વતું સુખ પમાય. ચ. નિ. ૮

એમ સુષોધ સુણી અણુગારનો, ખૂબ્યા ખહુ નર નાર. ચ.  
હેશના અંતે પૂછે નરપતિ, સુત પૂરવ જવ સાર. ચ. નિ. ૯  
શુરૂ કહે હેવાનુપ્રિય ! સાંભળો, કહું તેહનો અવહાત; ચ.  
ચહું નાણી મુનિવરજી પ્રકાશતા, ગત લર્ની જે વાત. ચ. ૧૦

જંખુદીપે ભારહવાસમાં,<sup>૧૦</sup> હેશ ભગધ મનોહાર; ચ  
શાલીઓમે શેઠ સુદત વસે, ણહુલો તસ્ પરિવાર. ચ. ૧૧  
ધર્મધર્મ<sup>૧૧</sup> ન જાળો શેઠ તે, લક્ષાલક્ષ<sup>૧૨</sup> ન લક્ષ;<sup>૧૩</sup> ચ.  
ચૌવન ધનનો મહ ધણો હેઠમાં, પણ થઈ વર્તો દક્ષ.<sup>૧૦</sup> ચ. ૧૨

૧ સ્વી. ૨ ચક્રવર્તી. ૩ વાસુદેવ-શ્રી કૃષ્ણ. ૪ શાંકર મહાહેવ.  
૫ સંસાર રૂપ સમુદ્રને વિષે નાવા-ન્હાયુ સમાન. ૬ આરત ક્ષેત્રમાં.  
૭ ધર્મ અને અધર્મ ૮ અક્ષ્ય-આવા લાયક અને અલક્ષ્ય નહિ ખારા  
યોગ્ય. ૯ લાન. ૧૦ ઉદ્ધારણુ સહિત. \* મુંદર શરીર વાળી.

એકદા એક સેવકના હાથથી, લક્ષપાડતું ઠામ; ચ.  
 કૃટયું તવ રૂઢો તે ઉપરે, કોધ અતિ ધણ્ણા પામ. ચ. ૧૩  
 વેરે આંધળા ! આંખ શું નીકળી ?, ખરે ખપોરે આજ; ચ.  
 બહુ મૂલું એ તેવતું પાત્ર ને, આંજયું અધમ ! ગત લાજ. ૧૪  
 એમ કલુપ વચને અતિ તર્જિયો, દાસ થયો લય લીત; ચ.  
 દીન વદને કહે ચૂકયો શેઠણ !, હવે નવ ભૂલું ખચીત. ચ. ૧૫  
 મારુ કરો અપરાધ એ માહરો, અજહાતા છો દ્યાળ !; ચ.  
 ઝરી શુન્હો ન કરીશ હું એહવો, કરણું કરો કૃપાળ ! ચ. ૧૬  
 એમ વિવિધ વચને સમજાવીયો, પણ નવ ઉત્તરે રોષ; ચ.  
 તર અનુચ્ચર<sup>૧</sup> ધર છોડી નીકળ્યો, રોષનો કરી મને પોષ ૧૭  
 તાપસ થઈ કરણ્ણું કરી ઉપનો, સેજજન સેવક પુતા; ચ  
 વૈર ણંધાણું તૈત્ત નિમિત્તથી, કર્મ ગતિ અફલુત. ચ. ૧૮  
 વૈરનો ણંધ પડ્યો અતિ આકરો, સુદત દાસનો એમ; ચ.  
 વૈર ના આંધગો કોઈથી પ્રાણીયા !, ભવજળ તરીયે નેમ. ચ. ૧૯  
 એકદા સુદતને મળીયા સહશુર, ધર્મચશા અણુગાર; ચ.  
 બૂઝી ધર્મ અંગી કર્યો ભાવથી, પાળતો શ્રાધાચાર.<sup>૨</sup>. ચ. ૨૦  
 આણું શ્રી જિનરાજની પાળીને, સરળપણે કરી કાળ; ચ.  
 તહારે ધરે સુત પણે તે અવતર્યો, લાલિતાંગ એ ખાળ. ચ. ૨૧  
 પૂર્વ લવની સુણ્ણી એમ વાતડી, ચિંતે એમ નરનાર; ચ.  
 વચને કર્મ બાંધ્યાં ને તે લદે, તે લોગ્યંધાં આ વાર. ચ. ૨૨  
 તે લાણ્ણી વચન વિચારી ઓલવાં, નેમ નવ લાગે કર્મ; ચ.  
 વૈર વિરોધ વાધે નહિ તિમ વળી, આતમ હોવે સધર્મ. ચ. ૨૩  
 પરસ્પરે કરે આમણું સહુ મળી, શુદ્ધ મને ગુરુ શાંખ; ચ.  
 રામચંદ્ર મુનિયે કહી ચૌદમી, નિસુણો મન સ્થિર રાખ. ચ. ૨૪

૧ સેવક. ૨ શ્રાવકનો આચાર.

## દોહરા

૧ સુધા રેબરણુ સમ હેથના, નિસુણીને નર નાથ;  
આરિત્ર લેવા ઉમહ્યો, છોડી સંઘળો સાથ. ૧

રાજ્યપાટ દઈ કુમરને, આણુ લઈ પરિવાર;  
રાન ગંભી વૈરાગ્યથી, ભૂપ થયા અણુગાર. ૨

પરસંસે સહુ પુરજનો, ધન્ય ધન્ય વૈરાગ્ય !!!;  
છતી ઇદ્ધિને ત્યાળીને, સંયમી થયા મહાલાગ્ય. ૩

નમી સ્તવી ઇષિરાજને, કુમરને પુરના લોક;  
આણ્યા સહુ નિજ નિજ ધરે, શુણુ ગાતા પુણ્યશૈખો. ૪

રાજ્યદ્ધિ શુરૂ પસંનિધી, મહીયત કરે વિહાર;  
શુદ્ધ સંયમ પાળતા, આતમને હિતકાર. ૫

સ્વદ્ધં પ્રત્રજાયા પાળીને, કરી સંદેખણુ સાર;  
આરાધન શુદ્ધિ કરી, જોંચ્યા મોક્ષ મુખાર. ૬

## દાણ ૧૫ મી

[ ધન ધન સાચો સંપ્રતિ રાજીએ દેશી. ]

દ્વાલિતાંત્ર રાજી હુવે સુખ તાજા, લોગવે પુણ્ય સંયોગળુ;  
દ્વાયા પડહ વજડાવે રાજ્યે, ટાળે વ્યસન અયોગ લુ. ધ. ૧

ધન ધન ને નર ધર્મ આરાધે, સાધે આતમ કામળુ;  
આ લવ પર લવ તો જન સુખિયા, પામે સુખ આરામ લુ. ૨

ધર્મના સાધન ધર્મિ જનને, પૂરા પાડે રાય લુ;  
સાથ આપવા ધર્મિ જનને, તન મન ધન ઉમાય લુ. ધ. ૩

ધર્મનાં ધામ ધગસથી બંધાવે, સેવે ગુરુજન પાય લુ.  
દાન સુપાત્રે આપે લાવે, શુણુજનના શુણુ ગાય લુ. ધ. ૪

૧ અમૃતનો. ૨ વૈરાયો. ૩ ઉત્કંઠાવાળો થયો. ૪ પરિત્ર-  
નિર્ભળ કીર્તિવાળાના. ૫ પાસે. ૬ પૃથ્વી ઉપર. ૭ દીક્ષા. ૮ પાપ-  
દોષના પદ્ધાતાપ પૂર્વક પ્રાયશ્ચિત લઈને.

ધર્મ પુષ્ટયનાં વિવિધ કામ એમ, કરતાં ગાળે કાળ છુ; ૧  
 રાજી જેહવી થાય પ્રગત પણુ, શાસ્ત્ર વચ્ચન એ ભાળ છુ. ૨  
 લોગ કર્મનો અંત લહી નૃપ, ચિંતે લડાં ચારિત્ર છુ; ૩  
 મોક્ષ માર્ગનું કરી આરાધન, નરભવ કરું પવિત્ર છુ. ૪  
 નરકેશરી નિજ પુત્રને આપે, રાજ્ય પાટ નર નાથ છુ; ૫  
 નિવૃત્તિ મેળવી શાંત ચિત્તથી, સંભારે જગ નાથ છુ. ૬  
 છતા લોગ ને છતી શક્તિએ, છોડે તેહને ધન્ય છુ!; ૭  
 અછતા પણ ત્યાગે કો વિરલા, ત્યાગી વૈરાગી મન્યો છુ. ૮  
 એહવે તે પુરના વન માંણે, ધર્મયથા અણુગાર છુ; ૯  
 આવ્યા લાભ્ય લભ્ય જનોને, દર્શન જસ સુણ કાર છુ. ૧૦  
 મુનિ આગમ શ્રવણે સુણ્ણી નરવર,<sup>૧</sup> રંજિત થઈ નરરાય છુ; ૧૧  
 અતિશય ભાવે વંદન આવે, પુરજન સહુ વન માંય છુ ૧૧  
 લક્ષ્મિ લર સહુ વંદન કરીને, યોડા મુનિવર પાસ છુ; ૧૨  
 અમૃત સમ દેશન ચુડ આપે, નિસુણે સહુ ઉદ્વાસ છુ. ૧૨  
 ભો ભંઘો ! શ્રી જિનવર ભાંઘે, દુવિધ થાંતિમય ધર્મ છુ; ૧૩  
 શ્રાવક સાધુપણુનો રૂડા, પાણતાં નિગમે<sup>૨</sup> કર્મ છુ. ૧૩  
 શક્તિ અનુસારે વ્રત પાણો, ટાળો અસત્ય આચાર છુ; ૧૪  
 મરણ તણુ લય મન મતિ આણો. વ્યસન કરો પરિહાર છુ. ૧૪  
 ધ્રત્યાદિક ઉપદેશ સુખુનીને, સમજ્યા બહુદ્વા જીવ છુ; ૧૫  
 વ્રત પદ્ધતિભાણુ ધણું જન વૈવે, વિનયથી પામીયે<sup>૩</sup> શિવ છુ. ૧૫  
 લાલિતાંગ નૃપતિ સુણ્ણી દેશના, ચઢી ભાવની નાવ છુ; ૧૬  
 તત્પર થયો સંયમ લેવાને, પામી ઉત્તમ દાવ છુ. ૧૬  
 ગુરુવર નમી ધર આવી કુમરને, રાજ્ય ઠવી તત્કાળ છુ; ૧૭  
 પરમ વૈરાગ્યે દીક્ષા લીધી, સિંહ પરે ઉજમાળ છુ. ૧૭  
 પુત્રાદિક વાંદી ધર આભ્યા, કરતા મુનિ ગુણુ થામ છુ; ૧૮  
 ગુરુ પણ વિચયર્યી મહી મંડળમાં, આત્મિક પદ્ધતીરામ છુ. ૧૮

૧ ત્યાગી, વૈરાગી મનાતા. ૨ રોજ. ૩ ખપાને. ૪ મોક્ષ. ૫  
 આત્મા સંખ્યા ધર્મદ્વિપ અગીયા સરખા.

અંગ ઈંગયારે પૂરણુ શીખ્યા, વિનયે શુદ્ધવર પાસ છુ;  
 મુનિની કરણી કરે ભવ તરણી, કરતા આતમ પ્રકાશ છ. ૧૮  
 તપ જપ સંયમ નિર્મળ પાળી, અંતે અણુસણુ સાધ છુ;  
 બારમે સ્વર્ગે નિર્જરી<sup>૧</sup> થઈને, લોગવે સુખ આણાધ છ. ૧૯  
 આવીશ અયરતું<sup>૨</sup> આયુ લોગવી, મહો વિદેષ ઉપજંત છ;  
 સફળા સંગે સંયમ આદરી, નિવૃત્તિ<sup>૩</sup> પદ પામંત છ. ૨૦  
 નમો નમો એહવા મુનિ જનને, નમતાં પાતિક જાય છ;  
 કથા સુણીને ગુણી જનોની, મંગળ માળા થાય છ. ૨૧  
 ગૃહવાસે પણ રહ્યા ધર્મ દઠ, ન તજુ ધર્મની ટેક છ;  
 એહવી દઠતા ધર્મની પાળે, તે લાઘોમાં એક છ. ૨૨  
 એહ કથા નિસુણી નર નારી, ધરને હુદ્ધય મુજાર છ;  
 ધર્મ નિયમ નિધાએ<sup>૪</sup> પાળો, થાશે સંકુળ અવતાર છ. ૨૩  
 કથા મહોંધિ થંથથી ઉદ્ધરી, એહ કથ્યો સંધંધજુ;  
 ભીયજનોને સદ્ગોધ કારી, રચિયો એહ પ્રમંધ છ. ૨૪  
 સાધુ સમાજે આચારજ વર, કુર્મસિંહ ગુર રાય છ;  
 તે શુદ્ધના સુપસાયે કીધી, એ કવિતા સુખ દાય છ. ૨૫  
 "નલ" વસુ નિધિ<sup>૫</sup> શરી સાલે સોહે, <sup>૬</sup>મધુ માસ મનોહાર છ;  
 વીર જ્યાંતી દિંદુ વારે, ગામ લોગાય મુજાર છ. ધન. ૨૬  
 પંદરમી ટાળે રંગરસાળે, પૂર્ણ થયો અધિકાર છ;  
 રામચંદ્ર કહે શ્રોતાને ધરે, હેઠલે જ્ય જ્યકાર છ. ધ. ૨૭  
 અમૃદર્શન દિગિરિ દ્વારિ<sup>૭</sup> શરી કુરતા, જ્યોતિષચક હમેશજુ;  
 એહ કથા સ્થિર રહેને ત્યાં લગ્ન, વિશ્વમાંહે સુવિગ્રહ. છ. ૨૮  
 ધતિ શ્રી લલિતાંગ કુમારનો રાસ સમાપ્ત:

૧ દેવ. ૨ સાગનેપમતું. ૩ મોક્ષપદ. ૪ દદ મનથી. ૫ ચૈત્ર.  
 ૬ સોમવાર. ૭ મેરુ. ૮ પર્વત. ૯ સૂર્ય. ૧૦ ચંદ્ર.



શાસન સમ્માટ આ.ભ.

શ્રી વિજય નેમિસૂરિશરજી મ.સા. નાં શિષ્યરત્ન  
પ.પુ.આ.ભ. શ્રી પદ્મસૂરિ ગ્રંથાલય  
દાદા સાહેબ, બાવનગર

|  |  |  |
|--|--|--|
|  |  |  |
|  |  |  |
|  |  |  |
|  |  |  |
|  |  |  |



૨૧૦ આચાર્યશ્રી કર્મસિંહણ સ્વામી શાસ્ત્રમાળા  
પ્રગટ થયેલા ભણકાયોની યા

- ૧ સામાયિક સુત્ર મૂળ અર્થ અને  
વિવેચન સંખ. ૫-૬
૨. વૈન સમાચાર ગઘાવલી  
ખંડ ૪-૬
- ૩ સદર ખંડ ૭-૮
- ૪ સુમન સંચય
- ૫ શુદ્ધસ્તવના અને સહાય
- ૬ સામાયિક પ્રતિક્રમણ મૂળ
- ૭ તપસ્વી તલકષ્ણી સ્વામીનું  
જીવનવિતાંત
- ૮ પ્રતિક્રમણ સ્પષ્ટીકરણ
- ૯ શ્રી વૈન સંજાય સંખ  
ભાગ ૧ લો
- ૧૦ સદર ભાગ ૨ લો
- ૧૧ સદર ભાગ ૩ લો
- ૧૨ સામાયિક પ્રતિક્રમણ સાર્થ
- ૧૩ શુદ્ધસ્તવના અને આવિકા કર્ત્તાંય
- ૧૪ આવિકા સુષોધમાળા ભા. ૧ લો
- ૧૫ સંજાય સંખ ભાગ ૪ યો
- ૧૬ શુદ્ધસ્તવના
- ૧૭ શ્રી દાનવીર ધર્મધાળનો રાસ
- ૧૮ આવિકા સુષોધમાળા ભા. ૨ લો

- ૧૮ ચંપદ્રમ
- ૨૦ ચંપદ્રમ
- ૨૧ અનાથી
- ૨૨ દરિકશી મુન ચારત્ર સંસ્કૃત
- ૨૩ ગહુંલી સંખ ભાગ ૧ લો
- ૨૪ સનતુમારનો રાસ
- ૨૫ ગહુંલી સંખ ભાગ ૨ લો
- ૨૬ આવદ્ર વત દર્પણુ
- ૨૭ લુવન સુદ્ધરીનો રાસ
- ૨૮ તિલોદ સુદ્ધરીનો રાસ
- ૨૯ પુરંદર કુમારનો રાસ
- ૩૦ સુમિત્ર નૃપનો રાસ
- ૩૧ સહાય માળા મૂળ છાચા  
અને આર્થ
- ૩૨ વૈન સંવાદ રત્નમાળા
- ૩૩ સુલસા સતીનો રાસ
- ૩૪ કેનકસેના સતીનો રાસ
- ૩૫ ધનવતી સતીનો રાસ
- ૩૬ તરંગવતી સતીનો રાસ
- ૩૭ અમરદાત કરતૂરી સતીનો રાસ
- ૩૮ લલિતાંગ કુમરનો રાસ